

# विडंगा

पक्षीनिरीक्षको वच्चेनो सेतु

१५-२, अंकुर

जुलाई - सप्टेम्बर, २००६

[भास्कर : ३१. २०/-]



वार्षा २००६



# સૂચિ

ખંડોનું ખગમંડળ	૪
વિહંગાવલોકન	૬
નિરોક્ષણ નોંધ	૭
ગીધ પર જાપતો	૨૧
પત્ર-સેતુ	૨૪
ઉત્તર ગુજરાતનાં જળાશયો-૪	૨૬
પદ્ધીઓનાં સ્થાનિક નામો	૨૮
છાંચડો વાવું છું	૩૨
બીજના એકોક્રિકરણ દ્વારા સંવર્ધન	૩૩
બીજાંકુદુરાં પક્ષીઓનો જીવા	૩૫
પક્ષી માટે વૃક્ષ, વૃક્ષ માટે પક્ષી	૩૭
નળસરોવર કાયરી	૪૦

## ગુખપુષ્ટ :

વૃક્ષજ્ઞા અથવા  
તસવીર: મનોજ ધોળકિયા

# કંપાદકીય

આપે આમલીનું ઘેઘુર વૃક્ષ છેલ્લે ક્યારે જોયું? એતું વૃક્ષ કે જ્યાં હાથ લાગે તો બે કાતરા પાડી લેવાનું કે બે કૂઝી કૂપોણો ચાવી લેવાનું મન થાય! ક્યારેક દૂરના વિસ્તારોમાં ગાડી લઈને જઈએ ત્યારે રાજ રજવાડા વખતમાં વાવેલાં આમલીનાં વિશાળ વૃક્ષોની હાર, રસ્તાની બને બાજુએ આપણું સ્વાગત કરતી દશ્યમાન થાય અને વિસ્તય તથા અહોભાવથી છલકાઈ જવાય! પચાસથી સો વર્ષ પહેલાં વવાયેલાં એ ઝાડ, તેમના પ્રત્યે દર્શાવાયેલ ભાવ અને કાળજીની જીવતીજીગતી છબી બનીને ઊભાં હોય. કેવા સંજોગોમાં વવાયાં હશે એ વૃક્ષો! અને સચવાયાં પણ હશે?! આમલી જેવાં ધીમી ગતિએ વૃદ્ધિ પામતાં વૃક્ષોની કેટલી ધીરજથી માવજત થઈ હશે!

હવે પછીનાં વર્ષોમાં આમલી લુમ થઈ જાય તો નવાઈ નહીં. આમલીની ગેરહાજરીની બાબતે આમેય દુઃખી હતો ત્યાં ૨૧મી મે, '૦૮ના 'ટાઈસ્સ ઓફ ઇન્ડીયા'માં સમાચાર વાંચ્યા કે સરકારે ખાનગી જમીન પર ઉંગેલાં છ જ્યાતિનાં વૃક્ષો વગર પરવાનગીએ કાપવાની છૂટ આપી દીધી છે. આ વૃક્ષો છે લીમડો, દેશી બાવળ, કણ્ણ, ખીજડો, આંબો અને આમલી; બધી જ વૃક્ષજીતિ સ્થાનિક, ઉપયોગી અને કિમતી! 'સૌરાષ્ટ્ર વૃક્ષછેદન કાયદી, ૧૯૮૧' અન્યથે ૨૬ જ્યાતિનાં વૃક્ષોનાં છેદન પર પ્રતિબંધ છે તેમાંથી આ હ જ્યાતિનાં વૃક્ષો પરનો પ્રતિબંધ દૂર થયો. અને તે એટલા માટે કે ખેડૂતો વૃક્ષ-ખેતી (agro forestry) કરી શકે. પણ સારા હેતુ માટે અને ખાસ તો વૃક્ષની ખેતી માટે જ વૃક્ષો કપાશે તેની શી ખાત્રી? અને કયો ખેડૂત આમલી, ખીજડો કે દેશી બાવળ ઉંચેરશે? આમલી અને ખીજડાનું હવે શું ભવિષ્ય?

વળી, વૃક્ષ અને પક્ષીને તો સીધો સંબંધ છે. વૃક્ષનો છાંધો, વૃક્ષ પર મળતી બેસવાની કે માળાની જગ્યા, વૃક્ષમાંથી મળતો ખોરાક.. વૃક્ષ છે તો પક્ષી છે. અને એટલે આપણે સૌ પક્ષીપ્રેમીઓ પક્ષીસંરક્ષણના ભાગરૂપે વૃક્ષસંવર્ધનનું કાર્ય એક આભિયાન તરીકે લઈએ તો!

વૃક્ષનું પ્રાગટ્ય બીજમાંથી થાય છે. એ બીજના સંયયને - એકોક્રિકરણને એક યજાની જેમ આપણે સ્વીકારીએ તો! સમસ્યા માત્ર વૃક્ષોની સંખ્યાની જ નહીં તેમની લુન થતી જતી વિવિધતાની પણ છે. વૃક્ષોની સ્થાનિક જ્યાતિઓના ભોગે પરદેશી વૃક્ષોનું સંકમણ કદાચ પક્ષીઓ જ નહીં પણ અનેક નાનાં જીવ-જંતુઓ માટે પણ ખતરારૂપ છે. વનસ્પતિજગત તથા પ્રાણીજગતનું વૈવિધ્ય એકબીજા પર પરસ્પર નિર્ભર છે. કાળકમે ઉદ્ભવેલી વૃક્ષોની અનેક પ્રજાતિઓ આ વિસ્તારનાં પણ-પણી તથા જંતુજગતના વૈવિધ્યની ભૂમિકા બાંધે છે. જીવસ્તુસ્થિતિનું સમગ્રત: જ્યાતિવૈવિધ્ય પરસ્પર ગાઢ રીતે અને ગૂઢ રીતે સંકળાયેલું છે. વૃક્ષોની અલ્ય થતી જતી સંખ્યા અને લુમ થતા વૈવિધ્યની ખૂલ્લ મોટી કિમત પક્ષીસ્થિતિએ ચૂકવી પડશે.

**vihangujarat@gmail.com**

લાખાંજ: વાર્ષિક રૂ. ૧૦૦-૦૦,

આંજીબન રૂ. ૧૫૦૦-૦૦

(શુભેચ્છા કાળો આવક્કર્ય - 'વિહંગ રીસર્ચ ફાઉન્ડેશન - Vihang Research Foundation' ના નામે પ્રફૂલ અથવા મ. એસ. થી. બહારગામના ચેકાં રૂ. ૨૫૫/- ઉમેરવા. આ સંસ્થાને મળેલા દાનો આવક્કરેચ ધારાની કલમ ૮૦૪૪ હેઠળ કરમુશીને પાત્ર છે.)

આ અંકમાં ૨૪૦૮ થતા વિચારો સાથે સંપાદક મંડળ  
સહમત હોય તે જરૂરી નથી.

'બીજ એકનીકરણ'ને આપણે 'ફિલસૂફી'ના દસ્તિકોણથી મૂલવીએ તો તેને કાંતશાયજ સાથે સરખાવી શકાય. બીજને વીજાવાં, એકઠાં કરવાં, તેને પોળ્ય જગ્યાએ પહોંચાડવા જેથી તેના રોપા તૈયાર થઈ શકે; આ આપો પ્રક્રિયા વૃક્ષ સાથે આપણું તાદાત્મ્ય સાથે છે, ભાવાત્મક ઐક્યનું નિરૂપણ કરે છે. બીજાં વૃક્ષ છુપાયેલું છે અને તેના આવિષ્કારમાં આપણે નિમિત્ત બનીએ તો પ્રકૃતિ પાસેથી છીનવીને મેળવેલી અગ્નિષ્ટ સુવિધાઓનું થોડા અંશે પણ આપણે વળતર યુક્તવી શકીશું. સાથે સાથે, લુમથતી વૃક્ષોની સ્થાનિક જ્ઞાતિઓને ટકાવી રાખવામાં આપણે સહાયરૂપ બની શકીશું.

સૂતર કાંતવાનો પ્રગટ હેતુ કદાચ સ્વાવલંબી બનવાનો જ ન હતો, પણ એના થકી ગાંધી વિચારશૈલીના મૂલ્યોને વળણી રહેવાનો હતો. વૃક્ષારોપણ તો મહત્વનું છે જ પણ બીજના સંચય, સંરક્ષણ અને વાવેતરમાં સહભાગી થવાથી પ્રકૃતિપ્રેમની ભાવનાનું જે રીતે પાયામાં પ્રત્યારોપણ થશે તે લાંબા ગાળે વિશે મૂલ્યવાન નીવડશે.

'વિહંગ', આ બીજ એકનીકરણ અભિયાનમાં સૌને આમંત્રે છે. કેટલાંક વૃક્ષોની યાદી અંદરના લેખોમાં છે. વધુ વૃક્ષોની યાદી પણ અમે આપતા રહીશું. બીજ એકનીકરણ, સંગ્રહ વગેરેમાં જરૂરી કાળજ વિશે પણ અમુક લેખમાં ઉલ્લેખ છે.

વૃક્ષ સંરક્ષણ અને સંવર્ધન સાથે જોડાયેલી અને તેને વરેલી કેટલીક વ્યક્તિઓનો આ અંકમાં સમાવેશ કરાયો છે. એ વિહંગ છે કે ઘણાં મહાનુભાવો આ કાર્ય

સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલાં છે અને બીજસંચયની વિચારધારા કરી નવી નથી. 'વિહંગ'ના માધ્યમ દ્વારા અમે માત્ર તેનો વ્યાપ અને વિસ્તાર વધારવા માગીએ છીએ. 'વૃક્ષ-સંરક્ષણ'ની ભાવના પ્રત્યેક ધર સુધી પહોંચાડવા માગીએ છીએ.

આ સંગ્રહિત - સંચિત બીજને સ્વયંસેવકો પાસેથી મેળવી 'નર્સરી' સુધી પહોંચાડવાના સંકલન કાર્યમાં સ્વૈચ્છિક રીતે જેઓ જોડાવા ઈચ્છતા હોય તેઓ તેમના સરનામાં મોકલી શકે છે. આ સંચિત બીજ તેઓ નજીકની વનવિભાગની જે તે 'નર્સરી'માં કે ખાનગી 'નર્સરી' (પડતર ડિમ્ટે રોપા આપવાની શરતે) માં મોકલી આપશે. આપ જાતે પણ બીજને 'નર્સરી'માં પહોંચાડી શકો છો. માત્ર એ અંગે અમને જાણ કરતા રહેશો તો ગમશે. ક્યાં વૃક્ષોનાં બીજ એકત્ર કરવા - કેવી રીતે કરવાં વગેરે બાબતે કોઈ પ્રશ્ન હોય તો તે આવકાર્ય છે.

બીજ-સંચયથી આગળ વધીને, જેઓ પાસે થોડી જમીન છે તેઓ સ્વયં કેમ વૃક્ષાઉંદ્ર કેન્દ્ર (nursery) શરૂ ન કરી શકે? આ બાબતે વધુ સમજવાનો, જાણવાનો આપણે પ્રયત્ન કરીશું.

વૃક્ષ, પક્ષીઓ માટે તો 'કલ્પવૃક્ષ' જ છે! પક્ષીની ગતિ, રીતિ અને નિયતિ બધું જ વૃક્ષો પર નિર્ભર છે. વળી, હાલની ઔદ્યોગિક તેમજ શહેરી વિકાસની દોટ જેતાં જો સામૂહિક રીતે સામાજિક કાંતિના સ્વરૂપમાં આ અભિયાન નહીં આદરીએ તો ઘણાં મોડાં પડીશું. □

## ખંડેરોનું ખગમંડળ

પોતાના અભ્યાસખંડની બહાર નીકળનાર જિશાસુની આંખે પંખીઓ ચક્કા વિના ન રહે. પંખીઓ પ્રભુનું એક એવું સર્જન છે કે જેમાં તેનાં ચૈતન્યના હુવારા ઊડતા આપણે જોઈ શકીએ છીએ. તેમણે પોતાની જુદી જુદી આસ્થિયતોથી માનવને આકર્ષેલો છે. કોઈએ પોતાના રંગવૈલવથી, કોઈએ મધુર કંઠથી તો કોઈએ પોતાના ઉડ્યનકીશલથી.

સિંહ, વાઘ, દીપડા, હાથી કે ગેડાને તેમનાં નૈસર્જિક વાતાવરણમાં જોવાનો લહાવો અનોખો છે. પણ એવી તક બધાને મળવી દુલ્ભાષે. તેમની વાત જવા દઈએ.

શિયાળ, સસલા, નાર નોળિયા કે શાહુદી/સાપ

જેવાં પ્રાણીઓ પણ ક્યાં સુલભ છે? જ્યારે પંખીઓ તો આપણા દેશમાં લગતમાં સર્વભાપક છે. કચ્છ-રાજસ્થાનની વિશાળ મરુભૂમિથી માંડી હિમાલયના ઉત્તુંગ શિખરો સુધીનો ભાગ્યે જ કોઈ ચોરસ માઈલ તેમનાં વિનાનો હશે. તેમને શોધવા માટે દૂર જવાની જરૂર નથી પડતી. જે તે ભૂભાગને કે પ્રદેશને અનુકૂળ પંખીઓ ત્યાં હોવાનાં અને વહેલાં કે મોડાં નિરીક્ષણપદ્ધતિ આંખે તેઓ ચદવાનાં. તેમાંથે આસોથી ફાગણ સુધીના સમયમાં ભારતનાં પક્ષીજગતમાં



ભરતી આવે છે. આ સમય દરમાન હિમાલય, તિબેટ, સાઈલિન્યા, રશીયા અને છેક યુરોપથી અનેક જાતનાં પંખીઓ આપણે તાં શિયાળો ગાળવા આવે છે.

રૂપાળું પંખી કોને કહેવું? જુદા જુદા ભભકદાર રંગો ધરાવતું હોય તેને? રૂપના એક અગત્યના અંગ તરીકે રંગનું મહાત્વ છે એ ખરું, પણ તેનેજ મૂર્ખન્ય સ્થાન આપીએ તો રૂપની વ્યાખ્યા અખૂદી રહે. રંગ ભલે કાળા કે કાબરા હોય પણ આકાર સૌઝવને લીધે રૂપાળાં અને નયનાભિરામ હોય એવાં ધણાં પંખીઓ છે. વળી, મોર, ફૂકડો, પીળક, શૌભિગી કે અધરંગ જેવાં પંખીઓ રંગવૈભવ અને અંગલાવણ્ય બન્ને ધરાવે છે.

સીમ- શેડે અને વિશાળ ખંડરોમાં કે ભજન ડિલ્વાઓમાં જેવા મળતી દેવચકલી ઉંડે કાળીટ્રવ (Indian Robin) છે તો કાળા રંગની, છતાં સપ્રમાણ શરીર રચના અને ઘીરધિમાં ડેક અને પૂછદીને બેંચીને ઉભી ટક્કાર કરવાની વત્તિશૂકવાળું અને મૂંઠનાં દેરા કથ્થાઈ રંગને લહેરાવતું આ પંખી ઉજજડ ખંડરોમાં પોતાની મીઠી સીટીથી પ્રાણ પૂરે છે. અંગેજ કાવ્યસાહિત્યમાં સ્થાન પામેલુ ‘રોભીન’ આપણી આ દેવચકલીનું કુંદુભી. દેવચકલીને આપણાં લોકસાહિત્યમાં સ્થાન મળ્યું છે અને તે એક શુકનિયાળ પંખી મનાયું છે.

કાબરો પિદો (Pied Bushchat) અને મોટો કાબરો પિદો (Variable Wheatear) “ધથા નામા તથા ગુણા” મુજબ રંગે કાળા તથા ધોળા છે. દેવચકલીના આ બન્ને કુંદુભી આપણે તાં શિયાળું મહેમાન થઈને આવે છે. નાના છોડ, વાડ, પત્થર કે એવી થોડી ઊંચી જગ્યાએ અથવા તાર-ટેલિફોનના તાર કે થાંભલા ઉપર બેસી ચ્યોર નજરે આસપાસની ભૂમિનું નિરીક્ષણ કરતાં અને જમીન ઉપર જેવું કોઈ જીવનું નજરે ચેતે કે તુરત ઊરીને પકડી લેતાં આ બન્ને પંખીઓની સ્ફૂર્તિ વિતાર્કર્ષ છે. કાબરી દેશભૂષામાં પણ તેમની નમણાઈ અછીતી રહેતી નથી. તેમનું ગાન મીહું ગણાય છે. અફસોસ એટલો કે આપણા આ મહેમાનો તેમનાં સંગીતનો આપણને બહુ લાભ આપતા નથી. પ્રજનન કરવા જ્યારે તેઓ ઉત્તરના પોતાના ઠડા વતનમાં જાય છે, ત્યારે તેમનું શરમાળપણું ગાયબ થઈ જાય છે અને તાં ખૂબ ગાય છે. આસપાસ જો નાના-મોટા થોડાં વૃક્ષો હશે તો થરથરો (Redstart) તાં હોવાનો. તે ઉપરના ભાગે કાળો અને પેટાળે ઈટિયો રાતો રંગ ધરાવે છે, દિવાળીધોડા પૂછદી ઊંચીનીંચી કર્યા કરે છે, જ્યારે થરથર્રો પૂછદીને ડાબાજમણી એમ આડી થરકાવ્યા કરે છે.

થોડી વાર તેમનું નિરીક્ષણ કરનારને પોતાની ચપળતાનો ચેપ લગાડી દે એવું તરવરિયું ચકલી જેવું એ પંખી છે. આ બધાં રૂપકડાં પંખીઓ કદમાં ચકલી જેવાં કે સહેજ નાના મોટાં છે. તેમની માદાઓ સાદા ભૂખરા રંગની હોય છે.

“કરતી’તી પ્રત” એમ વારંવાર યાદ કરાવતી અથવા “Did he do it?” એવો પ્રશ્ન પૂછ્યા કરતી આપણી સુપરિચિત ટિટોડી (Red-wattled Lapwing) ખંડરોની આસપાસ જોવા ન મળે તો જ નવાઈ. પટપટાપ બે પાંચ ડગલા જરૂરથી ચાલી, જમીન પરની જીવત વીણાતી ટિટોડી વાચાળ પંખી છે. સાપ, નોળિયા કે બિલાડી જેવા શિકારીઓ નજરે ચેતે તો કીકીઆરી કરી મૂકે અને આસપાસના પંખીમંડળને સાવધાન કરી દે. આવા વખતે નિરીક્ષણ કે સંશોધનમાં વ્યસ્ત એવા પક્ષીનિરીક્ષકે પણ આવા ઢેકારાનું કારણ જાણી લેવું સારું! ટિટોડીના કુળની વગડાઉ ટિટોડી (Yellow-wattled Lapwing) પ્રમાણાં ઓછી જાડીતી છે. તેનો વસવાટ મુખ્યત્વે ગામ બહાર. પ્રમાણમાં ઓછી વાચાળ એવી આ વગડાઉ ટિટોડીનો અવાજ ટિટોડી જેવો કર્કશ નથી પણ સંભળવો ગમે તેવો છે.

ભારતમાં ગાયક પંખીઓમાં જેમની ગણના છે એવું ચંડૂલ કુળ મુખ્યત્વે સાવ સાહું છે. મેલું સફેદ પેટાળ અને આછી બદામી પીઠ ઉપર કોઝી રંગની પટીવાળો ચંડૂલોનો પહેરવેશ છે. અજાણ્યાને ચકલી જેવાં લાગે. ધ્યાનથી જોઈએ તો તેની બે વિશેષતાઓ જણાય. એકાદ અપવાદ સિવાય બધા ચંડૂલોની ચાંચ ચકલી કરતાં પાતળી છે. વળી, તેઓ ચકલીની માફક બે પગે ઠેકડા મારતાં ચાલતાં નથી પણ કાબરની માફક એક પછી એક પગ મૂકીને ચાલે છે. ચંડૂલોની બે-એક જાતોને માથે ચોટી છે. દેખાવમાં સાવ સાદા એવાં આ પંખીઓ જેતર, પાદર અને વેરાન વગડામાં વસે છે. વસંતત્રણું આગમન સાથે તેમની ચેતના સંગીત દ્વારા ઉભરાવા માંડે. તેમાંથે નાનો ચંડૂલ (Syke's Crested Lark) સંગીતવિદ્યામાં વધારે પાવર્યો છે. મિનિટો સુધી આ પક્ષી એકધારું ગાતું જાય અને આકાશમાં ઉચ્ચેને ઉચ્ચે ચાદું જાય. ખૂબ ઉચ્ચે ચાદીને પવન તરફ મોહું રાખી એક જણ્યાએ ઊડતું મુકત કંઠ ગાય. નિરીક્ષણ કરીને થાકેલા પુરાતત્વવિદ્યનો થાક ભૂલાવી દે એવું મીહું તેનું ગાન છે.

સમાજે જેને અપશુકનિયાળ માન્યાં છે તે ધૂવડ કુળનો એકાદ પ્રતિનિષિ મોટા ખંડરોમાં વસતો જોવા મળી જાય એવું બને. છેવટે કાંઈ નહીં તો ચીબરી, આવાં સ્થળોએ આસપાસમાં ક્યાંક હોવાની. પોતાના એકાંત અને

આરામનો ભંગ કરવાવાળા પુરાત્ત્વવિદ્ધ પ્રત્યેનો અણગમો જરાય સંકોચ્યા રાખ્યા વિના તે વ્યક્ત કરશે. પહેલાં તો કોઈ બખોલ કે જ્યાં તે આરામ કરતી હશે તેની ધારે આવીને ઘાનપૂર્વક અને લાસ્યાસ્યદ લાગે એવી ગંભીરતાથી માણું ઉંચુનીંયું કરતી કરતી મૂંગી મૂંગી તમારી બધી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે. છતાંય જો તમે ત્યાંથી નહીં ખસો તો પોતે ઉદ્દીને થોડે દૂર જશે અને ત્યાંથી તમારા ઉપર બાન રાખ્યા

કરશે. છેવટે કંઠાળીને કર્કશ અવાજે ગાળો દઈને ઉડી જશે. આ બધું જોવાની મજા આવે એવું છે.

(પુરાત્ત્વમંડળ, પોરબંદરના મુખપત્રના સૌજન્યથી)

સી-૨, ઇસ્રિઓમ ઓપાર્ટ., 'ટાઇસ ઓફ ઇન્ડિયા' પ્રેસ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ-૫૧

## ખંડંગાવલોછન

લવકુમાર ખાચર

અનું નંદિતા મુનિ



### 'લીટલ બ્રાઉન પાઝલ'

અત્યારે મારી સમક્ષ 'WWF-India' અને 'નોથ ઇન્ડિયા બર્ડ નેટવર્ક' દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલું ટેબલ ક્લેન્ડર પદ્ધતિ છે. આ ક્લેન્ડર મેં ખાસ ખરીદું હતું; કારણ કે તેના મુખપૂર્ક પર શંખવા (Crab-plover, *Dromas ardeola*)ની ઉઙ્ઘણ કરી રહેલી જોડીની સુંદર તસવીર હતી. આ ક્લેન્ડરનો વિષય પાણીકાંઠાનાં પક્ષીઓ (waders) છે. પાણીકાંઠાનાં પક્ષીઓ કોષડા સમાં હોઈ તેમને 'બ્રાઉન પાઝલ' તરીકે પણ ઓળખવામાં આવે છે! પરંતુ આજે હું કાદબ ફંફૂસનારાં આ પક્ષીઓની નહીં, પરંતુ સમસ્યા સમાન એક અન્ય પક્ષીસમુદ્દાયની વાત કરવા માણું છું. આ પક્ષીઓ હૂટકી, ટીકીકી, કરકરિયા કે 'વોર્લબર' (warbler) તરીકે ઓળખાય છે. ટેબલ ક્લેન્ડરનો ઉલ્લેખ મેં એ કારણે કર્યો કે તેમાં આપવામાં આવેલી ઉત્કૃષ્ટ તસવીરો 'ડિજિટલ કેમેરા' લઈને વનવગડા ખૂંઢી રહેલા નવા પ્રકારના 'શિકારીઓ' દ્વારા લેવામાં આવેલી છે. આવા આધુનિક 'શિકારીઓ' પેક્ઝ એક શિકારીએ હમણાં એક નોંધપાત્ર શોધ, અથવા તો પુનઃશોધ કરી; એક સરથી પણ વધુ સમય અગાઉ કોઈ અંગેજ નિશાનબાજે નોંધેલા પક્ષી મોટીચાંચ પાન કરકરિયા (Large-billed Warbler, *Acrocephalus orinus*)ની આટલા સમય પછી તસવીર લઈને. તે સમયે હિમાયલ પ્રદેશ ખાતે સત્તલજની એક વેરાન અને ઊંચા તાપમાનવાળી ઝીણમાંથી મળી આવેલા એક નમૂનાને બાદ કરતાં છેક અત્યાર સુધી આ રહસ્યમય પક્ષીની અન્ય કોઈ જ નોંધ થઈ નહોતી. મોટીચાંચ પાન કરકરિયાની આસપાર 'વીટણાયેલું રહસ્ય તો પથાવતું છે, પરંતુ કમ-સે-કમ તેનું અસ્તિત્વ હજુ સુધી ટકી રહ્યું છે, એટલું તો સાબિત થયું. જેમ જેમ આધુનિક 'શિકારીઓ'ની સંખ્યા

અને પ્રવૃત્તિવિસ્તાર વધતા જશે તેમ તેમ શક્ય છે કે આ પક્ષી વધુ સ્થળોથી નોંધાય; અને કદાચ એવું પણ સાબિત થઈ શકે કે તે દુર્લભ નથી.

રહસ્યમય મોટીચાંચ પાન કરકરિયાની નોંધ બંગ્કોક (થાઇલેન્ડ) ખાતે પણ કરવામાં આવે છે. આ નમૂનો 'મિસ્ટનેટ' (ગાભ્યાસ અર્થે પક્ષીઓને પકડવા માટેની જરૂર)માં પકડાઈ આવેલ ડિમાયલ - લલકતા - બંગ્કોક - આ સ્થળો પરથી અનુમાન કરી શકાય કે આ યાયાવર હૂટકી હિમાયલપમાં ગ્રજનન કરતી હોય અને પૂર્વમાં ગંગાનાં મેદાનો ઉપરથી ઋતુપ્રવાસ કરી અનિન્ય એશિયામાં શિયાળો ગાળતી હોય.

મારે વાત તો ભૂતકાળની સ્મૃતિઓની કરવી છે; તો પછી હું આ તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ શા માટે કરી રહ્યો છું? એનું કારણ એ છે કે વર્તમાન પર હમેશા ભૂતકાળની છાયા રહેતી હોય છે; તેમ જ વર્તમાન ઘટનાઓથી પુરાણી સ્મૃતિઓ સંજીવન થતી હોય છે. મોટીચાંચ પાન કરકરિયાના સમાચાર પરથી મને સૌરાષ્ટ્રમાં મોટા કરકરિયા (Thickbilled Warbler, *Acrocephalus aedon*)ની સર્વપ્રथમ નોંધ યાદ આવી ગઈ. આ કરકરિયાને અમે 'મિસ્ટનેટ'માં પકડાયો હતો. અમે એને અગાઉ ક્યારેય જોયો નહોતો; અને એ વિસ્તારની આસપાસ ક્યાંય તેના અસ્તિત્વની નોંધ લેવાઈ નહોતી! એ તો પૂર્વ ભારતનું પક્ષી હતું. આ પ્રથમ પક્ષી મળ્યા પછી એના અન્ય નમૂના પણ પકડાયા. આમ ધીમે ધીમે એનો વિરોધ પરિયથ થયો અને પક્ષીનિરીક્ષણ વખતે અગાઉ એને મોટો પાન કરકરિયો (Indian Great Reed-Warbler, *Acrocephalus stentoreus*) ગણીને નજરઅંદાજ કરી દેતા, તેના બદલે એને યોગ્ય

રીતે ઓળખવા લાગ્યા. ત્યારથી હું દરેક પાન કરકરિયા (Reed-Warbler)ને ધ્યાનપૂર્વક નિખાળું છું. ફૂટીઓને 'શૂટ' કરતા આધુનિક શિકારીઓ એટલે કે તસવીરકારોને પણ આ પ્રકારનો અનુભવ થાય તે અશક્ય નથી. જો કે પક્ષીઓને 'મિસ્ટનેટ'માં પકડવા અને પક્ષીઓની તસવીર લેવી, એ બસે તદ્દન જુદા પ્રકારની પ્રવૃત્તિ છે. 'મિસ્ટનેટિંગ'માં પક્ષીઓ પકડાય તેની રાહ જોવાની હોય છે અને કયા પક્ષીઓ જડપાશે એ સંજોગોને આધીન હોય છે. આનાથી ઊલટું, તસવીરો જડપવા માટે દફનિશ્ચયથી પક્ષીઓનો પીછે કરવો પડે છે. કેમેરાનો યોગ્ય ઉપયોગ કરવાની કુશળતા પણ જરૂરી છે. વર્તમાન સમયના ઉત્તમ કક્ષાની તસવીરો જોઈને મને લાગે છે કે કાદવિધા મેદાનો ખૂંદતા આ નિશ્ચયબળવાળા તસવીરકારો વિવિધ ફૂટીઓને સારી રીતે ઓળખતા થઈ જશે. પણ આ તો મેં ભવિષ્યની આશા પ્રગટ કરી; હવે હું ભૂતકાળ તરફ પાછો ફું.

ડૉ. સલીમ અલીની 'ધ્યાનપરા વીડીમાં કાળો ઢોક' બિડ્સ'ની પ્રથમ આવૃત્તિ ૧૯૯૧માં પ્રકાશિત થઈ હતી. મને જો બારાબર યાદ હોય, તો તેમાં માત્ર ત્રણ ફૂટીઓનું વર્ણન આપવામાં આવેલું - દરજાદો (Common Tailorbird), ફડકફૂટી (Ashy Prinia) અને પાન ફડકફૂટી (Plain Prinia). આમાંનાં પ્રથમ બે પક્ષી તો આપણા બગીચામાં જોવા મળતાં સુપરિચિત પક્ષીઓ છે. આ બસે પક્ષીઓ બગીચાના મોટાં પાનવાળા છોડમાં કુશળ રીતે સિલાઈકામ કરીને માળા બનાવે છે. ધ્યાનાક્ર્ષક રંગ અને

લાંબી, ટઢાર પૂછીના કારણે એમની પિછાણા આસાન છે. દરજાનો રંગ ઉપરથી લીલો અને પેટાળમાં સકેદ છે; જ્યારે ફડકફૂટી ઉપર રાખોડી અને નીચે ગુલાબી જાંયવાળો સકેદ રંગ ધરાવે છે, ઉનાણો શરૂ થાય કે તરત આ બસે પક્ષીઓ અવિરત બોલવાનો પ્રારંભ કરે છે. દરજાદો મોટા અવાજે થાક્યા વગર 'ચૂપ-ચૂપ-ચૂપ-ચૂપ' બોલ્યા કરે છે. ફડકફૂટીનો અવાજ એના કરતાં ધીમો અને સંગીતમય રણકાર ધરાવતો હોય છે. ફડકફૂટી એક અન્ય અવાજ પણ કરે છે; મારી ધારણા હતી કે આ અવાજ એ ચાંચ વડે કરે છે. પણ ગાંધીનગર ખાતે મારા ધરના બગીચામાં રહેતી ફડકફૂટીની એક જોડનું કણજીપૂર્વક નિરીક્ષણ કરીને મેં જાણું કે એ અવાજ પાંખો દારા પેદા થાય છે.


પાન ફડકફૂટી બાગ-બગીચામાં આવતી નથી; પણ પાણીમાં ઊગેલાં લીચા ચિયામાં તેની આવ-જા ધ્યાન ખેંચે તેવી હોય છે. રોકડિયા પાક તરીકે મગફળનું વાવેતર પ્રચલિત થયું તે પહેલા વષટ્ઠિતુમાં ઉગાડવામાં આવતાં જુવાર, બાજરી, શેરી જેવા પાકોમાં પણ એની ગતિવિધિ જોવા મળતી. અન્યથા ખાસ ધ્યાનાક્ર્ષક ન કહેવાય એવી આ ફૂટીની લાંબી પૂછડી મને હમેશા ગમી છે.

(કમશઃ)

ઓત : Indian Birds, Vol.3, No.2,  
March-April 2007 અંકમાંથી સાભાર  
૧૪, જાંતું સોસાયટી, રાજકોટ ૩૬૪૦૦૪



## નિરીક્ષણ નોંધ



### રામપરા વીડીમાં કાળો ઢોક

તા. ૬-૩-૨૦૦૮ ના રોજ હું, ભાવેશભાઈ ન્યિબેદી તથા બીજા ચાર મિન્નો સાંજના સમયે રામપરા વીડી ગયેલ અને ત્યાં આવેલ તળાવ પાસે બે કાળા ઢોક. (Black Stork) જોયેલ.

### રવિ આરદેસશા

૭, જનકપુરી સોસાયટી, પુનિ. રોડ, રાજકોટ

### માંડવ વીડીની મુલાકાત

તા. ૨૬-૧-૨૦૦૮ના રોજ શ્રી ચીકુ વોરા અને શ્રી ફારુક ચૌહાણ સાથે મેથાન પાસે આવેલ માંડવ વીડીની મુલાકાત લીધી. ત્યાં લગ્ગડ (Laggar)ની પ્રજનનરત જોડી

જોવા મળી. ખીજડાના વૃક્ષ પર તેનો માળો પણ જોવા મળ્યો. અમે આશરે અડધા કલાક સુધી આ જોડનું હવાઈ પ્રણયનૃત્ય (courtship) પણ નિખાળું.

તા. ૨૩-૨-૨૦૦૮ના રોજ હું, શ્રી ચીકુ વોરા અને શ્રી ફારુક ચૌહાણ પાટડી જઈ રહ્યા હતા. ત્યારે સુરેન્નગરથી ૨૦ કિમીના અંતરે તુરુમ્બી (Red-headed Falcon)ની જોડી વીજળીના તાર પર બેઢેલી જોવા મળી. માદા તુરુમ્બી એક નાના વણાઓળખાયેલા પક્ષીનો આધાર કરી રહી હતી. આધાર પૂર્ણ થતો આ જોડી પાંખરતી (matting) જોવા મળી. ત્યાર બાદ માદા, પીપળાના વૃક્ષ પર બનાવેલા માળામાં બેસી ગઈ. તા. ૨૫, ૨૬ અને ૨૭ ફેબ્રુઆરી, '૦૮ના રોજ અમે તે જગ્યાની

પુનઃમુલાકાતો લીધી અને આ તમામ મુલાકાત વખતે તે જોડીની પાંખવાની ઢિયા જોવા મળી.

### વિશાળ થોરિયા

૫, અરુણ સોસાયરી, દાણ મિલ રોડ, સુરેન્ધ્રનગર

### દરજ્જાના માળાનું નિરીક્ષણ

તા. ૨૧-૧૦-૨૦૦૭ : તળાજી

**માળો બાંખવાની શરૂઆત:** સખત સૂર્ય પ્રકાશ ન આવે તેમ આંબાની એકદમ નીચેની ડાળીએ ચાર પાંદડાં જોડીને બનાવેલ; પાંદડાં એકદમ લીલાં તથા ખરી ન જાય તેવાં હતાં. તેમાં મુખ્યચે કરોળિયાના જાળાં, વાળ, તાણખલાં, કાપડાના નાના કટકા, રૂ, પ્લાસ્ટિકની થેલીના દોરા વગરે જોડીને નમતી ડાળીની દોયે માળો બાંખેલ.

**માળાની ખાસિયત :** માળો થોડો ઊંડો તથા ગોળ અને સાંકડો તથા અંદરથી એકદમ નરમ અને વ્યવસ્થિત.

**ઈડાં :** તારીખ ૧૮-૮-૨૦૦૭ના રોજ એક ઈંદું મૂક્યું. ત્યાર બાદ તા. ૧૯-૮-૨૦૦૭ના રોજ બીજાં ત્રણ ઈંદું મૂક્યાં. ઈંદું લંબગોળ તથા નાની લખોટી જેવડાં હતાં. સફેદ રંગમાં કથ્થાઈ રંગના ડાઢા જોવા મળ્યા.

**બચ્ચાં :** તા. ૨-૯-૨૦૦૭ના રોજ ચાર ઈંદું પેકી એક, પછી તા. ૩-૯-૦૭ના રોજ બે ઈંદુંમાંથી બચ્ચાં નાકળ્યાં.

નર, દૂર ખોરાક શોધવા જતો, માદા માળાની નજીક જ રહેતી હતી, જેથી બચ્ચાં પર પૂરતી નજીર રાખી રહાય. ખોરાકમાં બચ્ચાંને લીંબુરી તથા કુવાડિયામાંની નાની ઈચ્છાઓ આપતાં.

તા. ૧૪-૭-૨૦૦૭ના રોજ નાંદોય બચ્ચાં ઊડી ગયાં અને અંતે માળામાં માત્ર એક ઈંદું રહ્યું.

આમ, માળામાંથી સુરક્ષિત રીતે ગાણ બચ્ચાં કુદરતના ખોળે રમતાં અને ઊડતાં થયાં.

શિક્ષિકા શ્રી રઘુબેન દવેએ અમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. (ઇંદું મૂકવાની તારીખ લખી છે, તો માળો બાંખવાની શરૂઆત કર્યાની તારીખ કેમ નહીં? - થા)

### ધ્યાંખ સોનલ અમૃતભાઈ

દાંડાની વાડી, રામપુર રોડ, નવીનિબિલ સુલ પાસે,  
સ્લોટ નં. ૬૦, તા. તળાજી, જિ. ભાવનગર

### પાટશ જિલ્લાના ગરામડી ગામે પક્ષીનિરીક્ષણ

તા. ૨૩ ડિસેમ્બર, '૦૭ના રોજ પાટશ જિલ્લાનાં વિવિધ ગામોનાં તળાવમાં પક્ષીગણતરી કરેલી. આ

પક્ષીગણતરી મુજબ સૌ પ્રથમ પાટશ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી જાળાશય મુકામે ૮.૦૦ કલાકે પહોંચી પ્રથમ પક્ષીનિરીક્ષણ કર્ય.

આ જાળાશય ખૂબ જ રમણીય છે અને અહીં પાણીનું પ્રમાણ પણ સાંદું એવું છે. અહીં કરાયેલ પક્ષીનિરીક્ષણ દરમિયાન નીલશિર (Mallard) જોવા મળી એ સૌથી સુંદર અનુભવ હતો.

અમે નીચે મુજબનાં પક્ષીઓ જોયા:

પક્ષીઓનાં નામ	કુલ સંખ્યા
નીલશિર (Mallard)	૪
કરકરો (Demoiselle Crane)	૩૦
કુજ (Common Crane)	૨૫
ચમચો (Eurasian Spoonbill)	૧૬
ટીલીયાળી બતક (Spotbilled Duck)	૭
નાની મુરધાબી (Common teal)	૬
ભગતદું (Common Coot)	૩૦
નીલ જલમુરઘો (Purple Swamphen)	૩
પાનપણાઈ (Marsh Harrier)	૧
નાની ઝૂબકી (Little Grebe)	૨૫
મોટી ચોટીલી ઝૂબકી (Great Crested Grebe)	૬
રાજોડી કારચિયા (Common Pochard)	૩૦
નડી બગલો (Purple Heron)	૨

સેજલ પટેલ, નિરુજ ગજેરા, નિશિથ ધારીયા, જથ્યદેવ ધાખલ

પર્યાવરણ વિજ્ઞાન વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ. પાટશ

### સુરત અને ડાંગમાં પક્ષીનિરીક્ષણ

તા. ૨૮-૬-૦૭: સુરતથી હુમસના રસ્તે ગવિયર તળાવમાં ૨ શેતપણે જલમાંજર (Pheasant - tailed Jacana) જોયા. એ ઉપરાંત સાથે ૮ જેટલા કાળા જલમાંજર (Bronze - winged Jacana), ૭૦ થી ૮૦ નાની સિસોટી બતક (Lesser Whistling Duck), ૨૮ નકટા (Comb Duck), ૧૮ નાના ધોળા બગલા (Little Egret), ૨ મોટા ધોળા બગલા (Large Egret), ૨ નડી બગલા (Purple Heron), ૨૨ કેચીપૂછ વાબગલી (River Tern), ૬ નાની વાબગલી (Little Tern), ૩ સુરંગી પાનબગલી (Chestnut Bittern) જોવા મળી.

તા. ૮-૭-૨૦૦૭ : સુરત નજીક પાલ ગામની સીમમાં યોગશભાઈ પટેલ સાથે નીલપણો (Black naped Monarch - Flycatcher) જોયો જે આ બાજુ ક્યારેય જોવા મળ્યો નથી. ગાડ જંગલનું પક્ષી શહેર નજીક આવી ચડ્યું હતો. અગાઉ મેં અને 'નેચર કલબ' સુરતના નિર્મણ ચોથાયે

દુમસ પાસે ૮-૫-૦૬ના રોજ જોયેલો; જંગલો કપાતા અગાઉ ન દેખાતાં પક્ષીઓ શહેર તરફ આવવા લાગ્યા છે; જેમ કે વલસાડ શહેરમાં હવે દૂરસાજ વધારે દેખાવા લાગ્યા છે.

સુરત - દાંડી રોડ પર વેલુખ ગામ પાસેના નાના તળાવમાં તા. ૮-૭-૦૭ના રોજ કાળી પાનબગલી (Black Bittern) જોઈ.

૨૫-૧૦-૦૭ સુરત દાંડી રોડ પર રાતે મહાટેવના મંદિર પાસે વન દશરથિયા (Indian Jungle Nightjar) નો અવાજ ૧ કલાક સુધી સાંભળ્યો.

વાંસદા રાઘીય ઉદ્ઘાનમાં તા. ૧૮-૧૦-૨૦૦૭ના દિવસે જોયેલાં પક્ષીઓ :

કૂલરાજ (Crimson Sunbird) - ૬, મોર (Indian Peafowl) - ૧૦, ટપ્પીલો લક્કડખોડ (Heart-spotted Woodpecker), મોટો લક્કડખોડ (Great Black Woodpecker) - ૨, સુઅગણ (Malabar Trogon) - ૨, શ્યામશિર પીળાક (Black headed Oriole) - ૧૧, રાખોડી કુકડો (Grey Junglefowl) - ૩, રાખોડી ચિલોઓ (Grey Hornbill) - ૨, શૈતનયના (Oriental White-eye) - ૨૦+, ભીમરાજ (Greater Racket-tailed Drongo) - ૧૫+, દૂરસાજ (Asian Paradise Flycatcher) - ૨૦+ (જેમાં ૮ જેટલાં સફેદ હતાં), ચોટલિયો સાપમાર (Crested Serpent Eagle) - ૧, સોનેરીપીઠ લક્કડખોડ (Lesser Golden-backed Woodpecker or Blackrumped Flameback) - ૧૫+, નાનો લીલો લક્કડખોડ (Small Yellow-naped Woodpecker) - ૨, જીણકો લક્કડખોડ (Brown-capped Pygmy Woodpecker) - ૨, લાલપીઠ સોનેરી લક્કડખોડ (Greater Golden-backed Woodpecker or Greater Flameback) - ૧.

વાંસદાથી અનાવલના રસો પાલગભાડ પાસે ૮ જેટલાં રાખોડી અબાબીલ-લટોરા (Ashy Woodswallow) જોયા.

છેલવાં ત્રણ વર્ષોથી, મે-જૂનમાં એક જ જગ્યાએ (વીજળીના થાંબલા પર) માળો કરે છે.

અગાઉ, પ્રથમ વાર આ માળો ડો. બંકુલ નિવેદી સાથે જોયેલ.

### મુકેશ ભક્ત

'સારસ', ૧૦૧, ન્યુ ધરતી એપા., સીટીલાઈટ રોડ, સુરત ૩૬૦૦૦૭

### ગીરમાં શામા

તા. ૧૭-૨-૨૦૦૮ના રોજ મારા મિત્ર

અર્બુનભાઈ વિરાણી સાથે જુનાગઢ - જટાશંકર જવાનું થયું. તળેટીમાં આવેલ સનાતન ધર્મશાળાની બાજુમાંથી પસાર થતી કેરી ઉપર આગળ જતાં ઘણો જ ગીર જારીનો વિસ્તાર છે, જ્યાં ચોમાસામાં ખોખ પડે છે. તે વિસ્તારમાં શામા (Shama) પક્ષી જોવા મળેલ. ગીરમાં નોંધાયેલ છે કે કેમ, તે મારી જાણમાં નથી પરંતુ ૨૮ વર્ષના મારા અનુભવમાં મેં પ્રથમ વખત જોયું. ખૂબ સરસ રીતે જોયું. જંગલમાં અમારા બે સિવાય કોઈની અવર - જવર ન હતી. પરંતુ અફ્સોસ એ વાતનો હતો કે આગસને લીધે સાથે કેમેરો લીધેલ ન હતો. સાથે થરથરા (Black Redstart) અને ખેરખણી (Indian Treepie) જોવા મળ્યા. તેમજ જુનાગઢમાં સમણી (Pariah Kite) સામાન્ય છે, પણ આ વિસ્તારમાં જોવા ન મળ્યી.

### આજિત ભક્ત

બસ ડેપોની પાસે, પારી ડેવ્પેડ૭૦

### લાલપૂંછ પિદા (Rufoustaile Wheatear)ની જામનગરમાં નોંધ

તા. ૧૭-૨-૦૮ના રોજ મેહુલ ડેવિલા તથા મનીષ નિવેદી સાથે જામનગરની નજીક આવેલ રણાંજિત સાગર તેમની મુલાકાત લીધી. તાંથી પરત થતાં હતાં તારે રસ્તાની બાજુના જાડ પર એક પક્ષી બેઠેલું જોયું. બાઈક પાણી વાળીને જોયું તો દૂરથી તેની આકર્ષક લાલ પૂંછ દર્શયમાન થઈ. નજીક જઈને જોતાં તે લાલપૂંછ પિદી જણાયો.

મનીષ નિવેદીએ તેના ધજાં 'ફોટોગ્રાફ્સ' લીધા. અમે આ પક્ષીને નજીકના અંતરથી ધજો સમય માટ્યું.

સામાન્ય રીતે આ પક્ષી ગુજરાતના શિયાળુ મુલાકાતી છે તથા ટીક ટીક વ્યાપક છે. તે કુંગરાળ કે પથરાળ પ્રદેશોમાં નોંધાયેલું છે. પરંતુ, જામનગર કે તેની આસપાસમાં આ પક્ષી પહેલાં નોંધાયેલું હોય તેવી જાણકારી પ્રાપ્ય નથી. જો કોઈ પક્ષીનિરીક્ષક આ બાબત પર પ્રકાશ પાડે તો આભારી થઈશું.

ડૉ. મૌલિક એસ. વરુણાંધ્ર, પી.જી.લોસ્ટેલ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર

### હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ., પાટણની આસપાસના વિસ્તારમાં પક્ષીનિરીક્ષણ

સમયની સાથે વધતી જતી શહેરીકરણ અને બાંધકામની વિવિધ પ્રવૃત્તિઓથી પક્ષીરહેઠાણોનો સતત નાશ થઈ રહ્યો છે. એ વાતને ધ્યાનમાં રાખીને પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કેમ્પસમાં આવેલા જૈવિક વિજ્ઞાન ભવનમાં ચલાવાતા પર્યાવરણીયશાસ્ત્ર (environmental

## નિર્દેશાળ નોંધ

mental science)ના અનુસ્નાતક કલાના વિદ્યાર્થીઓએ ચાલુ શિયાળમાં ‘શહેરી વિસ્તારોમાં પક્ષીવૈવિધ્ય, બાપ અને વ્યવસ્થાપનની શક્યતાઓ’ વિવિધ ઉપર સંશોધનપત્ર તૈયાર કરવાના હેતુથી, તા. ૧૫ ડિસેમ્બર થી ૨૪ ડિસેમ્બર, ’૦૭ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના ૨૫૦ એકર વિસ્તારમાં આવેલા વિવિધ ભાગોનું સર્વેકાશ કર્યું; તેમાં ઔદ્ઘીય વનસ્પતિ ઉદ્ઘાન, ડિપાર્ટમેન્ટની આસપાસનો સુશોભનની વનસ્પતિ ધરાવતો બગીચો તથા અનુસ્નાતક વિભાગ પાસેનો વિસ્તાર કે જેમાં પડતર ખેતભૂમિ અને ધાસનું મેદાન તથા પાસેની યુનિવર્સિટીની દીવાલે આવેલાં ખેતરો; સરસ્વતી નરીનો પટ, ઉપરાંત વી.સી. બંગલોઝ અને સુવિધા ભવનની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં કુદરતી રીતે ઊળી નીકળેલી વિવિધ વનસ્પતિઓ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિસ્તારોની સવારે ૮-૦૦ કલાકથી ૧૨-૦૦ કલાક સુધી નિયમિત મુલાકાત લઈ અવલોકન કરેલ.

આ દરમિયાન અનુસ્નાતક વિભાગના અધ્યાપકશ્રી ડૉ. સંજયભાઈ દવેએ વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકેની ફરજ સારી રીતે અદા કરી. તેમની પાસેના પક્ષીઓના અનુભવોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા અને પક્ષીઓની વિવિધ જાતોને ઓળખવામાં મદદ કરી. એક સમાહ ચાલેલ આ પક્ષી અવલોકનમાં પાટક્ષ ‘સેશન્સ કોટી’ના જ્જ અને પક્ષીરસિક શ્રી જ્યદેવભાઈ ધાખલે પણ તેમની વ્યસ્તતામાંથી સમય આપી વિદ્યાર્થી મિત્રોને તેમના અનુભવનો લાભ આપ્યો. કાર્યક્રમ દરમિયાન ‘ટેકનિકલ’ સહકાર મેળવવામાં અધ્યાપકશ્રી ડૉ. નિશીથભાઈ ધારેયાએ વિવિધ સ્તરે મદદ કરી. એક સમાહ ચાલેલ આ પક્ષીનિરીક્ષણમાં ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીમિત્રોએ પૂરતો રસ દાખવી વિવિધ પક્ષીઓની ૪૮ જાતોનો અભ્યાસ કરેલ. અતે નોંધનીય છે કે પાટક્ષ શહેરમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલ રસ્તાના જાડ પર સારી એવી સંઘાયાં સૂડા પોપટ (Roseringed Parakeet) રાતવાસો કરતા જોવા મળે છે.

આ કાર્યક્રમમાં નીચે મુજબના અવલોકનકારો હતા : વિનોદ કક્કર, અમિત મોઢી, સેજલ પટેલ, તૃપ્તા મામતોરા, પૂજા શિંગાળા, મેધા પટેલ, કિરણ પટેલ, સ્નેહલ મકવાણા, ડૉ. સંજયભાઈ દવે, જ્યદેવભાઈ ધાખલ.

લેમયંડાચાર્ય ડૉ. ગુ. યુનિવર્સિટીના કેમ્પસમાં જોવા મળેલાં પક્ષીઓ :

પક્ષીનું નામ ડોરબગલો (Cattle Egret)	નોંધ નિવાસી
--	----------------

કાળી કંકણસાર (Black Ibis)	નિવાસી
સમડી (Black kite)	નિવાસી
કપાસી (Black-shouldered Kite)	નિવાસી
મોર (Indian Peafowl)	નિવાસી
તેતર (Grey Francolin)	નિવાસી
ટિટોડી (Red-wattled Lapwing)	નિવાસી
દ્વારૂતર (Blue Rock Pigeon)	નિવાસી
દોલો (Eurasian Collared Dove)	નિવાસી
પોપટ (Rose-ringed Parakeet)	નિવાસી
ધૂકિયો (Greater Coucal)	નિવાસી
કોપલ (Asian Koel)	નિવાસી
ચીખરી (Spotted Owlet)	નિવાસી
નાંગો પતરેંગો (Small Bee-eater)	નિવાસી
ચાખ (Indian Roller)	નિવાસી
ધાટીટાંકશો (Common Hoopoe)	નિવાસી યાયાવર
અગન ચંડુલ (Singing Bush-Lark)	નિવાસી
અબાલી (Dusky Crag-Martin)	નિવાસી
મોરી અબાલી (Eurasian Crag-Martin)	યાયાવર
કાબરી અબાલી (Northern House Martin)	નિવાસી
શિયાળુ તારોડિયું (Common Swallow)	યાયાવર
તારોડિયું (Wire-tailed Swallow)	નિવાસી
કેરીપુંછ તારોડિયું (Red-rumped Swallow)	નિવાસી
જિરનારી કાગડો (Jungle Crow)	નિવાસી
કાગડો (House Crow)	નિવાસી
કાળો કોશી (Black Drongo)	નિવાસી
બ્રાહ્મણી કાબર (Brahminy Starling)	નિવાસી
વૈયું (Rosy Starling)	યાયાવર
કાબર (Common Myna)	નિવાસી
ધોડા કાબર (Bank Myna)	નિવાસી
શોભિગી (Common Iora)	નિવાસી
બુલબુલ (Red-vented Bulbul)	નિવાસી
રણ બુલબુલ (White-eared Bulbul)	નિવાસી
મોટું લેલું (Large Grey Babbler)	નિવાસી
ચટકી માખીમાર (Redthroated Flycatcher)	યાયાવર
પાન ફડકફડી (Plain Prinia)	નિવાસી
કાંબરો પિંડો (Pied Bushchat)	યાયાવર
ઓજળો પિંડો (Isabelline Wheatear)	યાયાવર
દેવચકલી (Indian Robbin)	નિવાસી
ડાંગી ધાનચીરી (Oriental Tree Pipit)	યાયાવર
પીળકિયો (Yellow Wagtail)	યાયાવર
વન પીળકિયો (Grey Wagtail)	યાયાવર

શક્કરખોરો (Purple Sunbird)	નિવાસી	(Yellow Wagtail) - ૨૦, પીતશિર પીળાડિયો (Citrine Wagtail) - ૩૦, કાણી બગલી (Pond Heron)
ટુશિયુ (White-throated Munia)	નિવાસી	- ૨, મોટો ચકવો (Great Stone-Plover) - ૨, મોટો
રાજ (Yellow-throated Sparrow or Chestnut-shouldered Petronia)	નિવાસી	હજ (Greater Flamingo) - ૩૦, શુલાભી પેણ (Great White Pelican) - ૨૦, ભોયચકવી (Ashy-crowned Sparrow-Lark) - ૫૦ થી ૬૦, લીલાપ્રગ (Common Greenshank) - ૨, મોટું લેલું (Large Grey Babbler) - ૪૦ થી ૫૦, વગડાઉ ટિટોરી (Yellow-wattled Lapwing) - ૨, ટિટોરી (Red-wattled Lapwing) - ૪.
સાંસાગર (Bonelli's Eagle)	નિવાસી	
મોરગંદમ (Crested Bunting)	નિવાસી	
શક્રો (Shikra)	નિવાસી	
(આ યાદીમાં કાબરી અભાલી (Northern House Martin)ને 'નિવાસી' કહેલ છે. 'હેન્દબુક' પ્રમાણે તેનો વ્યાપ કાશ્મીર-લાદાખથી અરુણાચલ સુધીનો હિમાલય દશાવેલ છે. આપણે ત્યાં જવલ્યે જ આવી શકે. શ્રી લવકુમાર ખાચરે ગુજરાતનાં પેખીઓના 'ચેક-લીસ્ટ'માં તેથી 'શિયાળું સુલાકાતી, અતિ અસામાન્ય (very uncommon)' કહેલ છે. શ્રી પારાશર્ય, બોડ અને ટાંકના અધતન 'ચેક-લીસ્ટ'માં તેને પથબાણ કે વિરલતમ (vagrant) ગણયું છે. ઉત્તર ગુજરાતમાં તે બારેમાસ જોવા મળે છે બર્દુ? મળતું હોય તો જ 'નિવાસી' કહેવાય. જરૂરી સ્પાદતા ઈચ્છનીય ગણું છું. શિયાળું તારોડિયું, કાબરો પિછો, ડાંગી ધાનચીરી અને પીળાડિયો ઉપરોક્ત બસે 'ચેક-લીસ્ટ' મુજબ યાચાવર છે, નિવાસી નહીં. - લા.)		

## નિર્ધિથ ધારેયા

અધ્યાપક, પર્યાવરણાચાર્ય સાચ વિભાગ,  
દેમંડનાર્થ રૂ. ગુ. બુનિ., પાઠ્ય



ધારી અને આસપાસનું પક્ષીનિરીક્ષણ  
વર્ષ ૨૦૦૮ના જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં ધારી  
અને તેની આસપાસનાં જળાશયો પરનું મારું પક્ષીઓનું  
અવલોકન આ પ્રમાણે રહ્યું છે:  
ખોડિયાર જળાશય, ધારી:

નાની મુરઘાબી (Common Teal) - ૭૦,  
ગિરજા (Cotton Teal or Cotton Pigmy Goose) - ૨, ટીલિયાળી બતક (Spot-billed Duck) - ૫૦, ચમચ્યો (Eurasian Spoonbill) - ૩૦, નાનો કાજિયો (Little Cormorant) - ૫૦ થી ૬૦, ધોળી કાંકણસાર (Oriental White Ibis) - ૧૦, ઢોર બગલો (Cattle Egret) - ૪૦ થી ૫૦, બગવી સુરખાબ (Brahminy Shelduck) - ૨, સીંગપર (Northern Pintail) - ૨૦, રાખોડી કારચિયા (Common Pochard) - ૧૫૦, ભગતંડુ (Common Coot) - ૭૦ થી ૮૦, ચોટીલી કારચિયા (Tufted Pochard) - ૬૦ થી ૭૦, નાની ડુબકી (Little Grebe) - ૬, રાખોડીશર પીળાડિયો

## નિર્ક્રિક્ષણ નોંધ

(Yellow Wagtail) - ૨૦, પીતશિર પીળાડિયો (Citrine Wagtail) - ૩૦, કાણી બગલી (Pond Heron) - ૨, મોટો ચકવો (Great Stone-Plover) - ૨, મોટો હજ (Greater Flamingo) - ૩૦, શુલાભી પેણ (Great White Pelican) - ૨૦, ભોયચકવી (Ashy-crowned Sparrow-Lark) - ૫૦ થી ૬૦, લીલાપ્રગ (Common Greenshank) - ૨, મોટું લેલું (Large Grey Babbler) - ૪૦ થી ૫૦, વગડાઉ ટિટોરી (Yellow-wattled Lapwing) - ૨, ટિટોરી (Red-wattled Lapwing) - ૪.

## ફાચરિયા તેમ (ગોવિંદપુર પાસે) તા. ૧-૨-૨૦૦૮ :

મોટો હજ (Greater Flamingo) - ૭૦, નાની મુરઘાબી (Common Teal) - ૭૦, ભગતંડુ (Common Coot) - ૧૫૦, સીંગપર (Northern Pintail) - ૨૫, બગવી સુરખાબ (Brahminy Shelduck) - ૫, પીળીચાંચ ઢોક (Painted Stork) - ૪, ફાટીચાંચ ઢોક (Asian Openbill Stork) - ૫, નાનો કાજિયો (Little Cormorant) - ૧૫૦+, ચોટીલી કારચિયા (Tufted Pochard) - ૨૦, કાળી કાંકણસાર (Black Ibis) - ૨૦, નાની ડુબકી (Little Grebe) - ૧૦, રાખોડી કારચિયા (Common Pochard) - ૨૫.

તા. ૧૩-૧-૨૦૦૮ના રેજ દીવમાં જાલંધર બીચ પર નીલ કસ્તૂરો (Chestnut-bellied Rock Thrush, Monticola rufiventris) ની માદા જોવા મળેલ.

દલખાણિયામાં 'રેવન્યૂ' વિસ્તારમાં ૪ મોરણંડમ (Crested Bunting) જોવા મળેલ.

## અનુભૂતિ ભન્દ

'ભારદ્વાજ', સરદારનગર-૧, બસ સ્ટેશન પાસે, ધારી ઉદ્પદ્રો



## પક્ષીનિરીક્ષણની પહેલી સફર

૩૦ ડિસે. '૦૭ની શુલાભી હંડીબરી સવારે અમે HSBC Birdrace અંતર્ાર્થ પક્ષીગણતરી માટે એકઠાં થયાં હતાં. અમારી ટીમે (ધાસર, પ્રતિક્ષા અને હું) આ માટે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પસંદ કર્યું હતું. સવારે ૮ વાગ્યાની આસપાસ એક બાધાનોક્યુલર્સ અને ડો. સલીમ અલીના પુસ્તકથી સજજ અમારી ટીમે સફર શરૂ કરી. મારા માટે પક્ષીનિરીક્ષણનો આ પહેલો જ અનુભવ હતો. ત્યાર બાદ તો જાણે નવાં નવાં પક્ષીઓ જોવા જાણવાનો ચસકો લાગી ગયો. વનસ્પતિ ઉદ્યાન પાસેથી શરૂ કરીને અમે એક પછી એક પક્ષીઓ જોતાં, ઓળખતાં ચાલ્યાં. પક્ષીજગતાનાં જાણકાર મારા સાથી મિત્રો આ પક્ષીઓ વિશેનો સામાન્ય

પરિચય મને આપતાં ગયાં. જ્યારે અમે કોઈ નવું પક્ષી જોઈએ ત્યારે તેઓ હો. સલીમ અલીના પુસ્તકમાંથી તે પક્ષીની તસવીર કાઢીને પણ મને બાતાવતા, જેથી તેની ઓળખ મારા મનમાં દઢ થતી. પહેલાં જ અનુભવમાં બધાં પક્ષીઓનાં નામ, તેમને ઓળખવાનાં ખાસ ચિહ્નો, તેમની ખાસિયતો, અવાજ વગેરે સમજવું શેડું અધરું હતું. પરંતુ પક્ષીનિરીક્ષણ માટેની કેટલીક પાયાની બાબતો સમજાઈ જે આજે પણ મને કામમાં આવી રહી છે.

મારા મિત્રોએ સમજવું કે પક્ષીનિરીક્ષણ માટે પાણી ભરેલી જગ્યા સારી કેમ કે ત્યાં પક્ષીઓ મળવાની સંભાવના વધુ હોય છે. થોડો સમય એક નાનકડી તળાવડી પાસે બેઠા બાદ એક શકરો (Shikra) જોવા મળ્યો. અત્યાર સુધી મોટા ભાગે સમજી સમજને જેના પર ધ્યાન જ નહોંતું આપ્યું તે એક અલગ જીતિ છે તે જાણવા મળ્યું.

પીલુડી (Salvadora) પક્ષીઓને ખૂબ પસંદ છે, એ વાત સફરની શરૂઆતથી હું પ્રતીક્ષા પાસે સાંભળતી રહી હતી; અને ખરેખર જ્યારે પીલુડી મળી ત્યારે આ વાતની ખાતરી થઈ ગઈ. તેનાં નાનકડાં લાલ માણેક જેવાં રસદાર ફળો ખાવા માટે પોપટ, બુલબુલ, ચકલી જેવા ઈ-જ પક્ષીઓ એકદાં થયેલાં હતાં. નાનો પટરંગો (Small Bee-eater) તો કેટલીય વાર આમતેમ ઊડતો જોયો હતો. પરંતુ જ્યારે પહેલી વાર દૂરભીનમાં જોયું તો તેનું રૂપ જોઈને દંગ રહી ગઈ! આટલા નાના પંખીમાં લીલા, પીળા ને ભૂરા રંગોની અદ્ભુત મેળવણી, આંખ પાસે કાજળ લગાવ્યું હોય એમ કાળી રેખા, ગળામાં આગળ નાનકડો કંઠલો અને સુંદરતામાં હજુ કંઈ ઓછું પડતું હોય તેમ પૂછડીને વધુ લાંબી અને છટાદાર બનાવતા તાર જેવાં પીછાં. આ રૂપાણું પંખી ઊડતો વખતે જે જતાત્માની શુલાંટો ખાય છે તે જોવાની પણ મજા આવી ગઈ.

ચાપ (Indian Roller), મોર-ફેલ ને તેમનાં બચ્ચાં જોતાં આગળ વધ્યા ત્યાં જ એક ઝાડ પર સોનેરી લક્કડાઘોડ (Lesser Golden-backed Woodpecker or Black-rumped Flameback) ની જોડ જોવા મળી. લાલચટક કલગી ને સોનેરી પાંખોવાળા આ કુરરતની કલાના સુંદર નમૂનાઓ જોવા એમે એક ટેકરા પર બેઠા. પરંતુ સવાર સવારમાં તેઓ ખાસ કરવાના મૂડમાં ન જણાયા અને ખાસ હરકતો ન કરતા ઉપરની ડાળીમાં બેઠાં રહ્યાં. તેથી અમે આગળ વધ્યા.

ત્યાર બાદ પર્યાવરણ વિજ્ઞાન વિભાગની પાછળ આવેલાં એક મેદાનમાં અમે દાખલ થયા. કોઈ નવું પક્ષી નજરે ન ચઢતાં અમે ત્યાંથી પાછા જઈ રહ્યા હતા, ત્યાં જ

દૂરથી આવતા ‘ટુક ટુક’ના અવાજે અમારું ધ્યાન ખેંચ્યું. અવાજની દિશામાં ખોજ કરતાં આખરે યાસરે એ પક્ષીને શોધી કાઢ્યું. એ હતું કંસારો (Coppersmith Barbet). દૂર એક ઝાડની ઉપરની ડાળીએ તે બેહું હતું. એ જાણવા મળ્યું કે, કંસારાને શોધ્યો હોય તો હંમેશા ઉપલી ડાળીઓ તપાસી લેવી જોઈએ; અને આ સૂચનાનો અમલ કરીને પછી તો મેં પણ મારા IIM કેમ્પસમાં સતત સાદ કર્યા કરતા આ પક્ષીને શોધી કાઢ્યું હતું. તેને દૂરભીનમાં જોયું તો ફરી એક અચરજ થયું. નાનપણથી સેંકડો વાર જેનો અવાજ સાંભળ્યો હતો એ પક્ષી તો મારા માટે બિલકુલ અજાણ્યું હતું! ઠડા લીલા રંગ ને ગળામાં રતુમડા પહૂંચાવ્યું આ નાનકડું અદ્ભુત પક્ષી વર્ષાથી મારી આસપાસ જ હતું; પરંતુ આજે પહેલી વાર હું તેને જોઈ રહી હતી.

પ્રાણીશાખ વિભાગ અને EMRC વચ્ચે એક મોટું મેદાન આવે છે. તેમાં ચક્કર લગાવી ધંટીટાંકડો (Common Hoopoe), કલકલિયો (Whitethroated Kingfisher) વગેરે જોતાં જોતાં લગભગ ૧૦-૩૦ વાગ્યે અમે બૌતિકવિજ્ઞાન વિભાગના પાછળના ભાગે પહોંચ્યા. ત્યાં એક ધીમી સીટી જેવા જુદા જ અવાજે અમારું ધ્યાન દોર્યું. નાનકડી ચકલી જેવું દેખાવું આ પક્ષી અમે શોધી તો લીધું, પરંતુ સૂરજનો તડકો તેની પાછળ હોવાથી તે ક્યાં પક્ષી છે તે સમજાયું નહીં. જે પાતળી ડાળ પર તે બેહું હતું, ત્યાંથી વાર ઘડીએ ઉડી, બે-પાંચ કૂટ જેટલું ચક્કર લગાવી, તે જ ડાળ પર અને તે જ જગ્યાએ પાછું આવીને બેસી જતું. સામેના ઝાડ પર તેનું જોડીદાર બેહું હતું. તે પણ આમ જ ઉડીને પાછું જતું હતું. અમે જગ્યા બદલી તેની વધુ નજીક ગયા. આ પક્ષી તો મારા સાથી મિત્રોએ પણ પહેલાં નહોંતું જોયું. હું દૂરભીનથી તેને જોઈ રહી હતી; તે દરમાન યાસરે પુસ્તકમાંથી એક પક્ષી શોધી કાઢ્યું. મેં સામે દેખાતા અને પુસ્તકમાંના પક્ષીને મેળવી જોયું. ટેકરીની ટોચ જેવું સ્લેઝ ઉપસેલું માથું, રાખોડી રંગ, ગોળ ચમકતી કાળી આંખો અને શરીર પર પીળાશ પડતો લીલો રંગ. એક પછી એક બાબતો સરખાવીને અમે તે અજાણ્યું પંખી ઓળખી કાઢ્યું. એ હતું તરવરિયો માખીમાર (Greyheaded Flycatcher)! એક નવું જ પંખી શોધી કાઢવાની ઉપલબ્ધિના સંતોષ સાથે અમે પક્ષીનિરીક્ષણ સફર પૂરી કરી.

આ બે-અઢી કલાકના સમયમાં ગુજરાત યુનિ.ના ‘સ્કૂલ ઓફ સાયન્સ’ આસપાસના વિસ્તારમાં અમને જાગીતાં ને અજાણ્યાં લગભગ ચોત્રીસ જાતનાં પક્ષીઓ જોવા મળ્યાં. એ જ કેમ્પસમાં મેં M.Sc. માટે બે વર્ષ ગાળ્યાં હતાં, પરંતુ મારી આસપાસમાં જ આવું સમૃદ્ધ પક્ષીજગત

રહેલું હતું તેની ખબર તો મને તે હિવસે જ પડી!

### જિગ્નિષા ઉપાધ્યાય

અ-દર, સચિવિનિ વાર્ષિક, શ્યામલ ચાર સા પાસે,  
સેટેલાઈટ, અમદાવાદ



### ગાંધીનગરમાં મોરબાજ

ગાંધીનગર ખાતે તા. ૨-૨-૨૦૦૮ના રોજ બપોરે ૨-૩૦ વાગ્યે સેકટર ૪એમાં વૃક્ષોની હારમણા પર મોરબાજ (Changeable Hawk-eagle) જોયું છે, જાણી ટોચ પર બેઠું હતું. આશરે ૧૫ મિનિટ સુધી તેને નિહાળી શકાયું.

સેકટર ૪એમાં જ એક વૃક્ષની નીચવી ડાળીએ બેસીને શકરા (Shikra)ને નાના કલકલિયા (Small Blue Kingfisher)નો આહાર લેતો જોયો. તા. ૧૧-૨-૨૦૦૮ના રોજ; સમય સાંજના ૪-૪૫નો.

### દીવા મુનિ

૩/૧, સેકટર ૪એ, ગાંધીનગર ૩૮૨૦૦૪

પક્ષીસંરક્ષણ મંડળ (Bird Conservation Society, Gujarat) દ્વારા સંકલિત થયેલા, ગુજરાત જાન્યુઆરી ૨૦૦૭ના ‘ઓશિયન વોટરબર્ડ સેન્સસ’ માં પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. આ પક્ષીઓની કુલ સંખ્યા ૪,૨૩,૪૨૧ થઈ હતી. સંખ્યાની દાખિયે આ આંકડો સારો કહી શકાય. એનું એક કારણ એ પણ છે કે, તેમાં ‘સુરખાબ નગર’ (Flamingo City) ખાતે નોંધાયેલા આશરે એક લાખ જેટલાં મોટાં હજ (Greater Flamingo) અને નંદા બેટ ખાતે નોંધાયેલ એક લાખ જેટલી બતકી તથા અન્ય જગયર પક્ષીઓનો સમાવેશ થાય છે. પરંતુ સંખ્યા ઉપરાંત જોઈએ તો એક હુંઘદ હડીકિત એ છે કે, ગણતરીમાં આવવી લેવાતાં સ્થળોની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગણતરીકારો પણ ઓછા થયા છે. આ એક ગંભીર વિચારણા માણી લેતી સમસ્યા છે, જેનું નિરાકરણ આવશ્યક છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત થતા, ‘વેટલેન્ડ ઈન્ટરરેશનલ’ દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં ગુજરાત હંમેશા અગ્રકમે રહ્યું છે. આ અગ્રસ્થાન જળવાઈ રહે તે જોવાની આપણી સૌની જવાબદારી છે.

૨૦૦૭માં ગુજરાતમાં થયેલી ઉપરોક્ત ગણતરીની વિગતો આ પ્રમાણે છે.



### ચેતવાની વળતા પ્રવાસ વખતે નોંધપાત્ર

#### સંખ્યા

કચ્છમાં ચેતવા (Garganey) સામાન્ય રીતે વળતા પ્રવાસના સમયે જ દેખાતી હોય છે અને ત્યારના ઉનાણું પોશાકમાં આંખ પરની સફેદ લીટી આકર્ષક હોય છે. આ વર્ષ માર્ચ-એપ્રિલ, ૨૦૦૮ દરમાન કચ્છમાં નીચેની જગ્યાઓએ તે જોવા મળી.

સ્થળ	તારીખ	સંખ્યા
ડીમસર તળાવ, તા. નખત્રાણા	૨૬-૩-૦૮	૧૦
ચેકડમ સુથરી, તા. અબડાસા	૬-૪-૦૮	૩
તેરા-નવિયા વચ્ચેનું તળાવ	૬-૪-૦૮	૪૦
તા. અબડાસા		
છારી દેઢ, તા. નખત્રાણા	૬-૪-૦૮	૧૦૦

ક્રમ	જિલ્લો	જલવાવિત સ્થળની સંખ્યા	પક્ષીઓની સંખ્યા
૧	અમરેલી	૨	૨૭,૫૮૨
૨	ભાવનગર	૧૩	૧૩,૨૨૪
૩	કચ્છ	૨૮	૨,૧૫,૨૧૭
૪	પંચમહાલ	૧૩	૨૫,૬૮૬
૫	પાટણ	૨	૩૭,૦૦૦
૬	રાજકોટ	૬	૧૦,૪૨૮
૭	સુરેન્દ્રનગર	૧	૫,૮૩૦
૮	વડોદરા	૧૨	૮૮,૩૫૪
	કુલ	૭૭	૪,૨૩,૪૨૧

આ પક્ષીગણતરીમાં ડેવી રીતે ભાગ લેવો તે બાબતે વધુ માહિતી માટે આપ રાજ્યના સંકલનકર્તા અને પક્ષી સંરક્ષણ મંડળ, ગુજરાત (BCSG)ના માનુષ મંત્રી ડૉ. ભવભૂતિ પારાશર્યનો સંપર્ક કરી શકશો :

Dr. B.M. Parasharya  
State Co-ordinator - AWC and  
Hon. Secretary, BCSG,  
B-8, Veterinary Staff Qrts.,  
Nr. Jagnath, Anand 388001  
Phone: 02692-262214 (R) 9825361036 (M)  
Email : parashrya@satyam.net.in  
parashrya@yahoo.com



## અબડાસા તાલુકામાં ઘાસિયા પ્રદેશમાં પછાઈ(harriers)નો રાત્રિનિવાસ

અબડાસા તાલુકાના કુણાઈયા ઘાસિયા પ્રદેશની તા. દ-૧૦-૦૭ની સાંજની મુલાકાત વખતે અહીં ૧૫૦+ જેટલી પછાઈ જમીન પર રાતવાસો કરતાં નજરે પડી. વળી આ જ તાલુકાના નિવિયા ઘાસિયા પ્રદેશની તા. દ-૧૦-૦૭ની સાંજની મુલાકાત વખતે ૩૦૦+ જેટલી પછાઈ જમીન પર રાતવાસો કરતી જોઈ. આ પછાઈમાં મોટા ભાગનાં ઉજળી પછાઈ (Pallid Harrier) હતાં જ્યારે પાનપછાઈ (Marsh Harrier) નોંધપાત્ર તથા પર્ટીપછાઈ (Montagu's Harrier) ઓછી સંખ્યામાં નજરે પડેલ.

આમ બસે ઘાસિયા પ્રદેશમાં ૫૦૦+ પછાઈ બસેરો કરતી હોવાની સંભાવના છે.

## કાશ્મીરી ચાખ (European Roller) ની નોંધપાત્ર હાજરી

આ વરસે કચ્છમાં સારો વરસાદ થયો હોઈ ખોરાકની વિપુલતાને કારણે સારી સંખ્યામાં કાશ્મીરી ચાખ જોવા મળેલ. ઋતુનો પ્રથમ કાશ્મીરી ચાખ તા. દ-૮-૦૭ના રોજ માધ્યાપરના વાડી વિસ્તારમાં જોયેલ. ત્યાર બાદ જોયાની વિગતો નીચે મુજબ છે.

સ્થળ	તારીખ	સંખ્યા
દેશલપર, તા. ભુજથી નારાયણ	૨૬-૮-૦૭	૪૪
સરોવર, તા. લખપત		
સામત્રા, તા. ભુજથી જખૌ	૫-૧૦-૦૭	૬૦
તા. અબડાસા		
નલિયાથી કુણાઈયા, કનકાવતી	૬-૧૦-૦૭	૧૦૧
તથા કોઠારા, તા. અબડાસા		
નલિયાથી કુણાઈયાથી જખૌ	૭-૧૦-૦૭	૮૫
તા. અબડાસા		
માનકુવાથી રવાપર,	૧૪-૧૦-૦૭	૬
તા. ભુજ - નખત્રાણા		

ઋતુનો છેલ્લો કાશ્મીરી ચાખ દેવળિયા વીડી, તા. અંજીર વચ્ચે તા. દ-૧૦-૦૭ના રોજ પાંચની સંખ્યામાં જોવા મળ્યો. આમ આ વરસે કાશ્મીરી ચાખે સારાં દર્શન આપ્યાં. તેઓ તીતીંદોડા, ખડમાંકડી તથા નાના સરિસૂપ વર્ગનાં પ્રાણીઓ આરોગતાં નજરે પડતા હતા.

## યાયાવર પક્ષીઓના આગમનની માહિતી

કચ્છમાં મારા વર્ષ ૨૦૦૬-૨૦૦૭ના	પક્ષીનિરીક્ષણ દરમ્યાન ઋતુના પ્રથમ જોયેલા યાયાવર
પક્ષીનિરીક્ષણ દરમ્યાન ઋતુના પ્રથમ જોયેલા યાયાવર	પક્ષીઓની માહિતી નીચે મુજબ છે.
પક્ષીનું નામ	તારીખ
શિયાળું નાની ડુલકી	૨૭-૮-૦૬
(Black-necked Grebe)	
ગુલાબી પેણ	૨૧-૧૧-૦૬
(Great White Pelican)	
ડુપેરી પેણ	૧-૧૦-૦૬
(Dalmatian Pelican)	
સરેદ ફોંક	૨૩-૧૨-૦૬
(European White Stork)	
ભગ્લી સુરખાબ	૧૨-૧૧-૦૬
(Ruddy Shelduck)	
ગયણો	૩-૮-૦૬
(Northern Shoveler)	
ચોટીલી કારગિયા	૧૮-૧૧-૦૬
(Tufted Duck)	
શિયાળું ટીસો	૧૫-૧૦-૦૬
(Long-legged Buzzard)	
શિયાળું સાંસાગર	૧૫-૧૦-૦૬
(Booted Eagle)	
પરદેશી ઝુમ્મસ	૨૮-૧૦-૦૬
(Steppe Eagle)	
પદારી ગીધ	૧૦-૧૨-૦૬
(Eurasian Griffon)	
ઉજળી પછાઈ	૩-૮-૦૬
(Pallid Harrier)	
પર્ટીપછાઈ	૧૩-૧૧-૦૬
(Montagu's Harrier)	
પાનપછાઈ	૩-૮-૦૬
(Western Marsh Harrier)	
મત્સ્યભોજ (Osprey)	૩૦-૧૨-૦૬
ધોતી	૨૮-૧૦-૦૬
(Eurasian Hobby)	
લરજ	૩૦-૮-૦૬
(Common Kestrel)	
કુજ	૨૮-૧૦-૦૬
(Common Crane)	
કરકરો	૧૨-૧૧-૦૬
(Demoiselle Crane)	
ટિલોર (Houbara)	૧૪-૧૧-૦૬
અબલખ	૨૭-૮-૦૬
(Eurasian Oyster-catcher)	

નિર્વિક્ષણ જોંધ					
નાની ખલિલી (Whimbrel)	"	"	કુહુકંઠ (Common Cuckoo)	૩-૮-૦૬	શિતોડ, તા. ભયાઉ
મોટી બારજા (Grey Plover)	"	જખૌના મીઠાનાં અગર	રવાઈડો (Short-eared Owl)	૨૭-૧-૦૭	ફેલગઢ બીડ, તા. રાપર
મોટી ટોંગીલી (Greater Sand Plover)	"	"	પતરંગો (Blue-cheeked Bee-eater)	૩-૮-૦૬	પલાસવા
નાની ટોંગીલી (Lesser Sand Plover)	"	"	કાશ્મીરી ચાખ (European Roller)	"	શિતોડ
ખલિલી (Curlew)	"	"	ઘીટીટાકણો (Hoopoe)	૧૬-૭-૦૬	માધાપર, તા. ભુજ
મોટો ગડેરો (Blacktailed Godwit)	"	"	સર્કંધૂલ (Greater Short-toed Lark)	૩-૮-૦૬	નાંદા બેટ
નાનો ગડેરો (Bartailed Godwit)	"	"	મોટો સર્કંધૂલ (Eastern Calandra-Lark)	૨૭-૧-૦૭	ફેલગઢ બીડ
શેતપુંછ ટિટોડી (Whitetailed Lapwing)	૧૮-૧૧-૦૬	છારી હંદ	શિથાળું તારોટિયુ (Common or Barn Swallow)	૨૭-૮-૦૬	વાધાબેર
રચાપગ (Common Redshank)	૨૭-૮-૦૬	જખૌના મીઠાનાં અગર	શિથાળું રેતઅભાવી (Sand Martin)	૩-૧-૦૭	છારી હંદ
કાચબરંગી (Ruddy Turnstone)	"	"	રેતીયો લટોરો (Rufoustailed Shrike)	૨૭-૮-૦૬	જખૌ
કાળાપગ ક્રિયડિયો (Little Stint)	"	"	વૈયું (Rosy Starling)	૧૬-૭-૦૬	માધાપર
કાળાપગ ક્રિયડિયો (Dunlin)	"	"	મસ્કતી લટોરો (Grey Hypocoleus)	૧૮-૨-૦૭	ફૂલાય રખાલ
શેતપાંછ ક્રિયડિયો (Curlew Sandpiper)	"	"	દિવાળી માધીમાર (Spotted Flycatcher)	૧૭-૮-૦૬	વાંદાય - લુંલા વચ્ચે
નાનો લીલાપગ (Marsh Sandpiper)	૩-૮-૦૬	મુંજુસર તળાવ,	ચટકી માધીમાર (Redthroated Flycatcher)	૨૦-૧૧-૦૬	ચાડવા રખાલ
લીલાપગ (Common Greenshank)	"	પલાસવા	તરસરિયો માધીમાર (Grey-headed Flycatcher)	"	"
ટપકીલી તુતવારી (Wood Sandpiper)	"	"	દુધરાજ (Asian Paradise Flycatcher)	"	"
શેતપુંછ તુતવારી (Green Sandpiper)	૨૩-૭-૦૬	ભીમસર તળાવ	મોટો કાશરો પિંડો (Desert Wheatear)	૨૭-૮-૦૬	દરાર વાંદ
નાની તુતવારી (Common Sandpiper)	"	તા. નખત્રાણા	ભીજો પિંડો (Isabelline Wheatear)	"	જખૌ, મીઠાનાં અગર
ટેલટીચાંચ (Pied Avocet)	૨૭-૮-૦૬	જખૌ, મીઠાનાં અગર	શ્યામકંઠ રણપિંડો (Stoliczka's Bushchat)	૬-૧૦-૦૬	લોરિયા ભીરંદિયારા વચ્ચે
કાળીપીઠ ધોમડો (Heuglin's Gull)	"	"	રણપિંડો (Rufous-tailed Wheatear)	૧૩-૧૧-૦૬	કુણાઈયા, તા. અબડાસા
ધોળી વાબગલી (Gull-billed Tern)	"	"	લાલપુંછ પિંડો (Grey Wagtail)	૧૪-૨-૦૭	પાંખીભીઠ ફૂલાય
કાશ્મીરી વાબગલી (Whiskered Tern)	૩-૮-૦૬	મુંજુસર તળાવ, પલાસવા	વનપાણકિયો (Lesser Crested Tern)	૧૭-૮-૦૬	રૂકમાવતી નાળ, માંડવી
નાની દરિયાઈ વાબગલી (Lesser Crested Tern)	૫-૨-૦૭	ભદ્રેશ્વર દરિયાકિનારો	દિવાળીધોરો (Grey Wagtail)	૧૩-૧૧-૦૬	નખત્રાણા

(White Wagtail)

શ્વામશિર ગંદમ " "

(Blackheaded Bunting)

ધોરિયો ગંદમ " "

(Greynaped Bunting)

બીટા, તા. અબડાસા

ઉપેડા-વમોટી નાની

વચ્ચે, તા. નાખત્રાલા

શાંતિલાલ એન. વરુ

જૂના વાસ, મંદિરવાળો ખાંચો, માધાપર, ઝુજ ૩૭૦૦૨૦



## રૂવાનું તળાવ

ઉનાળો બરાબર જાય્યો છે. રૂવાના રવેચી માતાના તળાવે કમળની ઋતુ ખીલી છે. પાનના ચંદ્રવામાં ટીલિયાળી બતક (Spot-billed Duck), ભગતહું (Common Coot), નાની ડૂબડી (Little Grebe) વગેરે, ખાસ તો ટીલિયાળી બતક - રાતવાસી કરતી હશે તેવું લાગે છે. તે એટલી સરસ રીતે પાનમાં ભળી જાય છે કે હલનયલન થાય ત્યારે જ ખબર પડે છે. નકટા (Comb Duck) પણ ઘણા ભેગા થાય છે. એક નડી બગલા (Purple Heron)ની જોડી પણ ચિયામાં રાતવાસા માટે આવે છે.

એક કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher) એપ્રિલ-મેના ગાળામાં આ તળાવે દેખાય છે.

તળાવ ધીમે ધીમે તેની જળસપાટી ગુમાવહું જાય છે. ઝૂન સુધીમાં સુકાઈ જશે તેવું લાગે છે.



## પંખીઓની અસામાચ વર્તણ્ણૂક - 'ગ્લોબલ વોર્સિંગ'ની અસર?

(૧) આમ તો વર્ષોથી નવેમ્બર મહિનો ઉત્તરતાં અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દૂધરાજ (Asian Paradise-Flycatcher) મારે ત્યાં મારા 'ખોટ'માં બેચાર દિવસ પૂરતો મહેમાન બનીને આવે છે. વહેલી સવારે અથવા સૂર્યાસ્ત વેળાએ ચીકૂડી, આંબા ઉપર અચૂક દેખાય. છવામાંથી જીવાત પકડે; ક્યારેક નીચે પણ આવી જાય.

ચાર પાંચ દિવસ પછી દૂધરાજ ક્યાં અદશ્ય થઈ જાય તેની ખબર જ ન પડે. ઉપરોક્ત સમયગાળામાં તે અહીંના વિક્ટોરિયા પાર્કની 'નર્સરી'માં પણ દેખાવા લાગે છે; એટલે હું માનું છું કે તે ગીરમાંથી સ્થળાંતર થઈને અહીં આવતાં હોવા જોઈએ.

પરંતુ આ વર્ષે ૧૧ ડિસે., '૦૭થી દૂધરાજ દેખાવું શરૂ કર્યું. આ પંખી દૂધરાજની માદા અથવા અપુષ્ટ નર હતો; કારણ કે તેને લાંબાં પીંછા ન હતાં તેમ જ તેની પાંખમાં સફેદ રંગ પણ નહોતો. તેની પાંખોનો રંગ રત્નમણો (chestnut) હતો. ડિસેમ્બરના અંતમાં પૂબ ઠંડી પરી ત્યારે તે જોવા ન મળ્યો. પણ ફરી માર્ચ મહિનાની પહેલી

તારીખથી 'ખોટ'માં નિયમિત રીતે દેખાવા લાગ્યો. ખાસ કરીને સવાર-સાંજના સમયે ચીકૂડી પર અચૂક જોવા મળી જાય. તેનો લાક્ષણિક કર્કશ અવાજ મારી ચાદરાસ્તમાં એવો તો બેસી ગયો છે કે તે દૂર બોલતો હોય તો પણ મને તેની હાજરીનો ખ્યાલ આવી જાય.

૧૮મી માર્ચ, '૦૮ના દિવસે છેલ્લી વાર મારા ધર્મપત્ની વીણાએ તેને 'ખોટ'માં જોયો. ત્યાર બાદ તે ચુમ થઈ ગયો. આમ તે ડિસેમ્બર માસમાં દેખાયા બાદ, ૧૯મી માર્ચથી ૧૮મી માર્ચ, '૦૮ સુધી; એટલે કે સતત ૧૮ દિવસ મારા 'ખોટ'માં દેખાવાનો વિકલ સ્થાપિત કરી ગયો.

(૨) રૂબી માર્ચથી ભાવનગરમાં ભરબોરે અને સાંજે તથા રાતના સમયે ભેજવાળો ઠંડો પવન ફૂકાવો શરૂ થયો. માર્ચ મહિનો ઉત્તરતાં આવો ઠંડો પવન ફૂકાય એથી ગરમીનો બિલકુલ અહેસાસ નહોતો થતો. ઊલંડુ, વાતાવરણ આલ્બાદક બની જતું. ઉનાળાનો જાણે ક્ષય થયો હોય અને ફરી ચોમાસું બેસવાનું હોય તેમ, મારા 'ખોટ'માં બારે માસ જોવા મળતી મોર (Indian Peafowl)-ની ટોળી ગેલવાં આવી ગઈ. આ ટોળીમાં એક ડાન પક્ષીઓ છે; જેમાં બે પુષ્ટ નર, બે નાના નર અને બીજી બધી માદાઓ હોય છે. માર્ચના ઉત્તારથી નર મોરે કણા કરવાનું અને માદાઓને રીજવવાનું શરૂ કર્યું. તેનો જોરદાર કેકારવ પણ ચાલુ થયો.

અધૂરામાં પૂરું હોય તેમ, હું કાયમ રૂવા ગામની સીમમાં ફરવા જાઉં ત્યાં, બાંબો હનુમાનજીના મંદિર પાછળના ખેતરમાં તલિયો તેતર (Painted Francolin) પણ ૨૬મી માર્ચ, '૦૮થી રોજ સવારે તેના લાક્ષણિક અવાજથી બોલીને માદાને આકર્ષતો હોય તેમ સાંભળવા મળ્યો. સામાન્યત: આ પક્ષી ઝૂન મહિનામાં તેના વંશવૃદ્ધિકાળના સમયે બોલે છે. વાદળા જેમ વધુ વેરાય તેમ તેની ઉતેજના વધે. અન્યારે આ માર્ચના છેલ્લા દિવસોમાં તેને બોલતો સાંભળી ખૂબ નવાઈ લાગી. અને આ બધામાં પરાકાણ સમાન પ્રસંગ તો ૪ એપ્રિલ, '૦૮ની સવારના સમયે થયો. તે સમયે તલિયા તેતરની સાથોસાથ વર્ષા લાવરી (Rain Quail) પણ બોલતી સાંભળી. રથી એપ્રિલે જ સાંજના ૬-૧૫ થી ૭-૧૫ પના ગાળામાં જોરદાર ૧.૫ થી ૨ પરસાદ અને બરફના મોટા કરા પડ્યા, જે બીજી દિવસે સાંજે પણ પડ્યા.

આમ આશરે ૧૦ દિવસના સમયગાળામાં કુદરતે જે તેનું સ્વરૂપ બદલી કરાલ દેખાડી, તેનાથી પંખીજગત તો નવાઈ લાગે તેટલી હેઠે છેતરાઈ ગયું. પણ પછી તરત જ કુદરતે બાળ સંભળી લીધી. બેત્રા દિવસ ભેજવાનું હું વાતાવરણ રહ્યા પછી ગરમીએ તરત જ જોર પકડ્યું.

આંદું બને ત્યારે થાય છે કે 'જ્લોબલ વોર્મિંગ'ની અસર હશે? કે બીજા કોઈ પરિબળો પંખીના વર્તનને ફેરવવામાં અસર કરતાં હશે?

#### નવનિત ભડુ

પ્લોટન. ૨૪, બ્લોક બી, 'માતૃસૂત્ર', બેંક સોસાયટી સુભાસનગર,  
ભાવનગર ૩૬૪૦૦૧

#### જીમનગર આસપાસ પક્ષીનિરીક્ષણ

તા. ૮-૮-૦૭ : આપણો થોડા વખતનો વટેમાર્ગુ મહેમાન (passage migrant) કાશ્મીરી ચાખ મળતાં આનંદ થયો. (કઈ જગ્યાએ? -સં)

તા. ૩૦-૮-૦૭ : સવારના સાત. લાખોટા તળાવના કાંઈ આવેલ આર. ટી. ઓ. ઓર્ડિસની પાણી પાસે નાની ઝૂબકી (Little Grebe)ની બે જોડી ચાર અને બે, બચ્ચાં સાથે નિહાળી. નજીકમાં જ જલમુરધી (Common Moorhen) હતી.

તા. ૧૧-૧૦-૦૭ : ખીજડિયા અભ્યારઝયની મુલાકાત વખતે મોટી ચોटીલી ઝૂબકી (Great Crested Grebe) પોતાનાં ત્રણ બચ્ચાંને ખવરાવતી નજીકથી જોવા મળી. તેની તસવીરો બેંગી.

તા. ૨૧-૧૨-૦૭ : પિરોટન. મારાથી ફક્ત ૧૪-૧૫ મીટર દૂર આશરે ૧૫૦ જેટલા શંખલા (Crab Plover) જમીન પર બેસીને સૂર્યસ્નાનની મજા માડી રહ્યા હતા. (વેખક એમ કેવી રીતે કહી શકે?) માનવીય લાગણીઓનું પક્ષીઓ ઉપર આરોપણ યોગ્ય નથી. - ડો. ટાટુ) તેમાંના કોઈ કોઈક પગે લંગડી લેતા આગળ જતા હતા, તો ક્યારેક બજે પગે જડપથી ચાલતા જતા હતા. હું વધારે નજીક ગયો તો લયસ્યુક અવાજ કરતા, બેઠેલા બધા શંખલા ઊભા થઈ ગયા અને ઊઠીને થોડે દૂર બેઠેલા બીજા મોટા ટોળામાં ભળી ગયા. બધા મળી આશરે ૩૦૦ જેટલા શંખલા હતા. તો વળી ૪૦ મીટર દૂર અબલખ (Eurasian Oystercatcher) તેમની કાબરી વેશભૂષાને લીધે આકર્ષક લાગતા હતા. તેમનાથી નજીક ૧૬ કાયબરંગી (Ruddy Turnstone) ફરતી હતી. મારી ઘણી નજીક ૨૦ જેટલી કાંઠલાવાળી નાની ઢોંગિલી (Little Ringed Plover) તથા ૪૦ જેટલી ઝૂલામણી ઢોંગિલી (Kentish Plover) ઢોડાદોડી કરતી ખોરાક ગોતતી હતી. દૂર ૧૦ મોટા ધોમડા (Pallas's Gull) આરામથી ઊભા હતા. ત્યાં અચાનક ૨૦૦ જેટલી દરિયાઈ તુંવારી (Terek Sandpiper) આવી ચરી. તેમનાથી થોડે દૂર ૪૦ ખલિલી (Eurasian Curlew) આરામમાં હતી.

તા. ૨૭-૧-૦૮ : ઢીચડા ગામતળાવ : ચિ. સિદ્ધાર્થને લઈને ઢીચડા ગામ પાસેના તળાવે ગયો. લોકોની અવરજીવરથી ટેવાયેલા અપુષ નાના હંજ (Lesser Flamingo) રસ્તાની બંને બજુનું પાણીમાંથી ખોરાક મેળવતાં હતાં. ત્રણ જુદી જુદી ટોળીમાં ૧૦૦ જેટલા ટીલિયા (Ruff) નજેરે ચડ્યા. ગયણા (Northern Shoveler) તો રસ્તાથી ૩-૪ મીટર છેઠે જ કાર્યરત હતા. થોડે આગળ જતાં અદ્ભુત દશ્ય જોવા મળ્યું. અમારાથી ફક્ત ૨૦ મીટર છેટેથી ૨૦૦ જેટલી ગુલાબી પેણ (Great White Pelican) તરત પસાર થઈ. તેઓ માછલીઓને ડિનારાના છીછરા પાણી તરફ લાવતી હતી. પછી એ છીછરા પાણીમાંની માછલીઓ ઉપર હુમલો ચાલુ કર્યો. આવો સુલબ શિકાર મળી જતાં પીળીચાચ ઢોક (Painted Stork) પણ તેનો લાભ લેવા ઉતીરી પડ્યા. ચમચા (Eurasian Spoonbill) તેમાં ભજ્યા. પણ થોડે દૂર ઊભેલા ૬૦ જેટલા મોટા ધોળા બગલા (Great Egret) તો કેવળ મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યા.

તથાવમાં આવેલા નાના નાના બેટ પર આશરે ૮૦૦ જેટલા નાના કાંજિયા (Little Cormorant)નું સામાજ્ય હતું. સહેજ આગળ આશરે ૪૫ પિયાસણ (Eurasian Wigeon), ૨૦ સિંગપર (Northern Pintail), ૩૦ નાની મુરધાબી (Common Teal), ગયણા, અસ્પ્ય ભગડાં (Common Coot) તથા ૪૦ જેટલી રાખોડી કારચિયા (Common Pochard)થી તળાવ શોભી ઊઠ્યું હતું. ૧૦૦ મીટર જેટલા અંતરે તેટલા જ મોટા હંજ (Greater Flamingo) લાંબી ડોકને વાળીને પીઠ પર રાખી આરામ કરતા હતા. ઉદ્પેરી પેણ (Dalmatian Pelican) આરામથી કાંઠા ઉપર ઊભી હતી તો વળી ૪ વંગાડું ટિટોડી (Yellow-wattled Lapwing) નજીકમાં ફરતી હતી. ચૂનાના પથ્થરોની ખાંડ પાસે દેવચક્લી (Indian Robin)નો અડધા સુધીના નારંગી પેટાળવાળો નર સુંદર લાગતો હતો. શ્યામકંઈ રણાપિણો (Desert Chat) પોતાના કાળા ગળા અને છાતીને લીધે આકર્ષક લાગતો હતો તે ચિ. સિદ્ધાર્થની નજેરે ચરી ગયો.

૨૦૦ જેટલા નાના કાંજિયાને વારંવાર ઝૂબકી મારી માછલી પકડતા જોઈને ધોમડાઓ (Gulls) તેમાં ભાગ પડાવતા ઉતીરી પડ્યા. જીમનગરથી નજીક અને શાંત સ્થળે આવેલ ઢીચડાનું આ તળાવ માણવા જેવી જગ્યા છે.

#### જ્યાપાલસિંહ જીજી

શ્રી અંબા સુવન, ૮, પટેલ કલોની, રોડ નં. ૩/૪,  
જીમનગર ૩૬૪૦૦૮



ડૉ. જ્યેશ જોધીની

આમુર શાહિનની નિરીક્ષણ નોંધ

(ચિત્ર : છેલ્લા મુખ્યપૃષ્ઠ પર)

- તારીખ : ૧૪ એપ્રિલ ૨૦૦૮, સમય : સવારે નવ વાગ્યે, સ્થળ : કાલીબેલ ગામથી દુલધા ગામના રસે, ડાંગ જિલ્લો.

- હવામાન પરિસ્થિતિ (એ દિવસનું) : ઉનાળાના શરૂઆતના દિવસો જેવી ગરમી, ખુલ્લું આકાશ, સપ્રમાણ સૂર્ય તડકો.

- વિસ્તાર વિષે : ઉત્તર ડાંગનો કુંગરાળ વિસ્તાર, રસ્તાની આજુબાજુનાં મોટાં ભાગનાં વૃક્ષો પર પાનખરની અસર, વૃક્ષોનાં પણ્ણો ક્યાં તો ખરી ગયા હોય ને વૃક્ષો સૂક્ષ્મ જેવા લાગતાં હોય અથવા તો પીળા - કથ્થાઈ થઈ ગયેલા પણ્ણો ખરવાની આણી પર હોય.

- આમુર શાહિન જે વૃક્ષ પર જોવા મળ્યું એ વૃક્ષ પર્શીઠીન હતું તે તેથી વૃક્ષ ઓળખી શકાયું નથી.

- પક્ષીનું વિશિષ્ટ સ્થાન / જગ્યા : બન્ને પક્ષી પર્શીઠીન વૃક્ષની ટોચ પર બેઠેલાં જોવા મળેલાં, લગભગ ચાલીસેક ફુટની ઊંચાઈએ ત્યાર બાદ, એક પક્ષી ઊંડાન લગાવી મોટો ચકરાવો મારી ફરી એ જ વૃક્ષ પર ઊતર્યું.

- અવાજ (Call) : નિરીક્ષણ દરમ્યાન એકેવી વાર નહિ.

- વર્તન : બન્ને પક્ષીઓ વૃક્ષ પર ચાંચ વડે એમનાં પીછાં સાફ્ કરી વ્યવસ્થિત કરતાં જણાયા.

- ઉક્યુન : એક પક્ષીએ નિરીક્ષણ દરમ્યાન ઉક્યુન કર્યું હતું. એ ઉક્યુન સામાન્ય શાહિન (Falcon)ની માફક ખૂબ જરૂરી હતું.

- પક્ષી અને નિરીક્ષક વચ્ચે સીધું અંતર - લગભગ ૫૦ ફુટ

- દૂરબીન : ૧૦ x ૫૦ Olympus કેમેરા - લેન્સ : કેનન - ૪૦-૧૧, ૧૦૦ - ૪૦૦ એમએમ.

- ઓળખ માટેનાં સંદર્ભ પુસ્તકો :

1 'Birds of prey of the Indian sub continent' by Rishad Naroji

2 'Birds of the Indian subcontinent' by R. Grimmett, C. Inskip

સાથી નિરીક્ષકો : (૧) ડૉ. જ્યેશ જોધી (૨)

શ્રીમતી જ્યોતિ જોધી (૩) મુનવ જોધી (૪) ધર્મશ દેસાઈ

ડૉ. જ્યેશ જોધી  
માનવ કલીનિક, અશોક ટાવર, સાંકુવા પાસે, નવસારી ઉદ્ઘાટન

આમુર શાહિન (લાલપગ શાહિન) વિશે

Eng. name : Amur Falcon (*Falco amarensis*)

નામ : આમુર, આમુરિયા કે આમુર લેન્ડ એ આમુર નદીનો મૂળપ્રદેશ છે. આમુર નદી ચીન અને રશીયાની સરહદ પરથી પસાર થાય છે અને આમુરિયા એ બન્નેની વચ્ચે આવેલ મૌંગોલિયા દેશનો ભાગ છે.

ઓળખ : આમુર શાહિનની પુખ માદા

- સામાન્યતા : ઉપરથી રાખોડી કથ્થાઈ

- સંક્રદ ગાલ

- ગળાની બન્ને તરફ પાતળી વેરા રંગની મૂછ


- છાતી અને પેટ પર આડી કાળી રેખાઓ

- રતુમં - આછા પીળા રંગનું નીચેનું પેટાણ

- આછાં રતુમંદાં પગનાં પીછાં, અને પુંછની મૂળ ભાગ

- પાંખમાં ખૂબ કાળી રેખાઓ, પાંખની પાછલી ધાર કાળી, પુંછનીમાં આછા કાળી, રેખાઓ, પુંછની હંવાડેથી સહેજ આગળ સહેજ પહોળો એવો કાળો પડ્યો.

વાપ અને ફેલાવો : સામાન્યતા : કાર્જીરંગા અને નામદાંના રાખ્યીય પાઈ અને આજુબાજુના વિસ્તારોમાં આ પક્ષી દેખાયાની નોંધ થયેલ છે. ગુજરાતમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્ર, પોરંદર, કચ્છના અભાતના ટાપુઓ અને વેળાવદરમાં એક એક નોંધ થયેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં આ પક્ષીની કોઈ નોંધ નથી.



આ પક્ષી મધ્ય સાઈબિરિયા, આમુર લેન્ડ, ઉત્તર ચીન, પૂર્વ ચીનમાં ઉનાળા દરમ્યાન પ્રજનન કરતું હોય છે ને શિયાળાની શરૂઆતમાં ભારત પરથી પ્રવાસ કરી પૂર્વ આફિકા અને દક્ષિણ આફિકામાં શિયાળો ગાળે છે.

એપ્રિલની ૧૪ની તારીખે ડાંગ જિલ્લામાં ડૉ. જ્યેશ જોધીને  
જોવા મળેલ આમુર શાહિન, આમુર તરફનો પરત પ્રવાસ  
હોઈ શકે.

ડૉ. પિપુલ પટેલ  
એક્સ-રે કલીનિક, અવી આર્કડ, વેક્ટર લાઇસ સામે,  
બાલર રોડ, વલસાડ ડેફોડી

## કચ્છમાં વિરલ પક્ષીઓની નોંધ

જુલાઈ, ૨૦૦૭થી એપ્રિલ ૨૦૦૮ વચ્ચે કચ્છમાં  
વિરલ તથા અલભ્ય એવાં સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ  
નીચે મુજબ જોયેલ છે

## સારસ વોચ

એપ્રિલના અંતથી મે મહિનાની શરૂઆતના સમયે  
અમદાવાદ નજીક, સરખેજથી ખોળકાના રસ્તે, ઘઉના  
ખેતરોમાં લાણાણી થઈ ગયા બાદ જે ઘઉં પડેલા હોય તે  
ખાવા માટે ત્યાં સારસ એકઠાં થાય છે. સૂર્યોદય પછી જોવા  
મળતાં સારસના સમૂહમાં ૧૨ પથી વધુ સારસ નોંધાં તેમાં  
બચ્ચાં પણ જોવા મળ્યાં. બપોરે આ સારસ, પાસે જ આવેલી  
સાબરમતીના કંઠે બેસી જાય છે.

## કાર્ટિક શાસ્ત્રી

અશોકવાડી, પંચવાટી, અમદાવાદ

### પક્ષીનું નામ

વોરાડ (Great Indian Bustard)

રંગીન બટાવડો (Painted Sandgrouse)

વર્ષ બટેર (Rain Quail)

ગુલાબી તુતી (Common Rosefinch)

લાલપુષ્ટ પિંહો (Rufoustailed Wheatear)

શામખિશ ગંદમ (Blackheaded Bunting)

દૈયડ (Oriental Magpie-Robin)

નીલ કસ્તૂરો (Chestnut-bellied Rock

Thrush)

કાબરી રામચકલી (Pied tit)

રણચંદૂલ (Greater Hoopoe Lark)

મોટો સર્ડ ચંદૂલ (Eastern Calandra Lark)

નાનો ચંદૂલ (Syke's Crested Lark)

સિરકિર (Sirkir Malkoha)

મસ્કતી લટોરો (Grey Hypocolius)

ઝાંખી લીલી ફૂટી (Greenish Leaf-Warbler) પીંગળેશ્વર, તા. અબડાસા

મત્સ્યભોજ (Osprey)

શાહી જુમસ (Eastern Imperial Eagle)

સ્થળ	તારીખ	સંખ્યા
નલિયા ઘાસિયો પ્રદેશ	૬-૧૦-૦૭	૧
કુણાઠિયા ઘાસિયો પ્રદેશ	૬-૧૦-૦૭	૨
મલિયા ઘાસિયો પ્રદેશ	૭-૧૦-૦૭	૫
બીજા, તા. અબડાસા	૨૦-૧૨-૦૭	૧૦
પાલાર ધૂના, તા. નખત્રાણા	૮-૩-૦૮	૧
ગળપાદર-રાયધાપર, તા. ભુજ	૧-૭-૦૭	૩
કૂલાય રખાલ તા. નખત્રાણા	૧૬-૧૨-૦૭	૨
પાંખીલીઠ, કોરો હુંગર, તા. નખત્રાણા	૨૨-૨-૦૮	૧
જુરા-લોરિયા, તા. ભુજ	૨૬-૩-૦૮	૨
વાંગયતીર્થ, તા. ભુજ	૨૭-૪-૦૮	૧૨ ૧
પોલાયિયા, તા. માંડવી	૨૦-૧૨-૦૭	૧
પાંખીલીઠ, કોરો હુંગર, તા. નખત્રાણા	૨૩-૧૨-૦૭	૧
ફોટ મહાદેવનું કાંટાળુ જંગલ, તા. નખત્રાણા	૧૬-૧૨-૦૭	૧
વમોટી નાની- વાલાપર બુંદ્રો	૨૦-૧૨-૦૭	૩
પાલાર ધૂનો	૮-૩-૦૮	શેરી ૨
ધોળાવીરા ગંગારી બેટ (ખડીર)	૧૭-૨-૦૮	૩
કુણાઠિયા ઘાસિયો પ્રદેશ, તા. અબડાસા	૧૭-૧૨-૦૭	૨૦
વમોટી નાની-બીજા વચ્ચેનું તળાવ તા. નખત્રાણા-અબડાસા	૨૦-૧૨-૦૭	૩
રામપર-ફોટ મહાદેવ, તા. નખત્રાણા	૧૬-૧૨-૦૭	૧
કૂલાય રખાલ, તા. નખત્રાણા	૨૩-૧૨-૦૭	૧
કૂલાય રખાલ	૧૬-૧૨-૦૭	૧
	૧૬-૧૨-૦૭	૨૫
	૨૩-૧૨-૦૭	૦૩
	૨૦-૧૨-૦૭	૧
	૨૨-૧૨-૦૮	૧
જાંખી લીલી ફૂટી (Greenish Leaf-Warbler) પીંગળેશ્વર, તા. અબડાસા	૨૦-૧૨-૦૭	૧
રૂદ્રમાતા તેમ, તા. ભુજ	૨૬-૩-૦૮	૧
છારી ઢંઢ	૨૩-૧૨-૦૩	૧૦
હોડકા ઠઠ (બશી)	૨૪-૧૨-૦૭	૩

નિર્વિક્ષણ નોંધ			
નાનો ટીસો (Common Buzzard)	ભીરંડિયારા-સેરવો (બન્ની)	૧૩-૧-૦૮	૨
સાંસાગર (Bonelli's Eagle)	છારી હંદ	૨૨-૨-૦૮	૧
શિયાળુ સાંસાગર (Booted Eagle)	હોડકા હઠ (બન્ની)	૨૪-૧૨-૦૭	૧
પઢી પણાઈ (Montagu's Harrier)	જુદેશ્વર મહાદેવ, તા. નખત્રાણા	૧૬-૧૨-૦૭	૧
તુરભી (Redheaded Falcon)	નિગળ તળાવ, તા. અંજાર	૩૦-૧૨-૦૭	૧
મોટો ધુવડ (Eurasian Eagle - Owl)	લોથિથર, તા. ભચાઉ	૬-૧-૦૮	૧
રવાઈડો (Short-eared Owl)	સેરવો હંદ (બન્ની)	૧૩-૧-૦૮	૧
રણ દશરથિય (Sykes's Nightjar)	લોરિયા ભીરંડિયારા (બન્ની)	૧૩-૧-૦૮	૧
ડુપેરી પેણ (Dalmatian Pelican)	પરજાઉ, તા. આબડાસા	૭-૧૦-૦૭	૧
ઓજળી ટોક (White Stork)	ભીરંડિયારા-લોરિયા, હોડકા (બન્ની)	૨૪-૧૧-૦૭	૩
કાળો ટોક (Black Stork)	કુણાઠિયા ઘાસિયો મદેશ	૧૭-૧૨-૦૭	૧
કાળીનોક ટોક (Blacknecked Stork)	નલિયા ઘાસિયો મદેશ	૨૨-૧૨-૦૭	૨
	લાલા-જખૌ, તા. અબડાસા	૭-૧૦-૦૭	૧
	પાલાર ધૂનો	૮-૩-૦૮ (જોડી)	૨
	છારી હંદ	૨૬-૩-૦૮	૧
	છારીહંદ વિસ્તાર	૨૩-૧૨-૦૭	૨
	પિંગળેશ્વર હુવો, તા. અબડાસા	૨૦-૧૨-૦૭	૧
	વેકરિયા હંદ	૨૪-૧૧-૦૭	૮
	છારી હંદ	૧૮-૧૨-૦૭	૩
		૨૨-૨-૦૮	૬
		૪-૩-૦૮	૬
	પિંગળેશ્વર, તા. અબડાસા	૨૦-૧૨-૦૭	૧
		૨૨-૧૨-૦૭	૧
	કનારા તળાવ ચોભારી, તા. ભચાઉ	૬-૧-૦૮	૧૨
	ઇતરી તળાવ, તા. ભુજ	૭-૧-૦૮	૮
	ફેલગઠ તેમ, તા. રાપર	૧૬-૨-૦૮	૧૦
	વેકરિયા હંદ (બન્ની)	૨૪-૧૧-૦૭	૭
	છારી હંદ	૨૩-૧૨-૦૭	૨
		૨૪-૧૨-૦૭	૧૦
		૨૨-૨-૦૮	૧૦
		૪-૩-૦૮	૧૦૦
		૨૬-૩-૦૮	૩૦
		૫-૪-૦૮	૩
	ભીરજોગ હંદ (બન્ની)	૧૩-૧-૦૮	૩
	સુથરી ચેક તેમ, તા. અબડાસા	૮-૩-૦૮	૧
		૨૨-૩-૦૮	૧
		૧૫-૧૨-૦૭	૪
	જોડી સાથે - ૨ બચ્ચાં		

( સુધારો : 'વિહંગ'ના એપ્રિલ-જૂન, ૨૦૦૮ના અંકમાં પૃષ્ઠ ૧૪ અને ૧૫ની 'વાત્રકનો કેચમેન્ટ વિસ્તાર' તથા 'દિવાળીધોડાનો સમૂહ' નિરીક્ષણ નોંધના લેખક શ્રી નયન મશ્યાર (ગાંધીનગર) તથા પૃષ્ઠ ૩૧ પર તા. ૭-૮-૨૦૦૭ની મોરબી ખાતેની ગાધની નોંધના લેખક અશોક મશરૂ (રાજકોટ) છે તેની નોંધ લેવા વિનંતી છે.)

ગિરજા (Cotton Pigmy-Goose)	સુથરી ચેક ટેમ, તા. અબડાસા	૨૪-૧૨-૦૭	૪
ધોળીઓંખ કારચિયા (Ferruginous Pochard)	ધારી ઢંઢ	૨૨-૩-૦૮	૧
શેતપુષ્પ ટિટોડી (White-tailed Lapwing)	માવજ તલાવડી, તા. ભુજ	૬-૪-૦૮	૧
દરિયાઈ તુતવારી (Terek Sandpiper)	ભીમસર તળાવ, તા. નખતાશા	૨૨-૩-૦૮ (જોડી) ૨	૨
ચંચળ (Red-necked Phalarope)	કુકમા ગામ તળાવ, તા. ભુજ	૧૩-૧-૦૮	૧
કાચભરંગી (Ruddy Turnstone)	દેવીસર તળાવ, તા. ભુજ	૧૬-૧-૦૮	૧
શંખલો (Crab-Plover)	ભદ્રેશ્વર નાળ, તા. મુંડા	૬-૧-૦૮	૫
દરિયાઈ ડ્રીચડિયો (Sanderling)	વેકરિયા ઢંઢ	૨૪-૧૨-૦૭	૧૦
દરિયાઈ વાબગલી (Sandwich Tern)	સુથરી ચેક ટેમ	૬-૪-૦૮	૫
	ભદ્રેશ્વર નાળ, તા. મુંડા	૬-૧-૦૮	૫
	ભદ્રેશ્વર નાળ, તા. મુંડા	૬-૧-૦૮	૨
	પિંગળશર દરિયાડિનારો, તા. અબડાસા	૧૭-૧૨-૦૭	૬
		૨૨-૩-૦૮	૨૨
		૨૪-૧૨-૦૭	૧
	શાંતિલાલ એન. વડુ		
	જૂના વાસ, મંદિરવાળો ખાંચો, માધાપર, ભુજ		



## ગીધ પર જાપતો

તા. ૧૩-૧-૨૦૦૮ના રોજ જસાધાર રેન્જમાં જાંબુરી બીટના ચોટીલી વિસ્તારમાં આ પ્રમાણે ગીધ જોવા મળેલાં :

ગીરનારી ગીધ (Long-billed Vulture) - ૨, પછારી ગીધ (Eurasian Griffon) - ૩, રાજગીધ (Red-headed Vulture) - ૩, સફેદપીઠ ગીધ (Indian Whitebacked Vulture) - ૭. આમ કુલ ૧૫ ગીધ જોવા મળેલ.

અંજિત ભડક  
વારી

રાજ્યમાં લુનત થઈ રહેલ 'સફાઈ કામદાર' પક્ષી ગીધના બચાવ માટે થોડ્ય દિશામાં પ્રયત્ન કરવામાં નહિ આવે તો નજીકનાં ભવિષ્યમાં ગીધ તસવીરમાં જ રહી જશે.

ફક્ત ગીધનું સર્વેક્ષણ કરવાથી કે પક્ષીનિરીક્ષણથી તેનો બચાવ થઈ શકવાનો નથી. આના માટે સૌં પક્ષીપ્રેમીઓએ સાર્કિય ભૂમિકા ભજવવી પડશે.

તા. ૨૧-૩-૦૮ આસપાસ દસ્લાણા ગામ (તા.

વિરમગામ)માં એક વ્યક્તિના બકરાને કૂતરાઓએ મારી નાંખ્યું . તે વ્યક્તિએ કૂતરા પ્રયે

કૂર વલાણ દાખી મરેલા બકરામાં 'ફોરેટ-જી' નામની જેરી દવા મૂકી, જેથી કૂતરાં તેને ખાય તો તે મરી જાય. કૂતરાની ગ્રાણોન્નિય તીવ્ર હોઈ તે બચી ગયાં; પણ ઉથી ૮ નિર્દોષ ગીધ મરણ પામયાં. દસ્લાણામાં ગયા મે, '૦૭થી સારી સંખ્યામાં ગીધ જોવા મળતાં; તે આ બનાવ પછી દેખાયા નથી. ત્યાં માળા પણ હતાં. તેમાંનાં બચ્ચાનું શુ?

ગીધ અનુસૂચિ-૧માં આવતું સંરક્ષિત પક્ષી છે. ઇન્નાં પણ વન વિભાગે કોઈ પગલાં ભર્યા હોય તેવું જણાતું નથી.

આપણે સૌ આ બાબતે નક્કર પગલાં વિચારીને અમલ કરીએ. એક પ્રથમ પગલાં તરીકે પત્ર લખીને ઉચ્ચ અવિકારીશીનું ધ્યાન દોરી શકાય.

અનિલકુમાર જે. પટેલ  
બી-૨૬, શાયોના સોસાયરી, ડેન્રોજ રોડ, કડી



તારીખ	સ્થળ	સંખ્યા	નોંધ
(૧) સફેદપીઠ ગીધ (Whitebacked Vulture)			
૬-૧૨-૦૭	દુમરા	૨૧	૧ માળો
"	સાંધાણ	૨	૧ માળો
"	કોઈચા	૬	૧ માળો
"	જખૌ	૮	૫ માળા
૧૭-૧૨-૦૭	ખીરસરા-ભાનાડા	૩	-
	તા. અબડાસા		
૩-૨-૦૮	માપર-દેહિયા, તા. માંડવી	૬	-
૮-૩-૦૮	દુમરા	૧૦	૫ માળા
"	સાંધાણ	૧૧	૧ માળો
"	જખૌ	૮	૨ માળા
૨૨-૩-૦૮	દુમરા	૧૩	૩ માળા
"	જખૌ	૬	૨ માળા
"	સુથરી	૩	-
૬-૪-૦૮	જખૌ	૭	-
"	દુમરા	૧૮	-
(૨) ખેરો (Scavenger Vulture)			
૬-૧૦-૦૭	નલિયા ઘાસિયો પ્રદેશ	૧	-
૬-૧-૦૮	લોખેશ્વર, તા. ભચાઉ	૫	-
૬-૧-૦૮	અંજાર વરસામેડી રોડ	૪૪	-
	તા. અંજાર		
(૩) પછાડી ગીધ (Griffon Vulture)			
૬-૧૨-૦૭	દુમરા, તા. અબડાસા	૧	-

૨૨-૧૨-૦૭	કુણાઠિયા, તા. અબડાસા	૩	-
૧૧-૧-૦૮	માપાપર, તા. ભુજ	૧	-
૨૧-૩-૦૮	સાંધાણ-સુપરી,	૨	-
"	દુમરા, તા. અબડાસા	૨	-

શાંતિલાલ વર  
માપાપર, ભુજ

તા. ૨૧-૩-૨૦૦૮ના 'દિવ્ય ભાસ્કર' અખબારમાં વીરમગામ પાસેના દસ્લાણા ગામમાં બાર ગીધ મયની નોંધ આવતાંની સાથે જ જાણે મારા અંગત સ્વજનનું મૂલ્ય થયું હોય એ રીતે મારા પર પક્ષીપ્રેમીઓના પૃથ્વીભર્યા કોન અને સંદેશા આવવા લાગ્યા. મૃત્યુનું કારણ શું એ પ્રશ્નનો મારી પાસે ઉત્તર નહોંતો. આ ગામનું નામ પણ મેં પ્રથમ વખત જ સાંભળ્યું હતું. આથી મેં ના.વ.સ. શ્રી અમિત કુમારને ફોન કર્યો. તેમણે મને જણાવ્યું કે હોળીની રજા હોવા છતાં પણ સ્થાનિક પરિસ્થિત વન અધિકારી પ ગીધના મૃત્યુને આપી ગયા છે, જે વનયેતના કેન્દ્ર ખાતે રાખેલ છે. હું, કંઈ કાદ્જુ અને મુકેશ આચાર્ય ત્યાં ગયા અને જોયું કે જગ્યાનો અભાવ હોવા છતાં શ્રી પરમારભાઈએ મૃત્યુદ્દોને સાચીને ફીજરમાં મૂડી દીધા હતા. ફીજરમાંથી કાઢીને પક્ષીઓને જોયા. પુલ વયનાં આ પક્ષીઓ મારા અંદાજ મુજબ આશરે દસેક દિવસ પહેલાં મર્યાદ હોવાં જોઈએ. તેમના મૃત્યુમાં કીડા પડી ગયા હતા. ફીજર ખોલતાવેંત આખો રૂમ વાસથી ભરાઈ જતો હતો. 'ઈન્ડિયન ઇન્સિસ્ટ્યુટ ઓફ મેનેજમેન્ટ' ખાતેથી આવેલ એક અન્ય મૃત ગીધ પણ એ ફીજરમાં હતું; આથી

ઘંટીટાંકણા (Common Hoopoe)નો સમગ્ર વર્ણ આછો રતૂમડો કે મેલો ગુલાબી (એટલે કે ગોરાડુ માટી જેવો) છે. એ વર્ણની એક્રપતાને બંગ કરતી, આંખને રૂચે એવી, એ પંખીના શરીર પર વચ્ચે વચ્ચે કાળી રેખાઓ કે પટાપટીઓ હોય છે. ઘંટીટાંકણામાં પ્રત્યેક પંખીનું શરીર અનન્યસાધારણ વિશેષ ભાતથી અંલંકૃત હોય છે. હું આ અદ્ભુત સત્યની સાક્ષી પૂરવાની હિત કરી શકું છું. અદ્ભુત એટલા માટે કે માત્ર બે જ રંગનો આશ્રય લઈને પ્રત્યેક ઘંટીટાંકણાનું શરીર જૂજવી ભાતથી શાશગારવામાં નિસર્ગનો કેટલો લોકોતર શક્તિપરિય આપણાને થાય છે!

વિચાર કરો. એ પંખીનું આખું શરીર એક જ (ગુલાબી) રંગે રંગાયેલું છે. એમાં ભાત પડે છે કાળા પટાને લીધે. આ પટો એટલે પ્રત્યેક પીઠાભાંનો કાળો ભાગ. એની નિકટના પીઠાભાંના કાળા ભાગ સાથે ભળી જવાથી ઉપજતી આકૃતિવિશેષ. આવી ભાત પાડનારા પીઠાં થોડા ભાગમાં રતૂમડાં, કદીક કાળાં ને કહીક ધોળાં હોય છે. પ્રત્યેક પીઠાં ઊરે છે અલગ અલગ, છતાં કોઈ નિયોગ નિયમને વશવર્તી, એની આસપાસનાં પીઠાંના સહકારથી, એ ચોક્કસ ભાત પાડવાને શક્તિમાન બને છે. અને એ ભાત પણ પ્રત્યેક દેશના પ્રત્યેક હૂપોની જુદી જુદી! કેવી અલોકિક ર્યાના!

હરિનારાયણ આચાર્ય 'વનેચર'  
'વનવગડાનાં વારીમાંથી' સંકલિત

મને ભય લાગ્યો કે તેમાં પણ ક્રીડા ન પડી શક્ય. આ ગીધના મૃતદેહમાંથી નમૂના લેવા બાબત પણ સમયા હતી. મોટા ભાગના મૃતદેહ સરીને જળી ગયા હતા. પોસ્ટમોર્ટમ માટે પાંચ ગીધના નમૂના પિંજીર (હરિયાશા) કે કોઈ અતુર મોકલીએ તો એક પક્ષીના રૂ. ૨૫૦૦/- દીઠ રૂ. ૧૨૫૦૦/- ની તાત્કાલિક વ્યવસ્થા કરવાની રહે. તે ઉપરાંત પેંકિગ કરવાની 'જેલી'ની તથા થર્મોકોલ બોક્સની વ્યવસ્થા, ત્રણ દિવસની ઉપરાઉપરી રજા, ફીજરમાં જગ્યાનો અભાવ, ક્રીડા વગેરે જેવા સવાલો તો ખરા જ.

વનવિભાગ દ્વારા મોર અને ગીધની સારવારના અનુભવી ડૉ. ગાંગટેને બોલાવવામાં આવ્યા હતા અને તેમને જડરી નમૂના કાઢીને આંદાંડ વેટરની કોલેજ ખાતે મોકલવાનું કહેવામાં આવેલું. શ્રી પરમારભાઈએ ગમે તેમ કરીને ફોર્મેલિન લાવી રાખેલ. હું તથા ભૂરજભાઈ ડોક્ટરની મદદમાં હતા. ડોક્ટરે ખૂબ મહેનતથી નમૂના કાઢ્યાં. ગીધની અંદરથી ખૂબ ક્રીડા નીકળતા હતા. આ નમૂનાને વ્યવસ્થિત રીતે અલગ અલગ શીશીમાં ફોર્મેલિન નાંખીને પેક કર્યા. એક ગીધના 'કોપ'માંથી ખોરાક મળી આવતા તે પણ પેક કર્યો.

પરંતુ જ્યારે આંદાંડ ખાતે ડૉ. ભવભૂતિ પાચાશર્ય સાથે વાત કરી તારે જાણવા મય્યું કે ત્યાં ડાઈક્લોફેનેકનો નહીં પરંતુ ટોક્સિકોલોજીનો ટેસ્ટ થાય છે; જેના માટેના નમૂનાને ફોર્મેલિનમાં નહીં પરંતુ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરવાના હોય છે.

આ ઘટનાના અનુસંધાને હું દસલાશા જઈને પરિસ્થિતિનો તાગ લેવા તા. ૨૩-૩-૨૦૦૮ના રોજ સ્થળ પર ગયો. એ પહેલા જાણવા મય્યું હતું કે, ત્યાં વીસ જેટલાં ગીધ મૃત્યુ પામ્યા છે. તેમના મરણનું કારણ ખેડૂતો દ્વારા ભૂંને મારવા માટે વપરાતી ફોરેટ-જી-૧૦ નામની દવા હતી. આ ડિસ્સામાં, બકરી ચચાવતા એક વૃદ્ધની બકરીને ફૂતરાઓએ વાયલ કરી હતી. તે બકરી મરી જતાં તેના પર તે વ્યક્તિએ ફોરેટ-જી-૧૦ છાંટી દીધી અને એ કારણે ગીધ મરી ગયાં.

હું મારી બાઈક લઈને દસલાશા પહોંચ્યો; રસ્તામાં સરસ રીતે ભૂટે ઈંગલ જેવા મય્યું. સમયના અભાવના લીધે વચ્ચે આવતી વીરપુર પાંજરાપોળની મુલાકાત લીધા વગર દસલાશા ગયો. ગામના ચોરે ગીધ અંગે વાત કરતાં મારા અંગે ઘણી પૂછપરછ કર્યા બાદ મને ગીધના મરણની જગ્યાએ લઈ ગયા. ગામના તળાવના ડિનારે વડ, લીમાં, પીપળા અને જંબુડા જેવાં મોટાં વૃક્ષો હતાં. સવારનો સમય

હોઈ તળાવમાં એક તરફ સ્ત્રીઓ કુપડાં ઘોતી હતી અને બીજી તરફ ઘણાં નાના બાળકો નહાતાં હતાં. ત્યાં જઈને ગીધ વિશે પૂછતાં બધાં જ બાળકો બહાર આવી ગયાં! તેમણે ગીધને જાડ પરથી પડતાં અને જેતરોમાં પડીને મરી જતાં જોયાં હતાં, જે વાત કરવાની તેમને ઉત્સુકતા હતી. કયાં ક્યાં વૃક્ષો પર ગીધના માળા છે અને બચ્ચાં છે કે નહીં તે વિશે પણ તેમને બખર ન હતી. બાળકોએ કર્વું કે, અમે ટી.વી.માં જોયું છે કે ગીધની સંખ્યા ઘટે છે, પણ ગીધ માંદા પડે તો શું કર્વું કે ક્યાં લઈ જવા તેનો ઘ્યાલ ન હોવાથી તેઓ ગીધને મદદ ન કરી શક્યા. બાળકો મને તેમની શાળામાં પણ લઈ ગયા; જ્યાં મોટા ગ્રામજનો પણ જોડાયા. તેઓએ મને ગીધના માળા બતાવ્યા જેની વિગતો નીચે મુજબ છે.

- મંદિરના લીમાંડ ઉપર : ૨ માળા

- ક્રૂયા પાસેના લીમાંડ ઉપર : ૨ માળા (જેમાં બે પુખ પક્ષી અને એક બચ્ચું જોવા મળ્યા)

- ગામમાં લીમાંડ પર : ૧ માળો

- ગામની અંદરના તળાવમાં જંબુડા પર : ૧ માળો.

રસ્તામાં છોકરાઓએ મારી ઓળખાણ સરપંચ સાથે કરાવી, જેમણે ગીધ બચાવવાના કાર્યમાં સહકાર આપવાની તૈયારી બતાવી.

તા. ૨૨-૩-૨૦૦૮ના રોજ ખૂલેટીના દિવસે સવારે ૧૦-૩૦ વાગ્યે કંદર્ભાઈ કાદ્ઝુનો ફોન આવ્યો કે કેન્ટોનમેન્ટમાં તેમના મિત્ર સંજીવભાઈના ઘરે એક બીમાર ગીધ પડ્યું છે. આ વાતથી મને પહેલો પ્રાસ્કો તો એ પડ્યો કે કોઈ માળામાંનું બચ્ચું કે એનાં માનબાપમાંથી તો કોઈ નહીં પડ્યું હોય ને?

ખૂલેટીનો દિવસ હોઈ જલદી કોઈ મિત્રો મળ્યા નહીં. છેવેટે વનચેતનાથી ભૂરજભાઈને સાથે લીધા. તેમને મોર પકડતાં આવડતું હતું; ગીધ પકડવાની ફાવટ નહોતી. અમે એક રૂમાલ, મોઝું અને દવાની 'કીટ' વગેરે સામગ્રી લઈ કેન્ટોનમેન્ટ જવા નીકળ્યા.

લશકરની સધન પૂછપરછમાંથી પસાર થઈ સંજીવભાઈના બંગલે પહોંચ્યા. તેમના બગીચામાં ૨૦ જેટલા મોર હતા. એક મોર ગીધને ભગાડતો જોવા મળ્યો; એટલે રૂમાલનો ઉપયોગ કરી ઈજા ન પહોંચે તેવી રીતે તેને પકડી લીધું અને ભૂરજભાઈને તેના મોં પર મોજું ચંડાંવાનું જણાવ્યું જેથી ગીધ વધુ ગભરાય નહીં. કાર હું

ચલાવતો હતો અને ભૂરજુભાઈ સરસ રીતે ગીધને જાળવતા હતા. સત્તામાં આવતા ખાડાથી પણ ગીધ ભડકી જતું હતું. થોડા સમય પછી તેણે લીલા રંગની ઉલટી કરી

જેનાથી ખ્યાલ આવ્યો કે તે આઘાતમાં (in trauma)

આવી ગયું છે. શક્ય તેટલી ઝડપે તેને વનચેતના લઈ ગયા. ત્યાં તેને વાંદરા પકડવાના પાંજરા પર કંતાન મૂકીને રાખ્યું. આ પાંજરું નાનું હતું પરંતુ ગીધ માંદું હોઈ થોડા દિવસ માટે ચાલે તેમ હતું. તા. ૮-૪-૨૦૦૮ સુધી ડો. ગાંગટેએ તેને સારવાર આપી. કંઈપ્પભાઈ તેને રોજ ખોરાક આપવા આવતા. એમી એપ્રિલે વનવિભાગની મંજૂરી લઈ આ ગીધને ડાખલા છોડવા ગયા. તેને છોડતાં ચાર-પાંચ ડગલાં ચાલી પછી ઊરીને એક કિમી દૂર એક નહેરની પાળી પર જઈને બેઠું. થોડી વાર એના પર નજર રાખી તો ફરીથી ઊરીને એક વૃક્ષ પર અન્ય ગીધ જોડે બેસી ગમેલું જોવા મળ્યું.

તા. ૨૪-૩-૨૦૦૮ના રોજ વનચેતના કન્દ્રથી શ્રી પરમારભાઈને ફીન આવ્યો. આદિત્યભાઈના ઘર સામેના માળા પાસેથી એક ગીધ નીચે પડ્યું હતું અને એક દિવસથી તેમણે પોતાના ઘરે રાખેલ હતું. જ્યાં લઈને IIM-ની પાછળની સોસાયટીમાંથી ગીધને લઈ આવ્યા. તેની દરશા પણ ખૂલ ખરાબ હતી. તેને વાંદરા પકડવાના બીજા પાંજરામાં રખાયું. દુભાગ્યે તે દિવસે ડોક્ટર ઉપલબ્ધ નહોતા. તા. ૨૫-૩-૨૦૦૮ના રોજ ડો. ગાંગટે આવ્યા ત્યારે આ ગીધ 'કોમા'માં હતું. તેમણે સારવાર આપી પરંતુ રાને ગીધ મરી ગયું.

તા. ૨૬-૪-૨૦૦૮ના રોજ IIM ખાતે આ વર્ષનું એક બચ્યું માળામાંથી પડી ગયું. ત્યાંના સત્તાવાળાએ

વનચેતના કેન્દ્રનો સંપર્ક કર્યો અને એક મોટા 'ડસ્ટ્રિબ્યુન'માં બચ્યાને પહોંચતું કર્યું. તેને સારવાર આપવા છતાં બે દિવસ બાદ તે મરી ગયું.

---

આ ચાર દિવસની વાત કરવા પાછળ મારો ખાસ ઉદ્દેશ એ કહેવાનો છે કે શેડ્યુલ-૧ના આ પક્ષી ઉપરાંત, બીજાં પક્ષીઓ પણ માંદા પડે કે ઈજા પામે તો તેમને સારવાર આપવા માટે 'પક્ષી'ના નિષ્ણાત ડોક્ટર હોવા જોઈએ. જંગલ ખાતાએ એક અલાયથી હોસ્પિટલ, સ્ટાફ, ડોક્ટર અને એભ્યુલન્સની વ્યવસ્થા રાખવી જોઈએ. આ ઉપરાંત તમામ પક્ષીપ્રેમીઓએ દરેક ગામમાં જઈ જાગૃતિનો કાર્યક્રમ કરવો જોઈએ તથા દરેક પાંજરાપોળમાં જઈ દવાનો દુરૂપયોગ ન થાય તે પણ જોવું જોઈએ. BCSG 'વલ્યુર સેલ' વતી પક્ષીપ્રેમીઓને આ મારી વિનંતી છે.

આ વર્ષ (૨૦૦૮માં) જાન્યુઆરીમાં ડાખલા ખાતે ૨૫ પછાડી ગીધ (Eurasian Griffon) જોવા મળ્યા. તે ઉપરાંત ડાખલામાં સૌ પ્રથમ વાર કાળું ગીધ (Cinereous Vulture) જોવા મળ્યું. આ ગીધ અહીં એક અઠવાંિયા માટે જ જોવા મળ્યું હતું. ત્યાર બાદ તે અન્યન્ય (કદાચ તેના ઋતુપ્રવાસમાં આગળ) જતું રહ્યું. આશરે એક મહિના પછી તે ફરીથી એક અઠવાંિયા માટે ડાખલા ખાતે દેખાયું. આથી મારું અનુમાન છે કે એ વળતા પ્રવાસમાં હશે. કાળા ગીધનો પ્રવાસમાર્ગ કર્યો છે અને તે કેટલો સમય ડાખલા રહે છે તેની માહિતી મેળવવામાં અન્ય પક્ષીપ્રેમી મિત્રો સહાય કરે તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય.

કાર્તિક શાસ્ની

અશોકવાડી, પંચવટી, અમદાવાદ



## પત્ર-કોતુ

મારા ઘરે મેં ખોખા દ્વારા ચકલીના માળાને મદદ કરવાનું કર્મ કર્યું છે. જેમાં ચકલી છેલ્લાં ત વર્ષથી માળો બાંધે છે. આ વર્ષથે ઉદરડીએ તેના માળામાંથી થોડો સામાન લઈને એક કબાટમાં પોતાનું ઘર બનાવ્યું.

મને 'વિહંગ' વાંચવાનું ગમે છે.

દ્વેન્દ્ર ચાવડા

આશિયાના ફ્લેટ્સ, ૧૬૬૫/ઓ-૩૨, ઘ.ન.બી-૧,  
સરદારનગર, ભાવનગર ૩૬૪૦૦૧

'વિહંગ'નો હું

ગ્રાહક હું. હું પણ  
ગામડાંઓમાં કે બહાર

ફરવા જવાનું થાય ત્યારે 'પક્ષીનિરીક્ષણ' કરવાની તક જરૂરી લઉં છું. વૃક્ષારોપણ મારી 'નિવૃત્તિ' પછીની પ્રવૃત્તિ છે. આ કેને કાર્ય કરતા લાગે છે કે પક્ષીઓ અને વૃક્ષો એકબીજાનાં પૂરક છે. દરેક વાયરે આ કેને કંઈ કરવું ધટે.



આપણે જુદી જુદી જાતનાં વૃક્ષો વાવીને ઉછેરીએ છીએ, જે એક સામાજિક કાર્ય છે.

પક્ષીઓ પણ આ સૂચિનો એક હિસ્સો છે. વૃક્ષો તેઓનું પ્રાકૃતિક ધર છે. વૃક્ષો પશુપક્ષીઓને છાયા તેમ જ ફળરૂપે ખોરાક પણ આપે છે.

પક્ષીઓ પણ વૃક્ષસર્વર્થનાનું કાર્ય તેમની રીતે કરતાં હોય છે; જેમ કે, વડ, પીપળો, કેરળો, ઉમરો વગેરે વૃક્ષોનાં ફળો ખાઈ પક્ષીઓ દૂર ઊરી ચરક કરે છે; જ્યાં વૃક્ષો કુદરતી રીતે જ ઊરી નીકળે છે. ક્યાંક જો ઉમરાનું એકાદ વૃક્ષ હશે તો તેની એકાદ કિ.મી. ત્રિજ્યાના વિસ્તારમાં ઉમરાનાં નાનાં રોપ જમીન પર જોવા મળશે; ખાસ કરીને ચોમાસામાં મુખ્યત્વે નીચે મુજબનાં વૃક્ષો કે વનસ્પતિના ફળ પક્ષીઓને ખોરાક છે :

વડ, પીપળ, પીપળો, કેરળો, અંજર, લીમડો, આંબો, ઉમરો, ખીજડો, ગુંડા, ચીકુ, જામફળ, ટીમરુ, દાડમ, દ્રાક્ષ, પીલુડી, રાયશા, સીતાકળ, શેતૂર વગેરે. તો

આવો, આપણે પણ પક્ષી માટે આવાં વૃક્ષો ઉછેરીએ.

### મહિપતસિંહ ચુડાસમા

અ-૩૭, ન્યુ મહાવીરનગર, કલિંકું, ધોળકા

ભાવનગરમાં દ્વારાનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત રેલવે કર્મચારી તરીકે મારી ઓળખ આપી આ પત્રની શરૂઆત કર્દું છું. કોટેગ્રાડી સાથે પક્ષીનિરીક્ષણ વગેરે શોખ ધરાવું છું. નિવૃત્તિ પછીના મારા હાલના રહેઠાણની ભૂગોળ એવી છે કે શહેરના સાવ પૂર્વ છે એનોએમ રેલ ઉપર એકાદ કિ.મી. દૂર જતાં વસ્તીવાળો વિસ્તાર પૂરો થાય છે, ત્યાં છે. ત્યાં એક તળાવાડી હોવાથી પાણીકંઠાના થોડાં પક્ષીઓ જોવા મળે છે.

અમારા રહેઠાણ વિસ્તારમાં તેનું ‘આંબાવાડી’ નામ સાર્થક કરતાં વૃક્ષો હજુ ઠીક ઠીક બચ્યાં છે. જૂનાં, વિશાળ ફળિયામાં વૃક્ષોવાળાં મકાનો તોડી, નાના ખોટ પાડી ટેનામેન્ટ કે બહુમાળી એપાર્ટમેન્ટ બને એટલે સર્વપ્રથમ વૃક્ષોનો નાશ થાય છે. આમ વૃક્ષો ઓછાં થતાં પક્ષીઓના

### અંગણે લીલા

માણસમાત્રને નંબું નંબું જોવા-અનુભવવાળો આનંદ આવે છે. આશર્થ શોધવાની વૃત્તિ એને સહજ છે, અને તે બાળક, કુમાર અને યુવાનમાં અતિશય હોય છે. બાળકને અને ડિશોરને તો આ દુનિયામાં બધું જ નંબું નંબું લાગે છે. સુખ અને હુંઘ, વ્યાપિ અને મૃત્યુ, રૂપાંતું અને વરાવું, મોર અને ઊટ, ગાય, ધોડો અને હાથી બધું જ નવાઈબર્યુ હોય છે. આ સહજવૃત્તિનો વિનિયોગ કેળવણીમાં થાય છે. કૌતુકવૃત્તિને સંતોષી વિદ્યાર્થીના જ્ઞાનનું પ્રસારણ થાય છે, ને એ જ્ઞાન તત્ત્વથી: કૌતુકમૂલક અને આનંદપ્રદ હોય છે, કેમ કે કુદરતી ઝંખના તો જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ દ્વારા સંતોષ સુખનો અનુભવ કરાવે છે. નવી દીપિ નવી તૃપ્તિ આપે છે.

સકળ વિશ્ય, સકળ નિસર્ગ, આ મેદાન, પર્વત, નદી, સરોવર, સમુદ્ર, આકાશ, સૂરજ, ચન્દ્ર, તારા બધું કૌતુકજનક છે. એમાં વ્યવહારનાં પશુ, પંખી અને માનવ તાજી નજરને અદ્ભુતતાનો આસ્વાદ કરાવે છે. પંખીઓ જોવા, એમને નામથી ઓળખવાં, એમનો વ્યવહાર જ્ઞાણવો, એમની લીલા નિહાળવી, અને એ જોઈ વર્કજર્વર્થ કે નરસિંહરાવની માદફક ગાઈ ઊઠંબું એ જીવનનો એક વિશિષ્ટ આનંદ છે. એ વ્યવસાય હોય તો પણ વ્યવસાય લાગે નહિ. વસંતત્રસુમાં તમે સવારે કોયલને સાંભળી શકો. સૂરજ વહેલો ઊગશે તેમ તેમ તે વહેલી બોલશે અને વસંત ઊતરસાં શ્રીભરમાં તેના ટહુકા પણ ખૂબ વધશે. પ્રભાતમાં કોયલ પછી દૈયડ બોલશે, પછી બુલબુલ બોલશે, દરજાદો અને કુંભાર પણ સવાર ભરી દેશે. જરા વધારે આયાસ કરશો તો કોયલ અને કાગડાની સ્પર્ધા ગગનમાં દેખાશે. કોયલ ઓછી બળવાન પણ વધુ ચ્યાળ હોવાથી ચુટુર કાગડાને હંફાવે છે. એના માળામાં પોતાના ઈડાં મૂકી દે છે. મોરનો પિષ્યાવેભવ, પીળકનો રંગવેભવ, બુલબુલની બેઠક, કાબરનો દસ્સો, સક્કરખોરાનો ફૂલમવેશ, દરજાદાનું દરજાકામ, લેલાના કુદકારા, વેણાના ઊડણ નિહાળવા સારુ આયાસ કે ખર્ચ કરવો પડે તેમ નથી. સવાર સાંજના આકાશના રંગો જોવામાં, ચન્દ્ર અને તારાઓ વિલોકનવામાં, મેઘની ગર્જના કે વિદ્યુતના ચમકારાથી ચમકવામાં, વનસ્પતિનો વિવિધ પત્ર પુષ્પ ઇણ વેભવ માણસવામાં, તેમ પંખીઓની લીલા નિહાળવામાં કશો શ્રમ પડતો નથી.

એમનો કલરવ જ શ્રમહર લાગશે. આ આનંદમય અભ્યાસ માટે વૃત્તિના અતિસન્ધાનની જ જરૂર છે.

નિસર્ગનો આ આનંદસિંહ નિરંતર આમંત્રે છે. આપણાં ચંચુ અને શ્રોત જાગતાં હોય તો બસ!

- વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(ઓત : ‘ગુજરાત સમાચાર’ ૧૩-૨-૦૮માંથી સાભાર)

કુદરતી રહેણાં નાશ પામવાથી તેમની સંખ્યા ઘટતી જાય છે. તે છાતાં જે કંઈ પક્ષીઓ જોવા મળે છે તે વિશે એક નાનો પ્રસંગ લખી મોકલું છું.

ઇજુ ૮-૯ વર્ષથી બંધાયેલ ૧૨ ટેનામેન્ટની અમારી સોસાયટીમાં એક મધુમાલતીની વેલ છેક અગાસી સુધી પહોંચી છે. લગભગ ડિસેમ્બર '૦૭ અસપાસ આ વેલમાં નજીકના ટેનામેન્ટની પહેલા માળની બારીથી સહેજ ઊંચે હોલી (Little Brown Dove) એ માળો બનાવ્યો હતો.

જાન્યુઆરીની મધ્યમાં એક સવારે નવ વાગ્યાના સમયે હું મારા ટેનામેન્ટની બાલ્કનીમાં ઊભો હતો ત્યાં મટિયા લટોરા (Rufous-backed or longbilled Shrike) નું જોકું વેલની નજીક વીજળીના તાર ઉપર આવીને બેનું. તરત જ મને હોલીનો માળો ચાદ આવ્યો. પરંતુ કંઈ જોખમ હોવાની શક્યતાનો ખ્યાલ આવે તે પહેલા એક લટોરો વેલની જાડીમાં ગયો. ત્યારે હોલી માળામાં ઈડાં/બચ્ચાનું રક્ષણ કરતી હતો, તે લટોરાના આકમણને લીધે માળો છોડી ઊરી ગઈ અને લટોરો હોલીનાં બચ્ચાને ચાંચ્યો મારી ચોચમાં પકડી ઊરી ગયો. આજે ત્રણ અઠવાદિયા પછી સાંજે પાંચના સુમારે આ લાયું છું ત્યારે પણ વીજળીના થાંભલે લટોરો દેખાય છે. એ જ વેલમાં શક્કરખોરો (Purple Sunbird) માળો બનાવે છે. તેનું ભાવિ કેવું હતો?

અશોક ઈન્ડુપ્રસાદ શાસ્કરી

૧૦૮૮, આંબાવાડી, ભાવનગર ૩૬૪૦૦૧

■ 'વિહંગ' ગ્રીઝ ૨૦૦૭ મળી ગયું. આમાર. ખૂબ સરસ અંક બહાર પડેલ છે. તમારું બાવાસાહેબનું રેખાચિત્ર દાદ માગી લે છે.

'વિહંગ'માં રહી ગેલા નીચે મુજબના મુત્રણદોષ અંગે આપનું ધ્યાન ખેંચું છું. પૃ. ૭ પરના મારા લેખમાં Desert Finchની જગ્યાએ Trumpeter Finch હોવું જોઈએ. પૃ. ૩૧ (ગીધ પર જીપતો)માં તા. ૨૨-૪-૨૦૦૭ના રોજ પોલાદિયા ખાતે સફેદપીઠ ગીધ તથા તુમરા ખાતે પહારી ગીધની નોંધમાં 'મજનન ચાલુ' હોવાનું ભૂલથી છપાઈ ગયું છે.

પાના નં. ૧૫ પર શ્રી જ્યંત મદ્ધર જગ્ણાવે છે કે ૧૫૦ જેટલા દિવાળીઘોડા સ્થળાંતર માટે એકઠા થયા હતો. ૨૪-૧૧-૨૦૦૭ની તારીખ છે તો એટલા વહેલા સ્થળાંતર માટે એકઠાં ન થાય. તેઓ કોઈક જગ્યાએ રાતવાસો કરવા એકઠા થયા હતો. દિવાળીઘોડા આપણે ત્યાં એમિલ સુધી હોય છે; તેથી નવેંબર પહીનો વહેલો ગણાય. વળી આ પક્ષી રશિયા સ્થળાંતર કરે છે તેવા 'શિર્જિંગ' પુરાવા કર્યમાંથી મળ્યા છે. તેથી શ્રીલંકા સ્થળાંતર કરે છે તે બરાબર નથી.

પાના નં. ૨૩ પર 'અમારો કર્યણો પક્ષીનિરીક્ષણ પ્રવાસ' નોંધમાં તલિયો તેતર (Painted Francolin) જોયાનું જગ્ણાવેલ છે, જે કર્યમાં થતું નથી. તેને બદલે તેતર (Grey Francolin) હોઈ શકે.

શાંતિલાલ વડે  
માધાપણ, કર્ણા

## ઉત્તર ગુજરાતનાં જળાશયો (૪)

ડૉ. પી. ઐસ. ઢક્કર

'સેટેસાઈટ ઈમેજ' તથા નકશો : મુખપૂર્ક ર  
મહેસાશા તથા બનાસકાંઠા જિલ્લાનાં જળાશયો :

મહેસાશા જિલ્લાના કરી તાલુકાના થોળા તળાવથી અમે પક્ષીગણાતરીની શરૂઆત કરી હતી. હું અમદાવાદી શીલજ, રાંચરડા થઈ થોળા સુધી સાયકલ પર પક્ષીનિરીક્ષણ માટે જતો હતો. ૧૯૮૭માં એક વખત હું મારી ઓફિસના ફોટોગ્રાફર સ્વ. શ્રી જગહીશભાઈ શેઠ સાથે તેમના સ્કૂટર પર પક્ષીઓના ફોટો પાડવા નીકળ્યો હતો. અમે શીળજીથી રાંચરડા થઈ સાંતેજ-જેઠલજ રસ્તા પર કલોલ તરફ જતા હતા ત્યારે જેઠલજ પાસે એક નાના છોકરાએ અમને જગ્ણાબ્યું કે થોળના તળાવમાં બહુ જીવદાં (પંખી) છે, તેથી અમે થોળા તળાવ પર ગયા હતા. અમારા આશ્વર્ય વચ્ચે અમે

જોયું કે, આ સરોવરમાં બહુ જ વિવિધ પ્રકારનાં નાનાં, મધ્યમ તથા મોટાં કદનાં પક્ષીઓની હાજરી હતી. આટલી વિશાળ સંખ્યામાં તથા આટલી વિવિધતા એક સ્થળ પર, મેં પહેલી જ વાર થોળના તળાવમાં જોઈ હતી! મારા માટે મારી જિંદગીમાં પક્ષીઓની દસ્તિએ કહું તો આ એક વિશિષ્ટ દિવસ હતો. ત્યાર બાદ તો હું વાર્ષિક થોળા તળાવની મુલાકાત લેવા લાગ્યો. અહીં મોટાં હંજે (Greater Flamingo) મજનન કર્યું હતું. તેથી એક વખત દૂરદર્શનના અધિકારી શ્રી ઉર્વીશ દવેને ત્યાં લઈ ગયો હતો. દૂરદર્શન ટીમ સાથે હતી ત્યાંના મોટા હંજના માળા, નાનાં બચ્ચાનું તથા વિવિધ પક્ષીઓની વિડીયો ફિલ્મ તૈયાર કરી દૂરદર્શન સમાચારમાં તે પ્રસારિત કરેલ. ત્યાર બાદ હંજે

અમદાવાદ પાસેના સરોવરમાં પ્રજનન કર્યું છે તે અંગેના લેખ ‘ટાઈબ્સ ઓફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ તથા ‘બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી’ના સામયિકમાં પણ પ્રસિદ્ધ થયા હતા. એક નોંધ ‘ન્યુઝલેટર ફોર બર્ડ્વોર્સ’ જે બેન્ગલોરથી પ્રસિદ્ધ થતું હતું તેમાં પણ છાપાઈ હતી.

સ્વ. ડૉ. સલીમ અલી તે સમયે રાજ્યસભાના સભ્ય હતા. તેમના પ્રયત્નોના લીધે થોળ સિંચાઈ તળાવમાંથી થોડા ભાગને ‘થોળ પક્ષી અભયાશ્ય’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

શ્રી સુમન આર. શાહ, જે મુંબઈથી દર વર્ષ નિયમિત અમદાવાદ આવતા હતા અને અમારી સાથે જ્ઞાશયોના સર્વેકષણ તથા પક્ષીગણતરીના કાર્યમાં જોડાતા હતા તેમને પણ શરૂઆતમાં હું એક વખત થોળ તળાવ પર લઈ ગયો હતો. તેમણે ‘ન્યુઝલેટર ફોર બર્ડ્વોર્સ’માં થોળ તળાવમાં જોયેલા પક્ષીઓ વિશે લખ્યું હતું અને થોળ તળાવને તેમણે મીની કેવલાઈવ-ઘાના (ભરતપુર) તરીકે ગણાવ્યું હતું. આ અંગે એક લેખ ‘સેન્ટર ફોર એન્વીરોનમેન્ટ એજ્યુકેશન’, અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થતા સામયિક ‘અમદાવાદ’માં પણ પ્રસિદ્ધ થયો હતો.

મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં થોળ વિસ્તારમાં કૃષ્ણકમોટ (ચોખા)નું સારું ઉત્પાદન મેળવવા માટે બેદૂતોને સહેલાઈથી પાણી મળી રહે તે માટે ગાયકવાડ સરકાર દ્વારા થોળના સિંચાઈ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં નદીઓની દસ્તિએ જોઈએ તો મહેસાણા અને સાબરકાઠા જિલ્લાની છદ સાબરમતી દ્વારા નક્કી કરેલ છે. આમ સાબરમતી નદી એક ખાસ મોટી નદી જગ્ણાવી શકાય. મહેસાણા જિલ્લાના ધરોઈ ગામ પાસે સાબરમતી નદી પર બંધ બાંધી મોટા જગ્ણાશયનું સર્જન કરવામાં આવ્યું છે, જે ધરોઈ બંધ - જગ્ણાશયના નામે જ ઓળખાય છે.

ધરોઈ જગ્ણાશય પર મુખ્ય બંધ તરફથી જઈએ તો ખાસ પક્ષીઓ જોવા મળતાં નથી, પરંતુ જે વર્ષે પાણી ઓછું હોય તે વર્ષે ત્યાં ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસી તથા યાયાવર પક્ષીઓ જોવા મળે છે. ઘણી વખત ઊડા પાણીમાં જોવા મળતાં પેણ (Pelican) તથા મોટા કાજિયા (Great Cormorant) અહીં મોટી સંખ્યામાં જોઈ શકાય છે.

ધરોઈ બંધના સાબરકાઠા જિલ્લાના વિસ્તારમાં સહેલાઈથી પહોંચી શકાતું હતું. મહેસાણા જિલ્લા તરફનો વિસ્તાર કુંગરાળ હોવાથી, અમને રસ્તાઓની પૂરી

જાણકારી નહીં હોવાથી તેમજ અમારી પાસે સમય ઓછો હોવાથી મહેસાણા જિલ્લામાં આવેલ ધરોઈ જગ્ણાશયના વિસ્તાર તરફ અમે ફર્યા ન હતા.

મહેસાણા જિલ્લાની નાની નદીઓમાં રૂપેણા, ખારી અને પુષ્પાવતી ગણાવી શકાય. પરંતુ આ નહીંઓ પર કોઈ બંધ બાંધવામાં આવ્યા નથી.

મહેસાણા જિલ્લામાં અન્ય માનવસર્જિત જગ્ણાશયોની વાત કરું તો, ખેરાળું પાસે ગાયકવાડ સરકાર દ્વારા નિર્મિત ચીમનાબાઈ સરોવર ગણાવી શકાય. પરંતુ ઘણા વર્ષો સુધી અમને તેમાં પાણી જોવા મળ્યું ન હતું. વડનગરના શર્મિદા તળાવની ગણાના પણ સારા જગ્ણાશયમાં કરી શકાય.

આ ઉપરાંત કડી તાલુકાના ચંદ્રાસાં ગામનું તળાવ પણ ઘણું સારું છે. અહીંનું વાતાવરણ આહુલાદક છે. તળાવની ચારે તરફ વડ, આમલી, પીપળ, જંબુ જેવાં મોટાં વૃક્ષો આવેલા છે. તેમના પર વાંદરા તથા મોર ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. વાલમના તળાવમાં પણ યાયાવર પક્ષીઓ ઘણી વખત જોવા મળે છે.

કલોલ પાસે અમદાવાદ મહેસાણા ‘રેલવે લાઈન’ પાસે આવેલ ઈસંડ ગામનું તળાવ પણ એક સુંદર જગ્ણાશય છે. અહીં દેશી બાવળની સંખ્યા ખૂબ જ છે. આ તળાવમાં પણ ઘણી સારી સંખ્યામાં સ્થાનિક રહેવાસી તથા યાયાવર પક્ષીઓ જોવા મળતાં હતાં.

અમે અમદાવાદથી સાબરકાઠા જિલ્લાના હિમતનગર, વડાલી થઈ, ધરોઈ તેમ પર જતા હતા. ધરોઈથી મોકેશ્વર તેમ પર જઈ, પાલનપુરથી દાંતીવાડા જગ્ણાશય પર જતા હતા. કેટલીક વખત સીધા મહેસાણાથી પાલનપુર થઈ દાંતીવાડા જગ્ણાશય પર જતા હતા. તો કોઈ વખત વિરમગામ, શંખેશ્વર, રાધનપુરથી પાટણ જિલ્લાનો વિસ્તાર ફરીને વળતી મુસાફરીમાં દાંતીવાડા જગ્ણાશય પર પહોંચતા હતા.

બનાસકંઠા જિલ્લામાં નદીઓની દસ્તિએ જોઈએ તો સાબરમતી, સરસ્વતી, ઉમરદસી, બાલારામ, બનાસ, સીપુ, લડભી, રેલ, વ્હો અને ખારી નદીને ગણતરીમાં લઈ શકાય.

બનાસકંઠા જિલ્લામાં બનાસ નદી પર દાંતીવાડા પાસે બંધ બાંધી જગ્ણાશયનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે સીપુ નદી પર દાંતીવાડા અને પાંથાવાડા વચ્ચે બંધ બાંધવામાં આવ્યો છે, જેથી સીપુ જગ્ણાશયનું સર્જન થયું છે. આ ઉપરાંત વડગામ તાલુકાના મોકેશ્વર પાસે

સરસ્વતી નહી પર બંધ બાંધી જળાશયનું સર્જન કરવામાં આવ્યું છે.

મોકેશ્વર તેમ પર અમે શરૂઆતમાં જતા હતા ત્યારે બે વર્ષ સુધી કર્દી ખાસ પક્ષીઓ અમને જોવા મળ્યાં ન હતાં. પરંતુ છીછરા કંઠાવાળા વિસ્તારમાં અમે જઈ શક્યા ન હતા.

દાંતીવાડા જળાશય પર પણ ઘણી મોટી સંખ્યામાં વિવિધ રહેવાસી તથા યાચાવર પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતમાં પહેલી વખત અમને રાજહંસ, દાંતીવાડા જળાશય પર જોવા મળ્યા હતા. દાંતીવાડા જળાશયના કંઈ આવેલ માળીવાસ ગામમાં લોકો સાથે વાતચીત કરતાં અમને જાણવા મળ્યું હતું કે ધોળા ફૂકડા જેવાં પક્ષીઓ ઘઉં તથા ચણાનાં ખેતરો એક રાતમાં સાંદ કરી નાંખે છે. તેથી આ ‘સર્કેદ ફૂકડા’ જોવાની અમારી ઈચ્છા પ્રબળ બની અને અમે ત્યાં રાત રોકાઈ ગયા. બીજા દિવસે સવારથી અમે આ વિસ્તારમાં ભમણ શરૂ કર્યું. અમારા આશ્રય વચ્ચે અમને અહીં રાજહંસ (Barheaded Goose) જોવા મળ્યા અને તે પણ એક-બે જેવી નાની સંખ્યામાં નહીં પણ ત્રણસો કરતાં પણ વધારે સખ્યામાં!

આ સમયે હું અમદાવાદના ‘વિક્રમ સારાભાઈ કોચ્ચુનીટી સાયન્સ સેન્ટર’માં બાયોલોજી વિભાગમાં તથા ‘સ્પેસ એક્ઝ્યુક્યુશન સેલ’માં માનદ્દ સેવા આપતો હતો. ત્યાં ડૉ. ડીસોઝાને તથા કોશિક ડિશ્ટ્રિબ્યુનને વાત કરતાં અમે સેન્ટર તરફથી ટેક્સિસ્કોપ તથા કેમેરા લઈ આ પક્ષીઓની ફોટોગ્રાફી કરવા દાંતીવાડા જળાશય પર ગયા હતા. તેનો ‘રિપોર્ટ’ ત્યાર બાદ ‘કોચ્ચુનીટી સાયન્સ સેન્ટર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. દાંતીવાડાથી અમે ડીસા, ડિપોટર, ભાભર, સોનેથ, મોવાડા તથા સૂર્યાગમ જતા હતા.

સોનેથમાં ગામની દક્ષિણ દિશામાં મહાદેવનું મંદિર આવેલું છે. બાજુમાં સાતમી સદીનું એક જૂનું મહાદેવનું મંદિર છે. ત્યાંથી કોટડા સહેરનો ઉત્તરનો ભાગ નજીકમાં જ છે. આ વિસ્તારમાં બહુ જ મોટી સંખ્યામાં

યાચાવર તથા સ્થાનિક રહેવાસી પંખીઓ જોવા મળે છે. ઘણી વખત અહીં મોટાં હંજ તથા નાના હંજના બચ્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે.

સૂર્યાગમના તળાવમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસી તથા યાચાવર પક્ષીઓ જોવા મળે છે. સૂર્યાગમથી અમે કચ્છના મોટા રણમાં આવેલ નડ બેટ પર જતા હતા. અહીં નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. રહેવા તથા જમવાની અહીં સગવડ મળી રહે છે. ત્યાંથી બાજુમાં આવેલ જગમલ બેટ પર અમે જતા હતા. આ બેટ પર એક આડબંધ બાંધવામાં આવેલ છે, જેવી સારા જળાશયનું નિર્માણ થયું છે. આ જળાશયમાં હંજ તથા હંજનાં બચ્યાં સારી એવી સંખ્યામાં જોવા મળે છે તેવી માહિતી મળતાં અમે ત્યાં ખાસ કાર્યક્રમ ગોઠવીને ગયા હતા. આ જળાશયમાં અમને ૨૦ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ નવ જેટલી સર્કેદ સુરખાબ (Common Shelduck) જોવા મળી હતી, જે અગાઉ હું ‘વિહંગ’ (ઓકટો-ડિસે. ’૦૭) માં જણાવી ગયો હું.

આમ કચ્છના મોટા રણનો બનાસકાંઠા જિલ્લાની હઢને અડીને આવેલો વિસ્તાર પક્ષીઓની દિશિએ ઘણો અગત્યનો ગણાવી શકાય. અહીં મહાકાળ (Raven), રણચંડૂલ (Hoppoe Lark) જેવાં પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે.

આ સિવાય દાંતીવાડા અને સીપુ તેમની વચ્ચેના વિસ્તારમાં આબુ પર્વત તરફ ગાંડા બાવળના ગાઢ જંગલની વચ્ચે એક જળાશય આવેલું છે, જે હડમતિયાના નામે ઓળખાય છે. અહીં બિલારી માઈમારોની હાજરી અવશ્ય જોવા મળે છે, જેઓ માઇલી પકડવાનો ‘કોન્ટ્રેક્ટ’ રાખે છે. આ જળાશયમાં પણ સારી એવી સંખ્યામાં સ્થાનિક રહેવાસી તથા યાચાવર પક્ષીઓ જોવા મળે છે.

આમ, પક્ષીઓની વિવિધતાની દિશિએ બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લાઓ ઉત્તર ગુજરાતમાં મહાત્વનું સ્થાન ધરાવે છે એમ કહી શકાય.

૨૪, ન્યુ નંદનવન સોસાયટી, ઈસરો પાછળ, અમદાવાદ-૧૫

□

## નગરકોવર પક્ષી અભયારણયાનો

### પક્ષીઓના રથાળિષ નામો : એછ અભયારણ

પક્ષીઓને ઓળખવાની ભાતભાતની પ્રથાઓ મચાવિત છે. દરેક પક્ષીને પોતાનો એક આગવો રંગ, આકાર અને કદ હોય છે, જે તેનાં શારીરિક લક્ષણો તરીકે

ઓળખાય છે. આ લક્ષણો પરથી જ દરેક પક્ષીની એક આગવી ઓળખ ઊભી થઈ શકે છે. શારીરિક લક્ષણો ઉપરાત દરેક પક્ષી, તેના અવાજ, બેસવાની રીતભાત,

ઉડુંયન પદ્ધતિ, હળનચલન કિયાઓ, ઈડાનો રંગ, ઈડાનું કદ, માળાનો પ્રકાર તેમજ બચ્ચાનાં લક્ષ્ણો પરથી પણ ઓળખાય છે. તુદુપરાંત પક્ષીવિદી પક્ષીને તેની એક આગામી નામકરણ પદ્ધતિથી પડ્યા ઓળખે છે, જેમાં પક્ષીઓનો સમૂહ (group), કુળ (family), અંગ્રેજી નામ (common English name), વૈજ્ઞાનિક નામ (scientific name) અને પ્રાદેશિક/પ્રાંતીય નામ (regional name) જેવાં વિવિધ પાસાંઓનો સમાવેશ થાય છે. કોઈ એક જ પક્ષી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ સ્થાનિક નામો ધરાવે છે. ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પક્ષીનિરીક્ષણનો છેલ્લાં ૧૨ વર્ષનો મારો શોખ તેમજ અનુભવનો નિયોઝ એ સૂચયે છે કે તે ગુજરાતના શહેરીજનો કરતાં ગામડાંમાં કે જગલોમાં કુદરતનાં સાગ્રાધમાં વસતાં લોકો મોટા ભાગનાં પક્ષીઓને સ્થાનિક નામોથી જ ઓળખે છે. તેઓ પક્ષીઓનાં અંગ્રેજી કે ગુજરાતી નામોથી નહિવતું કે ઓછા વાકેફ હોય છે. આવાં સ્થાનિક નામો વૈજ્ઞાનિક સમુદ્દરને તેઓનાં સંશોધનકાર્યમાં ખૂટી કરી પૂરી પાડે છે.

આ લેખમાં ગુજરાત રાજ્યના સૌથી મોટા રક્ષિત જળપાવિત વિસ્તાર - નળસરોવર પક્ષી અભ્યારણ્ય (અંદાજિત વિસ્તાર - આશરે ૧૨૦ ચો. ક્રેમી.) ના રહેવાસી તેમજ મુલાકાતી પક્ષીઓનાં સ્થાનિક નામો અંગે ડાથ ધરેલા એક અભ્યાસ વિશેની માહિતી આપેલી છે. શિયાળા દરમ્યાન ૧ થી ૧.૫ લાખ જેટલાં દેશ-દેશાવરનાં વિવિધ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાત લે છે. ચોમાસા દરમ્યાન સમગ્ર વિસ્તાર હ થી ૮ ફુટ પાણીની સપાટીમાં ગરકાવ હોય છે. નળ સરોવરમાં લગભગ ૨૫૦ થી ૩૦૦ જેટલાં નાનાં મોટા બેટ આવેલા છે, જેનો ઉપયોગ પદાર જ્ઞતિનાં લોકો અસ્થાપી વસવાટ તેમજ માઇન્ટારી માટે કરે છે. નળસરોવરમાં બામકી અને ભોગાવો એમ બે મુખ્ય નદીઓનો પ્રવાહ છલવાય છે, જેનો ઉપયોગ મુખ્યત્વે સિંચાઈ-ખેતીમાં થાય છે. સમગ્ર વિસ્તારની ફરતે મુખ્ય ગામોમાં ધરજી, શિયાળ, મેણી, વેકરિયા, કાયલા, શાહપુર, નાની તથા મોટી કઠેચી, ભગવાનપુર, રાણાગઢ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય જ્ઞતિઓ ઉપરાંત આ ગામોમાં લગભગ ૭૦ થી ૮૦ હજાર જેટલા પદાર લોકો વસવાટ કરે છે. ઉનાણા તેમજ ચોમાસા દરમ્યાન મોટા ભાગના પદારો મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહે છે; જ્યારે અમુક પદારો શિયાળા

દરમ્યાન પાક-ધાન ઉપરાંત શિયાળું અને સ્થાનિક પક્ષીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નળસરોવર પક્ષી અભ્યારણ્ય ખાતે છેલ્લાં કેટલાંય વર્ષોથી વસ્તી પદાર કોમ. તેમના રોઝિંદા વ્યવહારમાં પદાર ભાષાનો ઉપયોગ કરે છે. ભાષાશાસ્ત્રીઓમાં એમ મનાય છે કે પદાર ભાષા ગુજરાતી, કચ્છી તેમજ સિંધી એમ ત્રણ ભાષાઓના મિશ્રણથી ઉદ્ભવેલી એક સ્વીકૃત ભાષા છે. નળસરોવર પક્ષી અભ્યારણ્ય ખાતે નોંધાયેલ તેમજ જોવા મળતાં પક્ષીઓનાં પદાર ભાષામાં સ્થાનિક નામોની યાદી અતે ૨૪ કરેલ છે જે તૈયાર કરવામાં સતત ત્રણ વર્ષ (૨૦૦૪ થી ૨૦૦૬) થી અવિરતપણે મહત્વનું યોગદાન આપનાર તેમજ મારા સંશોધનકાર્યમાં સદાય સાથ આપનાર નળ સરાવરના જાણીતા પક્ષીનિરીક્ષક શ્રી કાસમ સમા સિદ્ધાંધી, તેમના પુત્ર રમણન કાસમ સમા, નળ સરોવરની ફરતે આવેલાં પદાર ગામના સર્વે સરપંચ ભાઈઓ, તેમજ સમગ્ર પદાર જ્ઞતિના લોકોનો હું હદ્યપૂર્વક આભાર માનું હું. ગુજરાતના પક્ષીવિદોના અથાગ પ્રમાસથી રાજ્યના અન્ય રક્ષિત વિસ્તારોનાં પક્ષીઓનાં સ્થાનિક નામોની પણ એક આવા જ પ્રકારની યાદી પ્રગટ થઈ શકે તેમ છે, જે પક્ષી-સંશોધનમાં એક આગામું પ્રદાન સાબિત થશે.

**નળસરોવર પક્ષી અભ્યારણ્યનાં પક્ષીઓની સ્થાનિક (પદાર) ભાષામાં નામ :**

ગુજરાતી નામ/સમૂહ	સમૂહ/અંગ્રેજી નામ	સ્થાનિક નામ
Grebes		
મોટી ચોટીલી ડુબકી	Great Crested Grebe	ટામ
શિયાળું નાની ડુબકી	Black-necked Grebe	એડુલાં
શિયાળું મોટી ડુબકી	Red-necked Grebe	એડૂલું
નાની ડુબકી	Little Grebe	ટોયલાં
Pelicans		
ગુલાબી પેણ	Great White Pelican	વડો પેણ
Cormorants/Shags		
મોટો કાજિયો	Great Cormorant મોટો જળકાગડો	

પદ્ધતિઓનાં રથાનિક નામો					
નાનો કાળિયો	Little Cormorant	નાનો જીજાકાગડો	નાનો હંજ	Lesser Flamingo ગઈણ	Swan, Geese and Ducks
વચેટ કાળિયો	Indian Cormorant	કાળિડા	ગાજ હંસ	Greylag Goose	ઘોડા
	Darters		રાજ હંસ	Bar-headed	પટાળિયા
સર્પશ્રીવ	Darter	ખાંભી		Goose	ઘોડા
	<b>Herons, Egrets and Bitterns</b>		નાની સિસોટી બતક	Lesser Whistling સજજ	
કબૂત બગલો	Grey Heron	રાખિયો રેલ		Duck	
નરી બગલો	Purple Heron	વડો રેલ	ભગવી સુરખાબ	Brahminy	શંખલી
લીલી બગલી	Little Green	નાની રેલ		Shelduck	
	Heron		સિંગપર	Northern Pintail	પરાણ
કાણી બગલી	Indian Pond	હાયકો	નાની મુરધાબી	Common Teal	ટોપિયો
	Heron		ટીલિયાળી બતક	Spotbilled Duck	અવડ
મોટો ધોળો બગલો	Great Egret	વડો બગલો	નીલશિર	Mallard	ધુંધટો
વચેટ ધોળો બગલો	Intermediate Egret	નાનકો બગલો	લુહાર	Gadwall	ફરાસો
નાનો ધોળો બગલો	Little Egret	ચોટલિયો બગલો	પિયાસણ	Eurasian Wigeon	ફરારસી
			ચેતવા	Garganey	છેખલી
દરિયાઈ બગલો	Western Reef Egret	પરાણો	ગયણો	Northern Shoveler	ગયન
			રાખોડી કારચિયા	Common Pochard	રાખોલિયો થરંગ
સુરંગી પાનબગલી	Chestnut Bittern	હાબકી	ચોટીલી કારચિયા	Tufted Pochard	કાળોલિયો થરંગ
પીળી પાનબગલી	Yellow Bittern	ઢેકડી			
શિયાળી પાનબગલી	Great Bittern	હાબકો	ઠિરજા	Cotton Pigmy	સકરિયો
	<b>Storks</b>			Goose	
પીળીચાંચ ઢોંક	Painted Stork	ચિત્રોડો	નકટો	Comb Duck	ઘોડા
ફાટીચાંચ ઢોંક	Asian Openbill	શંખલી		<b>Raptors</b>	
	Stork		પહોંચ	Harriers	હોડાયા
સરેણ ઢોંક	European White Stork	દૂષિયો ઢેકડો	મત્સ્યભોજ	Osprey	મચ્છરંગી
				<b>Cranes</b>	
કાળો ઢોંક	Black Stork	કાળુડો ઢેકડો	કુજ	Common Crane	કુજડી
મોટો જમાદાર	Greater Adjutant	ધયડો ઢેકડો	સારસ	Sarus Crane	હરેડો
	<b>Ibis</b>		કરકરા	Demoiselle Crane	ભાલકુજડી
ધોળી કંકણસાર	Oriental White Ibis	ઘોડર	સંતાકૂકડી	Rallids	કોગડા
	Ibis		સંતાકૂકડી	Crakes	પોણિંગ
કાળી કંકણસાર	Black Ibis	કાળી કાયનેલી	નીલ જળમુરધો	Purple Swamphen	કોણોગ
નાની કંકણસાર	Glossy Ibis	મેલી કાયનેલી	ભગતં	Coots	
			જલમંજર	Common coot	આડ
	<b>Flamingos</b>		શેતપંખ જલમંજર	Jacanas	
મોટો હંજ	Greater Flamingo	બરૈયો	Pheasant-tailed		ટીચુડી
			Jacana		

પદ્ધતીઓનાં સ્થાનિક નામો

Shorebirds and other waders		ગુજરાતી નામ	સમૃહ/અંગ્રેજ નામ	સ્થાનિક નામ
બાટશા, ઢોંગલીઓ	Plovers	દૃયલા	nામ	nામ
તુતવારી	Sandpipers	ખોયદા	ગયશો	Northern Shoveller ગઢિશો
ગારખોડ	Snipes	સંતામશા	લુહર	Gadwall બુઅાર બુઅારી
		ખોદિયા	સિંગપર	Northern Pintail પરાસ
	Whimbrels		પિયાસણ	Eurasian Wigeon ફરાઓ
નાની ખલિલી	Whimbrel	નાનો ડેબડો	નાની મુરઘાબી	Common Teal શેખલો કે જેખલો
ખલિલી		Eurasian Curlew વડો ડેબડો	ચેતવા	Garganey કરીઓ
મોટો ગડેરો	Black-tailed Godwit	ડેબડો	રાખોરી કારચિયા	Common Pochard તાર્ડીઓ
ટીલિયો	Ruff	ખોયડ	લાલચાંચ કારચિયા	Red-crested Pochard રાતો બારી
ગજપાંઠ	Black-winged Stilt	લામગુરી		Pochard
ઉલટીચાંચ	Pied Avocet	રટરાંગડી	ધોળીઅંખ કારચિયા	Ferruginous Pochard તામણી
મોટો ચકવો	Great Stone Plover	વડો ખાર		
		ટિટોડો		
ચકવો	Stone-Curlew	ખાર ટિટોડો	ચોટીલી કારચિયા	Tufted Pochard કાળવેલીઓ
	Glaredids		આ નામોનો ડૉ. સલીમ અલી અને ડિલન રિલીની	
રણગોધલો	Courser	ખા-ટિટોડો	‘હેન્ડબૂક ઓફ દ બર્ડ્સ, ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન’માં પણ સમાવેશ કરવામાં આવેલ છે.	
	Pratincoles			(સંકલન : નંદિતા મુનિ)
નાનું તેજપર	Small Pratincole	તરારી		□
	Larids			
ધોમડા	Gulls	ટાગા		
વાબગલી	Terns	ઢોરપંદ્યા		
	Skimmers			
જળદળ	Indian Skimmer	ચિનાવરી		
	Other Birds			
ધુવડ	Owls	ધુડ		
કલકલિયા	Kingfishers	હુબાડિયો		
તારોડિયા	Swallows	શ્યામલ		
ધાનચીડી	Pipits	બડુડા		
પીળકિયા	Wagtails	ખાબરા		
		હિરેન સોની		
		અચાપક (પ્રાણીવિજ્ઞાન)		
અશોક એન્ડ રીટા પટેલ બાયોટેકનોલોજી સંસ્થા (ARIBAS)				
		ન્યુ વલ્લબ્ષ વિદ્યાનગર ૩૮૮૧૨૧		

શ્રી હરિનારાયણ આચાર્ય ‘વનેચર’ના પુસ્તક ‘વનવગડાના વાસી’માં નજકાંઠામાં પક્ષીઓના તે સમયે પ્રચારિત સ્થાનિક નામોની એક યાદી આ પ્રમાણે આપેલી છે :

‘વિહંગ’માં જાહેરખબર  
પ્રકૃતિ અને પક્ષી સંરક્ષણ અંગેનું સામયિક ‘વિહંગ’, છેલ્લાં દસેક વર્ષથી પ્રસિદ્ધ થાય છે અને તેણે ખૂબ જ લોકચાહના મામ કરી છે. ગુજરાતના ખૂણે ખૂણે વસતાં પદ્ધતિનીરીકડો વચ્ચેના સેતુ તરીકે તે એક ઉમદા અને ઉપયોગી કામગીરી બજાવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણની ભાર્તીય પરંપરા અને મૂલ્યોના જતનની સાથે તે દિશામાં કાયાનીત વૈજ્ઞાનિક અભિગમનું સંસાન કરતા આ સામયિકમાં જાહેરખબર મોકલી એક સમાજોપ્યોગી, સુંદર કાર્યમાં આપ પણ સહભાગી થઈ શકો છો. જાહેરખબરમાં જાહેરાતની સાથે સાથે પ્રકૃતિસંરક્ષણ અંગેના કોઈ સંદેશને ઉપસાવી શકોએ તેવો અમારો પ્રયત્ન હેઠેશે.

‘વિહંગ’માં જાહેરખબરના દર નીચે ગ્રમાણે છે :  
આખું પાનુ (4 colour) રૂ.૫,૦૦૦/-  
આખું પાનુ (B.W) રૂ.૨,૦૦૦/-  
અખું પાનુ (B/W) રૂ.૧,૦૦૦/-  
બીજું/ગીજુ મુખપૂર્ક (4 colour) રૂ.૬,૦૦૦/-  
પાછળનું મુખપૂર્ક (4 colour) રૂ.૭,૫૦૦/-

બાળપણથી વૃક્ષો મારાં સુખહુદ્ધના સાથી રહ્યા છે. પાંચેક વર્ષમાં નોકરી છોરીને બેસી ગઈ તારે મિત્રો, વડીલોએ પૂછ્યું “શું કરીશ?” મેં કહ્યું. “વૃક્ષો વાવીશ.” મારો આ જવાબ સહુને બિલકુલ ઉડાઉ લાગ્યો હતો. લાગે જ ને! મને ખુદને મારાં આ જવાબ માટે નવાઈ લાગીંતી. હું શિક્ષિકા, ભાણવા ભણવવા સિવાય બીજું કામ વિચારવું તે સમયે મારા વશની વાત નહોતી. તોય જવાબ ઉડેથી હતો. ઉડાઉ નહોતો. વિચારબીજ કદાચ આમ પદ્યાં હશે. પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે પેન ઘડવા માટે બ્લેડ જેની પાસે હોય તે ન આપે. અમારા રખડપણીના વિસ્તારમાં સાગ્યાનું એક જ ઝડ. કોઈએ સંશોધન કરી કાઢ્યું કે, “સાગના પાનથી પેન ઘડાય.” પછી તો એ ઝડ પર અમારો ધસારો તીર બચાબર. એક દિવસે ઝડના માલિકે અમારા ટોળાને બરોબર બીવડાયું. એ વખતે લાય્યુંતું કે આ એક જ ઝડ શું કામ? આવાં સામટા હોત તો આ ડોસાથી બીજું ન પડત.

નીચેક ઘરને પણેંચી વળે તેટલી કેરીથી ફળતો અમારો ‘વાંજિયો’ આંબો કપાઈ ગયો. પછી અમે કેરીની બહુ અછત વેઠી. કેરી ખાવાની તીક્ર જંખના થાય અને બીજા મારા ગોડિયાઓને કેરી ખાતા જોઉં ત્યારે થતું કે, “મારું ચાલે તો ઠેર ઠેર આંબા ઊગાડી દાં.” મારું ચાલ્યું ત્યારે ખરે જ મેં તેમ કર્યું. સાગ, આંબા ઉપરાંત એટલી બધી જતનાં વૃક્ષો છે કે હવે એ બધાં મને કહે છે, અમે હવે પહોળાં નથી થઈ

શકતાં. ઉંચે જ વધવાની મોકળાશ રાખી તે?

આમ તો મારી બધાં જ ઝડ સાથે દોસ્તી, પણ જેતરના એકાંતવાળા શેડે ઉગેલ બાવળ મારો વિશેષ દોસ્ત થઈ ગયેલ. કુટુંબમાં પહેલું સંતાન હોવાને નાતે આપણા માથે કામનો પાર નહીં ને બંધા સાવ રખ્યું. વારે વારે વઢ પડે ને મારે ય પડે. કોઈક ક્ષેત્રો એવું નકરી થઈ ગયેલું કે માણસો દેખતા રહ્યું નહિં. તેથી વઢ કે માર પડે ત્યારે હુંબણા રહવાના પેલા બાવળ પાસે જઈ. કોઈ વાર એવું બને કે દિવસો કે મહિનાઓ પછી એ બાવળને મળવાનું થાય. તેમાં શું? ઘટના તાજી કરીને મન ભરીને રડી લેવાનું.

બોલો, વૃક્ષ મારા પર આમ છવાયેલું હોય તો હું છાંયડો ન વાવું તો શું કરું?

વૃક્ષો વાવવાનું શરૂ થયું. તેમાં પહેલું કામ એ કર્યું કે મારા ગામ બોરખરીનું અમારું દંડ વરોનું ફળિયું ફળજાડ અને ઈમારતી લાકડાં માટે મહદૂ અંશે સ્વાવલભી બને. મોટા-ભાગનાં લોકોએ આ પ્રવૃત્તિ ઉપાડી. ફળજાડમાં અમે સહુએ ઉછેર્યા આંબા, લીંબુ, જમરૂખ, પપૈયા અને સરગયો. તો ઈમારતી લાકડાં માટે ઉછેર્યા વાંસ અને સાગ. પહેલા વર્ષ જરૂરી રોપા મેળવવા જે તકલીફ પડી તેણે મને જાતે નર્સરી બનાવવાની પ્રેરણા આપી. નર્સરી બનાવતા આવડી તે ઉપલબ્ધ ખરી. પરંતુ, કયા જાને ક્યારે કૂલ બેઠાં? બી ક્યારે પાકાં થશે? તે અંગેની રઝળપાટમાં મારા માટે અજાણ્યાં વૃક્ષો મારા નવા મિત્રો થયા. તેમણે જ સુજાઈયું,

### નોંધપોથી

પક્ષીનિરીક્ષણના સાધનોમાં ‘ફિલ ગાઈડ’ અને દૂરબીન જેટલું જ મહત્વ નોંધપોથીનું પણ ગણી શકાય. પક્ષીનિરીક્ષણનાં ભ્રમણોમાં એને સાથે લઈ જવાનું ન ભૂલતાં!

નોંધપોથીમાં ટાંચણ માટે પેન્સિલ કે બોલપોઈન્ટ પેનનો ઉપયોગ કરવો સારો; જેથી કદાચ એ ભીની થાય તો પણ લખાશ બગડે નહીં. એકથી વધુ પેન્સિલ સાથે રાખવી એ પણ સારી ટેવ છે, કારણ કે પક્ષીઓને નિહાળવામાં પેન્સિલ ખોવાઈ જાય, એ એક સર્વસામાન્ય અનુભવ છે.

તમારી નોંધપોથીમાં તારાખ, સમય, સ્થળ, ઋતુ અને વાતાવરણનો ઉલ્લેખ કરી શકાય. પક્ષીઓની જે પ્રજ્ઞતિઓ જોવા મળી હોય તેની યાદી ઉપરાંત, ઓળખી શકાયાં ન હોય તેવાં પક્ષીઓ વિશે સ્થળ પર કરેલ નોંધ અને તે પક્ષીનો ‘સ્કેચ’, જેવી અગાન્યની માહિતી તેમાં સચ્યવાય છે. આ સિવાય પક્ષીઓના દેખાવ, વર્તણુક અને લાક્ષણિકતાઓ વિશે પણ તેમાં નોંધ ટપકાવી શકાય. જે તે સ્થળના વનસ્પતિજગત અને પ્રાણીજગત વિશે પણ તેમાં નોંધ સામેલ કરી શકાય.

વૈજ્ઞાનિક માહિતીની દાખિયે અગત્યની આ નાનકરી નોંધપોથીઓ નિર્સર્જમાં તમે વિતાવેલ સુખી ઘડીઓનું કાયમી સંભારણું પણ બની રહે છે.

(સ્રોત : The Birder's Catalogue : The Sourcebook for Birding Paraphernalia!, લેખક : શીલા બગ, મ્રકાશક : સાઈમન એન્ડ શુસ્ટર)

“ખોવાયેલાં જાડ જે તે જગ્યાએ ફરી લઈ જા.” વૃક્ષો સાથે નિસ્બત ધરાવનાર કેટલા બધા મિત્રોનો એમાં સાથ છે. અમૃત્યુ રન્નોની જેમ પડીકામાં સાચેલાં બી આંખ સામે ખૂલે તારે લાવનાર અને લેનાર બેઉ ભોરી ઊઠીએ. આ વર્ષે મુખીથી વાયવરણાંના બી આચ્યાં. મુખીના અતિ વસ્ત સી. એ. શ્રી રાષ્ટ્રિનભાઈને વાયવરણાંના વૃક્ષો આકર્ષા હશે. એમણે ફૂલો તો માણ્યા જ પણ બી મેળવવાની ય તસ્દી લીધી અને મને મોકલ્યાં. મુખીમાં વાયવરણો હાય તે જ કેટલી સારી ઘટના! વૃક્ષોના પાકા દોસ્ત એવા ઉકાઈના હરિબાઈ પ્રધાન બીજ મોકલનારા નવા મિત્ર મયા.

કાળજાળ ગરમીમાં વેરાન વિસ્તારમાં રખડતા વિચાર આચ્યો કે “ આ ધરતી પર બી ખેરવનારાં વૃક્ષો ન હોય તો અહીં વૃક્ષો પાછાં થાય એવી શક્યતા ઘડી ઓછી કહેવાય. મારાં વૃક્ષમિત્રો મને ઠગલો બીજ આપી શકે તેમ છે તો મારે આવા વિસ્તારમાં વેરવા જોઈએ. વિચારનો અમલ કરતા વાર કેટલી? બોરખરીની અમારી રખ્યું ટોળી તગારાં કીથણા લઈને બીજ વીણવા નીકળી પડે. (આ વર્ષે

બીજ સુખદ ઘટના બની. નોકરી છોડીને રખડતી થયેલી દીકરી પર અત્યંત નારાજ મારા બાપુજી કોથથો ભરીને અર્જુન સાદળાં બીજ વીણી લાભાં.) પહેલા - બીજાં વર્ષે ટોકરવા વિદ્યાલયની બધી છાનાઓ હુંગરો પર બી ઠાણવા આવી તી. ડિલોબંધ બીજ વેર્યા હોય એટલે સુંદર દશ્ય જોવા આંખો કેવી અધીરી હોય! ધરતી અંકુરિત થઈ તારે અમે જોવા ગયાં તો ગણ્યાગાંધ્યા વૃક્ષરોપાએ અમારું અભિવાદન કર્યું. હરખ અને હતાશા બેઉ લઈને હુંગરો ઉત્થાં. આ વાત અમદાવાદના ભરતલાઈ પાઠકને કહેતી હતી તારે એમણે કવિ શ્રી મકરદભાઈનું ગીત સંભળાયું:

“વાચા મેં બીજ અહી હુંકે હાથે

હવે વાદળ જાણે ને જાણે વસુંધરા.”

ટાંકણો જ ટકોરો પડ્યો. આપણે આપણું કામ કરી લીધું પછી ગણવા શું બેસંતું? ને વસુંધરા તો ખંધું જાણે જ છે.

“તુઝે સબ હે પતા, હે ના માં..!”

મુ.પો. બોરખરી, તા. વારા, જિ. તાપી ઉદ્ઘાટન

## વૃક્ષોના બીજના ઔદ્યોગિકરણ કાર્ય કંવર્ધન અને સંરક્ષણ

ડૉ. ઈસ્માઈલ હુજ

ગુજરાતમાં આપણાં દેશી અને આચાતી વૃક્ષોની લગભગ ૪૧૦-ટેલી જાતો જોવામાં આવે છે. આ વૃક્ષો પૈકીનાં અધ્યાત્મ ભાગનાં આચાતી વૃક્ષો છે. જડપથી શહેરીકરણ થવાથી દિવસે દાહે વૃક્ષો લુપ્ત થતાં જાય છે. ખાસ કરીને દેશી વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. દેશી વૃક્ષોને ખરેખર ઓળખનાર વ્યક્તિઓ પણ ખૂબ જ ઓછી છે. દેશી વૃક્ષો આપણાને કુદરત તરફથી મળેલ અમૃત્યુ વારસો છે. તેનું સંરક્ષણ અને વૃદ્ધિ કરવા માટે બીજ અનુક્રમિત કરી રોપાઓ તૈયાર કરવા જરૂરી છે. આવા વૃક્ષોના ગુજરાતી નામ અને વૈજ્ઞાનિક નામની ટૂકમાં વિગત જોઈએ.

નામ	વૈજ્ઞાનિક નામ
ઊભ	<i>Miliusa tomentosa</i>
ચુંબડો	<i>Adansonia digitata</i>
શીમળો (દેશી)	<i>Bombax ceiba</i>
કોદારો	<i>Firmiana colorata</i>
મુચુકુન્દ	<i>Pterospermum acerifolium</i>
જંગલી બદામ	<i>Sterculia foetida</i>
કડાયો	<i>Sterculia urens</i>
સારડોલ	<i>Sterculia villosa</i>

બીલી	<i>Aegle marmelos</i>
કોઢા	<i>Limonia acidissima</i>
સાલેડી	<i>Boswellia serrata</i>
ગુગળ	<i>Commiphora wightii</i>
કાકડ	<i>Garuga pinnata</i>
લીમડો	<i>Azadirachta indica</i>
રોણિયો	<i>Soymida febrifuga</i>
ચારોળી	<i>Buchanania lanzaan</i>
ાંબો	<i>Mangifera indica</i>
અંબેડો	<i>Spondias pinnata</i>
સીસમ	<i>Dalbergia latifolia</i>
જંગલી ખાખરો	<i>Erythrina suberosa</i>
તણાછ	<i>Ougeinia oojeinensis</i>
બીયો	<i>Pterocarpus marsupium</i>
ખાટી ચામોલ	<i>Piliostigma foveolata</i>
અંજન	<i>Hardwickia binnata</i>
અશોક	<i>Saraca indica</i>
રતનગૂંજ	<i>Adenanthera pavonia</i>
હરદે	<i>Terminalia chebula</i>
અર્જુન સાદ	<i>Terminalia arjuna</i>

શિવલીંગી	<i>Couroupita guianensis</i>
મીઠળ	<i>Gardenia spinosa</i>
માલણ	<i>Gardenia resinifera</i>
હળદરવો	<i>Adina cordifolia</i>
નેવરી	<i>Ixora arborea</i>
મહુડો	<i>Madhuca indica</i>
રાયણ	<i>Manikara hexandra</i>
ટીમ્પુરુ	<i>Diospyros melanoxylon</i>
મરખો	<i>Schrebera swietenioides</i>
ઈદ્રજાવ	<i>Holarrhena antidysenteria</i>
ટેટુ	<i>Oroxylum indicum</i>
રગત રોહિડો	<i>Tecomella undulata</i>
ચંદન	<i>Santalum album</i>
કપોલો	<i>Mallotus philippensis</i>
સરેડો	<i>Streblus asper</i>
દીવ તાડ	<i>Hyphaene indica</i>
વાયવરણો	<i>Crateva nurvala</i>

ઉપરોક્ત દેશી વૃક્ષોની યાદીમાં સંઘ્યા જેમની ઓછી હોય અને ઓછી થતી જતી હોય તેવાં વૃક્ષો લીધેલ છે. આ પૈકીનાં અમુક વૃક્ષોનાં બીજ ફક્ત જંગલમાંની જ મળે. 'વિહંગ'ના વ્યાપના કારણે બીજ એકત્ર કરવા

અશક્ય નથી. લોકોમાં પ્રચલિત ન હોય તેવાં વૃક્ષોનાં બીજ જે તે વિસ્તારમાં વનસ્પતિના જાણકાર સાથે સંપર્ક કરી એકત્ર કરી શકાય. બીજ એકત્ર કરવાની બે રીતો છે. (૧) જાડ પરથી બીજ એકત્ર કરવા અને (૨) જાડ પરથી ખરેલ બીજ એકત્ર કરવા. બીજની ગુણવત્તા અગત્યની છે, કારણકે વનસ્પતિ સૂચિમાં વૃક્ષોનું આયુષ્ય સૌથી વધારે છે. આ ઉપરાંત બીજ એકત્ર કરવા માટે કઈ કાળજી લેવી?, બીજનો સંગ્રહ કઈ રીતે કરવો?, તેની વિગત ટૂકમાં મુદ્દાસર જોઈશું.

સંગ્રહિત બીજને ઓળખ પરથી (Identification label) આપવી જરૂરી છે. આ 'લેબલ'ની વિગત અને આપેલ છે.

(૧) વૃક્ષનું નામ અને જાત (૨) સ્થળ (૩) બીજ એકત્ર કરેલ વૃક્ષોની સંખ્યા (૪) બીજ એકત્ર કર્યા તારીખ (૫) બીજ એકત્ર કરનારનું નામ

બીજ એકત્ર કરવા માટેની કાળજી :

૧) બીજનું કવચ સખત થાય, ફળ પાકે અથવા શાંગો ફાટે ત્યારે બીજ એકત્ર કરવું : ઘણી વખત બજારમાં મળતાં ફળને અફુદરતી રીતે પક્કેલ હોય તો તેનું બીજ કામ આવતું નથી. કયા જાડ પરથી લેવામાં આવેલ છે? તેની માહિતીના અભાવે જાડની ગુણવત્તા જાણી શકતી નથી.

## A photographic field guide to the BIRDS OF GUJARAT


Available at

Ankur Hobby Centre, Abhinath complex,  
Nr. Sardar Patel Stadium, Naranpura,  
Ahmedabad-380 014 Ph: 66621313

Kitab Kendra, Sahitya Seva Sadan,  
Gujarat Collage Cross Roads,  
Ahmedabad-380 006 Ph: 26422136

Dr. R. B. Balar  
10/A, Sweet Home Society, Shreyas Tekra,  
Ambawadi Vistar P. O., Ahmedabad-380 015  
Ph: 26610533 M:9427703589

Pappillon Multimedia  
310, Milestone Building, Nr. Drive-in Cinema  
Thaltej- road, Ahmedabad. Tel 079 27433806



Shri Lavkumar Khachar  
an eminent naturalist and  
bird watcher of Gujarat says

..... The photographs are of great fidelity and certainly help in identification of birds seen on any walk in a city garden or across the countryside, but above all, we Gujaratis must possess a copy of it for no other reason than as a reminder of the great joys right at our doorsteps if only we know when to stop and where to look.....

Shri Lalsinh Raol,  
an eminent Gujarati writer and author of four books on birds of Gujarat says

The husband and wife team has made bird watching as an obsession spending more and more of their spare time visiting different areas of India. This book is the result of two decades looking at birds through their camera's lens.....

Advt.

૨) બીજ અથવા ફળ કીટક દ્વારા નુકશાન ન થયેલ હોતું જોઈએ : કીટકના નુકશાનથી ઘણી વખત ફળ પાડી જતાં હોય છે આ બાબત ખાસ ધ્યાનમાં લેવી.

૩) બીજ / ફળ પરિપક્વતાની બાબત ધ્યાનમાં રાખવી : સામાન્ય રીતે વહેલાં પાકતાં બીજ (અન્ય વૃક્ષોની સરખામણી)ની ગુણવત્તા સારી હોતી નથી. જ્યારે વૃક્ષ પર ફળ પાકવાની પ્રક્રિયા ટોચ પર હોય ત્યારે જ બીજ સારું મળે.

૪) વૃક્ષની નીચે કપું અથવા તાડપત્રી પાથરી બીજ એકત્રિત કરવું.

૫) બીજનો જથ્થો સાફસૂફ થઈ શકે અથવા સાચવી શકાય તેટલો જ એકત્ર કરવો.

**બીજ એકત્રિત કર્યા પદ્ધતીની કાળજી :**

૧) બીજ સિવાયના વૃક્ષોના ભાગોને દૂર કરવા : આમ કરવાથી જથ્થો ઘટાડી શકાય. આથી વધારે બીજનો સંગ્રહ થાય.

૨) બીજ સાફ કરી ભેજ હોય તો છાંયડામાં સુકવણી કરવી : સૂર્ય તાપમાં બીજ સુકવવાથી સ્ફુરણ શક્તિ વધી જાય છે. બીજ ધીમે ધીમે સુકાતું જોઈએ. બીજમાં વધારાનો ભેજ દૂર કરવો ખૂબ જ જરૂરી છે. વધારાના બેજથી બીજમાં કીટક તથા ફૂગથી નુકશાન થાય.

૩) બીજને સુકવતી વખતે બીજની સાથે 'લેબલ' રાખવું.

૪) બીજનું 'ગ્રેડિંગ' કરવું : બીજના ગ્રેડિંગમાં



કીટકથી નુકશાન થયેલ તથા અપરિપક્વ બીજને દૂર કરવા. પરિપક્વ, તંહુરસ્ત, ભરાવદાર બીજને અલગ કરવા. આનાથી બીજનો જથ્થો પણ ઓછો થશે.

**બીજનો સંગ્રહ :**

૧) બીજનો સંગ્રહ કરતી વખતે તેમાં હ થી ટકાથી વધારે ભેજ હોવો ન જોઈએ : વધારે ભેજથી બીજને કીટક તેમજ ફૂગથી નુકશાન થાય. બીજમાં અંદાજિત બેજનું પ્રમાણ જાણવા માટે, સામાન્ય રીતે બીજને ફેરવતાં તેના અવાજ ઉપરથી આવી શકે.

૨) બીજનો કપડા, પ્લાસ્ટિક કે 'બ્રાઉન પેપર બેગ'માં સંગ્રહ કરવો : આ માટે બેગ નવી જ વાપરવી. બીજની અંદર તેમજ બેગની ઉપર લેબલ રાખવું જરૂરી છે. બીજનો થોડો જથ્થો હોય તો રેઝિઝરેટરમાં લાંબો સમય જગવી શકાય.

વૃક્ષોનાં એકત્રિત કરેલ બીજને ફોરેસ્ટ કે અન્ય નર્સરીમાં આપી તેનાં રોપાં થાય તે જરૂરી છે. ખાનગી નર્સરીમાં પણ જૂજ પ્રમાણમાં જોવામાં આવતાં વૃક્ષોનાં રોપાં મળવા મુશ્કેલ હોય છે. આથી ખાનગી નર્સરી પણ આ રોપાંનો ઉછેર કરે તો સહેલાઈથી વૃક્ષ ઉછેરનારને મળી શકે. આ વૃક્ષોનો વાપ વધવાથી નવી પેઢી અને સમાજમાં તે વિષે જાગૃતિ આવશે અને પરિચય થશે.

સહસંશોધન નિયામક, જુનાગઢ કૃષિ યુનિ., જુનાગઢ ૩૯૨૦૦૧

## બીજાંકુરણમાં પદ્ધતીઓનો કાળો - નો આપણો ?

ડૉ. કેતન ટાડુ

વૃક્ષોનાં કે અન્ય વનસ્પતિનાં બીજનું સફળતાપૂર્વક અંકુરણ થાય તે માટે ઘણી વખત એ જરૂરી હોય છે કે બીજને તેના માતૃવૃક્ષ (કે જનકવૃક્ષ)થી દૂર પ્રસ્થાપિત થવા અનુકૂળ તક મળે. બીજ, તેના માતૃવૃક્ષથી છૂટાં પડી પૂર્વનિયોજિત ના હોય તેથી દિશામાં વત્તાઓએ પ્રમાણમાં દૂર સુધી વિભરાય તેને 'સીડ ડિસ્પર્સલ' કહે છે. ગુજરાતીમાં તેને બીજનું વિકિરણ કે વિકિરણીય સ્થળાંતર કઢી શકાય (વળી, કેટલીક વૃક્ષજ્ઞતિઓમાં સફળતાપૂર્વક બીજાંકુરણ થવા માટે વિકિરણ દ્વારા સાનુકૂળ જગ્યા મળવી તેટબુનું જ પૂર્તાં હોતું નથી. કેમ કે કેટલાંક વૃક્ષ (કે અન્ય વનસ્પતિ)નાં બીજ કઢા સુરક્ષાકવચથી આવરિત હોય છે. જો આ સુરક્ષાકવચ કોઈક પરિબળ દ્વારા ટૂટે નહિ તો બીજનું અંકુરણ થઈ શકતું નથી). બીજનાં વિકિરણીય સ્થળાંતર

('ડિસ્પર્સલ')માં ભાગ ભજવતાં પરિબળોમાં પવન, વહેલું પાણી, ઢોરઢાંભર કે ફલાદારી વન્ય પ્રાણીઓ (દા.ત. ફલભક્તી ચામાચીયિયાં, રીછ વગેરે) નો સમાવેશ થાય છે. ચરાણ કરતાં કરતાં એક જગ્યાએથી બીજ જગ્યાએ જતાં વેટાંબકરાંનાં શરીર પર ચોટેલાં ગોખરું ઘણાંને જોયાં હશે. ઘેટાં બકરાં દ્વારા ગોખરુનું સ્થાણાંતર એ 'ડિસ્પર્સલ' નું જ એક ઉદાહરણ છે. માત્ર વેટાંબકરાં કે અન્ય વન્ય પ્રાણીઓ જ નહિ, પક્ષીઓ પણ ફળ / બીજના વિકિરણીય સ્થળાંતરમાં ભાગ ભજવે છે.

ફળાદારી પક્ષીઓ વિવિધ વૃક્ષજ્ઞતિનાં બીજનાં સ્થળાંતર અને સફળ અંકુરણમાં ભાગ ભજવતાં હોય છે. કેટલીક જાતિનાં ફણાઉ વૃક્ષો અને કેટલીક જાતિનાં પક્ષીઓ વચ્ચેનો પારસ્પરિક સંબંધ એટલો સઘન હોય છે કે એકના

ગેરહાજરીમાં બીજનું અસ્તિત્વ પણ જોખમમાં આવી શકે છે. આવા પાસપરિક અવલંબનનું પ્રચલિત (અને કંઈક અંશે વિવાદાસ્પદ) ઉદાહરણ મોરિશિયસ ટાપુ પરનાં 'ડોડો' (*Dodo - Raphus cucullatus*) પક્ષીઓ અને 'ટેમ્બાલાકોક' / 'કેલ્વેરિયા મેજર' (*Sideroxylon grandiflorum*)નું છે. ઘણાં વનસ્પતિશાસ્કીઓ / જીવવિજ્ઞાનીઓએવું માને છે કે ડોડો પક્ષી (કે જે ૧૬૮૧ના અરસામાં નામશેષ થયું) પોતાના ખોરાક માટે 'કેલ્વેરિયા મેજર'નાં ફળો પર આખાર રાખતું. વળી, આ ફળોનાં ઉપભોગ દરમ્યાન તે આડકતરી રીતે ફળોની અંદર રહેલાં બીજના 'ડિસ્પર્જલ'માં મહત્વનો ભાગ ભજવતું. માત્ર 'ડિસ્પર્જલ' જ નહિ, પણ 'કેલ્વેરિયા મેજર' ના બીજોના અંકુરણમાં પણ ડોડો પક્ષી અગત્યનો ભાગ ભજવતું તેવું જીવવિજ્ઞાનીઓનો એક વર્ગ માને છે. આનું કારણ એ કે 'કેલ્વેરિયા'નાં બીજ એક સુરક્ષાત્મક કવચમાં જકડાયેલાં રહેતાં ને જ્યાં સુધી આ કવચ તૂટે નહિ ત્યાં સુધી તેનાં બીજનું અંકુરણ અશક્ય રહેતું. ડોડો પક્ષીના પાચનમાર્ગમાંથી પસાર થતું બીજ અંકુરણ પામી શકતું કેમ કે તે પક્ષીના પાચનમાર્ગમાં રહેલાં કંકરાઓની દળવાની પ્રક્રિયા (grinding action) સામે તેવું કવચ ટકી શકતું નહિ. તૂટેલા કવચવાળું બીજ ડોડોના પાચનમાર્ગમાંથી ઉત્સર્ગદ્વિષ્ય તરીકે બહાર આવે ત્યારે તેવું અંકુરણ થતું. જીવવિજ્ઞાનીઓનો એક વર્ગ દૃઢપણે માને છે કે ડોડો પક્ષીના વિલોપનને કારણે 'કેલ્વેરિયા' વૃક્ષનું અસ્તિત્વ પણ જોખમમાં આવી પડ્યું (જો કે બધાં જીવવિજ્ઞાનીઓ તેવું નથી માનતા.) ત્યાર બાદ, ડોડોની ગેરહાજરીમાં 'વાઈલ્ડ ટકી' પક્ષીઓના પાચનમાર્ગમાંથી 'કેલ્વેરિયા'ના ફળોને પસાર કરાવી તેમનું બીજુંકુરણ કરાવવામાં જીવવિજ્ઞાનીઓને સફળતા મળેલી.

આ બીજનાં વિકિરણીય સ્થાનીતર ('ડિસ્પર્જલ') અને અંકુરણની ચર્ચામાં હવે આપણે મોરિશિયસથી ધ્યાન છટાવી, પાછા આપણાં પોતાના પ્રદેશમાં પાછા ફરીએ. આપણે ઘણી વખત એક જીતિના ઝડપમાંથી જ નીકળતું / ઊગેલું બીજ જીતિનું જાડ જોઈએ છીએ. વળી, ઘણી વાર

દિવાલોની તિરાડેમાંથી રોગી નીકળતાં પીપળા (*Ficus religiosa*) કે વડ (*Ficus bengalensis*)નાં જાડ જોઈએ છીએ. આવી ઘણનાઓ માટે ઘણી વખત ફળાહારી પક્ષીઓ દ્વારા થતું બીજનું વિકિરણીય સ્થાનીતર જવાબદાર હોય છે. (અલબત્તા, તેવું માત્ર પક્ષીઓને લીધે જ થતું હોય તેમ ન કહી શકાય.) વડ અને પીપળા ઉપરાત, ઉમરો (*Ficus racemosa*) અને બોરસલી (*Mimusops elengi*)નાં ફળો પણ ફળાહારી પક્ષીઓને પસંદ હોવાથી એમ કહી શકાય કે તેમનાં બીજોના વિકિરણમાં પક્ષીઓ ભાગ ભજવતાં હશે. 'બેરી' (berry) પ્રકારનાં ફળોવાળી વનસ્પતિ જીતિઓ તેમ જ ધાન્ય બીજો (grains)નું વિકિરણીય સ્થાનીતર, પ્રાણીઓની સરખામણીમાં પક્ષીઓ દ્વારા વધારે થતું હોય છે. એવું પણ જાણવા મળે છે કે, નાનાં ફળોનો આદાર કર્યા બાદ પક્ષી પોતાના માનીતા જાડ પર આરામ કરતાં કે રાતવાસા માટે પાછું જાય છે ત્યારે તે ઝડપથી છાલ પર પોતાની ચાંચ ઘસે છે ને તેથી ચાંચ પર ચોટેલાં બીજોનું વિકિરણીય સ્થાનીતર થવામાં લાભ મળે છે. આગળ ઉપર 'ડોડો' અને 'વાઈલ્ડ ટકી' ના ઉદાહરણમાં જોયું તેમ પક્ષીઓનાં પાચનમાર્ગમાં પસાર થઈને ઉત્સર્ગદ્વિષ્ય (અધાર) તરીકે બહાર આવેલાં બીજ ઝડપથી અંકુરણ પામે છે કેમ કે પાચનતંત્રમાંથી પસાર થતી વખતે બીજ પર અમુક પ્રકારની 'ટ્રિટમેન્ટ' કે 'પ્રોસેસિંગ' થતું હોય છે.

બીજોનું વિકિરણ ('ડિસ્પર્જલ') પક્ષીઓ દ્વારા થતું હોય કે અન્ય પ્રાણીઓ કે પવન વગેરેથી - એ જે તે વૃક્ષજીતિ માટે લાભકારક હોય છે, કેમ કે ૧) વિકિરણને કારણે વૃક્ષ કે અન્ય વનસ્પતિનાં બીજ વિશાળ વિસ્તારમાં ફેલાય છે. આને કારણે બીજ અને તેમાંથી ઉદ્ભબતાં બીજાંકુરો પાસપાસે રહેતાં નથી. પરિણામે, તેમની વચ્ચે પોષકતાત્ત્વો, મૂળના પ્રસાર માટેની જગ્યા તેમજ પાણી તથા સૂર્યપ્રકાશ વગેરે માટે અંદરોઅંદરની સ્પર્ધા ઘટે છે, જે વૃક્ષજીતિઓનું અસ્તિત્વ ટકાવવામાં લાભપ્રદ થાય છે, ૨) વિકિરણીય

- ભારતીય ઉપભૂતિમાં જોવા મળતાં પક્ષીઓમાંથી ૧૭૫ પ્રજાતિ એવી છે કે જે વિશ્વભરમાં માત્ર અહીં જ જોવા જ મળે છે (એટલે કે 'endemic' છે).

(શ્રોત : Birds in our Lives લેખક : આશિષ કોણારી, પ્રકાશક : યુનિવર્સિટી પ્રેસ)

- મોગલ શાહેનશાહોના શાસનકાળમાં બાજદારીનો ખેલ લોકપ્રીય હતો. બાજની સાથોસાથ એ સમયે દુધિયા લટોરા (Southern Grey Shrike)ને પણ શિકારની તાલીમ આપી બાજદારીના ખેલ માટે પાણવામાં આવતો.

(શ્રોત : Handbook of the Birds of India and Pakistan લેખક : ડૉ. સલીમ અલી અને એસ. ડિલન રિસ્ટી, પ્રકાશક : ઓક્સફર્ડ બુક્સ)

સ્થળાંતર પામતાં બીજોમાંથી ઘણાં બધાં બીજ માતૃવૃક્ષના પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના પ્રદેશમાં સ્થળાંતરિત થઈ શકે છે. ઘણી વખત એવું પણ બને છે કે આ નવો પ્રદેશ કે નવું પર્યાવરણ તે વૃક્ષજ્ઞતિના બીજોને વધુ માફક આવે તેવાં હોય છે અને તેથી તે બીજવાળી વનસ્પતિ / વૃક્ષ જ્ઞતિને સરવાળે ફાયદો થાય છે.

આપણે જોયું કે બીજોનું 'ડિસ્પર્જલ' વનસ્પતિઓ / વૃક્ષોના ફાયદામાં હોય છે. વિહંગો તો અનાયાસે આ કાર્ય કરી નાખે છે! પરંતુ, મારા માનવા મુજબ આપણે સહુ 'વિહંગપ્રેમીઓએ તેમની પાસેથી પાઠ શીખવો જોઈએ ને આપણને તેમ જ પર્યાવરણને ફાયદા કરે તેવી વૃક્ષજ્ઞતિના બીજોનું વિકિરણીય સ્થળાંતર થાય તેવી પ્રવૃત્તિઓ સભાનપણે કરવી જોઈએ. આનો એક રસ્તો એ છે કે, પોતપોતાના વિસ્તારમાં મળતાં અને આપણને તેમજ પર્યાવરણને ફાયદાકારક હોય તેવાં વૃક્ષોનાં બીજ એકત્રિત કરવા જોઈએ. આવા એકત્રિત થયેલાં બીજ રાજ્યના બીજ

પ્રદેશમાંના 'વિહંગ' મિત્રોમાં વહેંચવા જોઈએ. જેથી આપણે 'વિહંગ' મિત્રો 'સીડ ડિસ્પર્જલ' નું કાર્ય ઓછામાં ઓછું પ્રયોગાત્મક રીતે કરી શકીએ. એવું પણ કરી શકાય કે, એકત્રિત કરેલાં બીજ, વનવિભાગની નર્સરીઓ માં આપવામાં આવે. ત્યાં તે બીજોની યોગ્ય માવજત થાય ને તેમને વનવિભાગની 'નર્સરી'ઓ કે 'બોટનિકલ ગાર્ડન્સ' / 'આર્બોરિટસ'માં ઊગાડી શકાય. વનવિભાગ દ્વારા બીજોનું વિતરણ રાજ્યના વિવિધ વિસ્તારોનાં વૃક્ષપ્રેમી લોકોમાં પણ કરી શકાય. આવા પગલાં પ્રયોગાત્મક ધોરણો કરીએ તો એ આવકાર્ય થશે. અન્યથા ગાંડો બાવળ તો ગમે ત્યાં પોતાનું એકચકી સામ્રાજ્ય સ્થાપવા તૈયાર જ છે!

અફ/પ્ર/નંનવન-૩, મૌલિક વિવેનીનાણક,  
સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦૦૧૫



## પક્ષી માટે વૃક્ષ, વૃક્ષ માટે પક્ષી

ડ. મણાવ નિવેદી

અનુ. નંદિતા મુની

મારા થોડાક નેસર્જિક બગીચામાં આજથી પાંચેક વર્ષ પહેલાં મેં એક નવો જ છોડ જોયો. ટક્કાર થડવાળા આ છોડના હદ્યાકાર પાન પર ઢુંબાટી આવેલી હતી. મને મળવા આવેલા એક વનસ્પતિવિદ્ધ મિત્રો મને આ છોડનો પરિચય કરાવ્યો. એ છોડ અશ્વગંધા (Withenia sommifera)નો હતો. આ છોડના ઔષધિય ગુણ વિશે અમારે ચર્ચા ચાલતી હતી ત્યારે મારા મનમાં એક વિચાર ઘોળાયા કરતો હતો કે રોપકી કર્યા સિવાય આ છોડ મારા બગીચામાં કેવી રીતે આવી ચડચો? મારા ઘરની આસપાસના બીજા બગીચામાં કે ખુલ્લા વિસ્તારમાં પણ કયાંય આ છોડ હતો નહીં એટલે એનું આગમન એક રહસ્ય સમું બની ગયું.

આ રહસ્યનો સ્ફોટ ત્યારે થયો કે જ્યારે મેં તેનાં લાલ ફળોનો આહાર કરી રહેલા એક મોરને નિહાયો. અશ્વગંધાનાં કાચાં ફળ લીલા રંગનાં હોય છે અને એને પાડે ત્યારે તેમનો રંગ લાલ થઈ જાય છે. એ નિહાળવામાં અને એને ખાવા માટે આવતાં પક્ષીઓનું ધ્યાન પૂર્વક નિરીક્ષણ કરવામાં મને રસ પડ્યો. આ પક્ષીઓની યાદી ત્વરથી વધવા લાગી. મોર ઉપરાંત કાબર, બ્રાબણી મેના, બુલબુલ, કોયલ, થોરિયું લેલું અને વન લેલાં જેવાં પક્ષીઓને મેં આ ફળ આરોગતાં નિહાય્યા. ત્યારથી પંખીઓને પ્રિય એવો આ

'બર્ડ પ્લાન્ટ' મારા બગીચામાં રહે તેની હું કણણ લઉં છું.

રતનમાળા અભ્યારણ્યમાં હું પક્ષીઓનો અભ્યાસ કરતો હતો ત્યારે જંગલમાં પુષ્પિત થયેલાં કે ફિલિત થયેલાં વૃક્ષોની મુલાકાત લેતાં પક્ષીઓની હું નોંધ રાખતો. સૌથી વધુ પક્ષી જ્ઞતિઓ આ જાણ પ્રકારનાં વૃક્ષો પર જોવા મળતીઃ શીમળો (Silk Cotton, Bombax ceiba), ખાખરો કે ક્રેસ્સ્યો(Flame of the Forest, Butea monosperma) અને પંગારો (Coral Tree, Erythrina variegata). આ વૃક્ષો પર ફૂલ આચ્યા હોય ત્યારે તેના ઉપર ગમે ત્યારે વીસેક જેટલી જ્ઞતિનાં પક્ષીઓ તો મધુરસનો આહાર કરતા જોવા મળે જ. આ પક્ષીઓમાં ખાસ તો વિવિધ પ્રકારના કોશી (drongoes), હરેવા (chloropsis), કંસારા (barbets), ખેરખા (treepies), કાબર (mynas), કાગડા, સકરખોરા (Sunbirds) અને સામાન્ય ન ગણી શકાય તેવા શ્યામશિર કસ્તૂરા (Eurasian Blackbird)નો પણ સમાવેશ થાય છે. મને બરાબર યાદ છે કે ડાંગના જંગલમાં ચિલોત્રા (Grey Hornbill)ને શોધવો હોય તો તેનો સૌથી સરળ રસ્તો એ કે ટેટા આચ્યા હોય તેવો વડ કે 'ફાઈક્સ' જ્ઞતિનું અન્ય વૃક્ષ શોધી કાઢવાનું. આવા વૃક્ષ પર આહારમાં લીન ચિલોત્રા મળી જ જાય.

પક્ષી અને વનસ્પતિના પારસ્પરિક સંબંધના આવા અનેક અન્ય ઉદાહરણોનો મેળે અભ્યાસ કર્યો હોવાથી આ વિષયના મહત્વ બાબતે મને લખવું ગમ્યું. આપણે કેવી વનસ્પતિની વાવડી કરીએ છીએ તે બાબત પક્ષીઓ માટે ઘણી અગત્ય ધરાવે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે ઉદ્યાનોમાં, રસ્તાની ધારે કે બગીચામાં જે વનસ્પતિઓ વવાય છે તેની પસંદગી પર્યાવરણની સુસંગતતાને બદલે માનવીની કહેવાતી ‘સાનુકૂળતા’ને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તમારી આસપાસનાં વૃક્ષોનું થોહું પણ નિરીક્ષણ કરશો તો તમે જ્ઞાણી શક્ષશો કે કયા વૃક્ષો હીકરે ‘બડ્-કેન્ટલી’ છે. જો તે કોઈ દેશી વૃક્ષ હશે તો તે અચ્યુક ‘પક્ષિસહદ્ય’ હશે. આવાં વૃક્ષોમાં લીમડો, વડ, પીપળો, ઉમરો, પલાશ, ગોરસ આમલી, ગુંડી અને ગુંડા, દેશી બાવળ, પીલુડી, આંબો, પંગારો. શીમળો, મહુડો વગેરેનો સમાવેશ થાય છે. આ યાદી હજુ લાંબી બની શકે. આ દેશી વૃક્ષો પક્ષીઓને ફળ-ફૂલના સ્વરૂપે ખોરાક પૂરો પાડવા ઉપરાંત તેમને રાતવાસા અને માળા બાંધવાનું આશ્રયસ્થાન પણ બની રહે છે. આની સામે પક્ષીઓ પણ આ વૃશ્રોના ફેલાવામાં ઘણી અગત્યની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ ફળ ગળી જાય છે અને દૂર જઈને ચરક દ્વારા તેનાં બીજ ફેલાવે છે એ આપણે બધાં જ્ઞાણીએ જ છીએ. વડનાં કુળનાં ‘ફાઈક્સ’ વૃક્ષો ઉપરાંત લીમડો, પીલુ, ટીમંડુ જેવાં વૃક્ષો તથા બોર (Zizyphus), અશ્વગધા જેવાં કુપો અને ચિયા તેમ જ જલજલ વનસ્પતિની પણ અનેક જાતોના ફેલાવામાં પક્ષીઓનો મહત્વનો ફાળો છે.

પક્ષીઓ અને વનસ્પતિનો આ આંતર્સંબંધ એટલો ગહન છે કે એક લુમ થાય તો બીજું પણ નામશે થઈ જાય છે. ટાપુઓ અને વર્ષાવનોમાં આ હકીકતનાં અનેક ઉદાહરણો જોવા મળ્યા છે. પક્ષી અને વનસ્પતિનો સંબંધ માત્ર ફ્લાઇર (frugivory) પૂરતો જ મયારીદિત નથી. પક્ષીઓ વનસ્પતિને હાનિ પહોંચાડતાં ક્રિટકોને દૂર કરે છે. પોતાની ચરકના સ્વરૂપે તેઓ પર્યાવરણામાં પોષક દ્વયો પણ ઉમેરે છે. ચિલોત્રા ઘણી વાર વૃક્ષનાં ફળોનો આધાર કરીને મોં વતી તેનાં બીજને બહાર કાઢે છે. મારાં મિત્ર અને સહકાર્યકર ડો. અપરાજિતા દાન છેલ્લાં બાર વર્ષથી અરુણાચલમાં ચિલોત્રાનો અભ્યાસ કરે છે. તેમના કહેવા અનુસાર જંગલને જીવિત રાખવામાં ચિલોત્રાની ખૂબ

મહત્વની ભૂમિકા છે. ચિલોત્રાને તેઓ ‘જંગલના બેઝુ’ (farmers of forest) ગણે છે!

દેશી વનસ્પતિઓથી માત્ર પક્ષીઓ જ આકાર્યિ છે તેવું નથી. પક્ષીઓના ખોરાકસમા વિવિધ ક્રિટકો (જેમકે પતંગિયા) અને નાનાં-મોટાં અન્ય વન્યજીવોને પણ તે આશ્રય આપે છે. વનસ્પતિની આપણી પસંદગીમાં થોડા વધુ સભાન અને સંવેદનશીલ બની આપણે વન્યજીવો માટે સુંદર નિવાસસ્થાનો રચી શકીએ. ઘણી વાર તો આ વનસ્પતિને વાવવાની જરૂર પણ નથી પડતી; પોતાની મેળે જ તે ઊગી નીકળે છે. બસ, તેને ઊગવા દો, ઉછરવા દો. આ વાતનું પહેલું પગલું એ હોઈ શકે કે આવી વનસ્પતિને આપણે ઓળખીએ અને તેનું નિરીક્ષણ કરીએ. મને ખાતરી છે કે આપણામાંથી ઘણાં મિત્રો આવાં ‘બડ્કેન્ટલી’ વૃક્ષોને ઓળખતાં હશે અને તેને ફેલાવવાનું કે સાચવવાનું કામ પણ કરી રહ્યાં હશે.

દેશી વનસ્પતિના મહત્વ પર હું આટલો ભાર મુકી રહ્યો છું એનો અર્થ એ નથી કે દાયકાઓથી આપણી વચ્ચે વર્સી ગયેલ વિદેશી વૃક્ષોનું કોઈ જ મહત્વ નથી. એમાંથી કેટલાંક વૃક્ષો પર્યાવરણ માટે સારાં છે અને કેટલાંકને પક્ષીઓએ અપનાવી લીધા છે. પણ આપણી પોતાની વૃક્ષસમૃદ્ધિ જ એટલી ઐશ્વર્યપૂર્ણ છે કે એને જ શા માટે ન વધાવી લેવી? હ્યાત વૃક્ષો પ્રત્યે દુર્લભ સેવીને કે વૃક્ષો વાવી અને ઉછેરી શકવાની સાનુકૂળ પરિસ્થિતિઓનો લાભ ન લઈને આપણે પર્યાવરણ સંરક્ષણની મૂલ્યવાન તકો વેડફી દેતા હોઈએ છીએ. જો કે કેટલીક સભાન વ્યક્તિઓ કે સંસ્થાઓ પોતાના ભગીચા કે સુંદર તથા દિષ્ટપૂર્ણ ‘લેન્ડલેપીંગ’વાળાં લીલાછમ ‘કેમ્પસ’ કે ‘ફાર્મહાઉસ’ના સ્વરૂપે વર્સી કે નગરની વચ્ચે પણ સ્વર્ગ રચી દે છે. પસંદગી આપણા હાથમાં છે અને સાચી તથા સંવેદનશીલ પસંદગી દ્વારા આપણે કોઈ રીતે જરૂર પ્રદાન કરી શકીએ. મારી અંગત વાત કરું તો, એકાદ બુલખુલે ભેટ આપેલા અશ્વગંધાના નાનકડા બીજામાંથી ઊગીને મારા મનમાં વનસ્પતિ અને પક્ષીઓના પારસ્પરિક સંબંધની સમજારૂપી વૃક્ષનાં મૂળિયાં ઊડાં ગયાં. દરેક સારો વિચાર પણ એક બીજરૂપ છે. આપણી મનોભૂમિમાં એ ઊગી નીકળે તો પછી વાસ્તવિક ભૂમિ પર પણ જરૂર આકાર ધરાણ કરશે.

૧૩, સુકુમલ ફ્લેટ્સ, રામદેવનગર, અમદાવાદ ૩૮૦૦૧૫

Publisher, Printer and Editor : Dr. Bakul Trivedi, 19/414, Satyagrah Chhavni, Satellite Road, Ahmedabad 380015. Owner : Vihang Research Foundation, Ahmedabad. Printed at : Bhagwati Offset, Bansidhar Estate, Bardolpura, Ahmedabad-1. Laser Typesetting : Sharad Prakashan, 5, Sunpoint, Memnagar, Ahmedabad 380052

# BONDS IN A 'SNAP'



**It works like magic. Sticks quick and strong, in a matter of seconds.  
And all you need is one tiny drop.**

Fevikwik - the one-drop instant adhesive with a high-strength formula that bonds **almost anything to anything** - be it plastic (most kinds), rubber, acrylic, chinaware, ceramic, metals...

Try Fevikwik. And see for yourself the magic of the fastest bonding adhesive in the world.

Fevikwik. The instant bond that lasts long.

Fevikwik can even stick your fingers.  
**Use it carefully.**



**Fevikwik® - THE ONE-DROP INSTANT ADHESIVE**

® **Fevikwik®** is the registered trademark of Pidilite Industries Ltd., makers of **FEVICOL**

# નળસરોવર ડાયરી

ડૉ. બંકુલ ત્રિવેદી

૭મી એપ્રિલ, '૦૮

૭મી એપ્રિલે નળસરોવર ગયા ત્યારે આઈ સારસે અમારું સ્વાગત કર્યું!

અમને મોટા ગડેરા (Black-tailed Godwit)નાં મોટાં ટોળાં જોવા મળ્યાં. ન્રાણસો જેટલાં મોટાં હજ (Greater Flamingo) પણ હતાં. નળસરોવર પરિસરમાં ખારી પીલુનાં જાડ વધુ છે અને અત્યારે તેના લાલ ચટક રંગનાં ફળ બેઠેલાં, એટલે વૈયાંને ભાવતું ભોજન મળી ગયું! પવનમાં ઝૂલતી પીલુની ડાળીઓ પર સમતોલ રાખતાં રાખતાં, ઉપરનીચે, વાંકાંચૂંકાં થઈને આ ફળની લિજજાત માણતાં વૈયાં જોવા એ એક લહાવો છે!



અમે ગયા એના બે-ત્રણ દિવસ પહેલાં જ જે વાવાજોડું આવ્યું તેમાં ઓફિસ સંકુલના મકાનોને તેમજ કિનારા ઉપરનાં તથા બેટ ઉપરનાં વૃક્ષોને ઘણું નુકસાન થયું છે. ‘પાનવડ’ ઉપરનાં બધાં પીલું મૂળમાંથી બધાર નીકળી આવેલાં હતાં. આ ચોમાસે મોટા પ્રમાણમાં પીલુનું


વૃક્ષારોપણ થાય તો સારું.

પ્રાબલા બેટ તરફ જતાં સેકડોની સંઘ્યામાં ચેતવા (Gargany) નાં ટોળાં જોવા મળ્યાં, એ જ રીતે પ્રજનન પોષાકથી સજજ રાતપગ (Spotted Redshank), મોટા ગડેરા (Black-tailed Godwit) તથા શ્યામશિર તથા લાદાખી ધોમડા (Black-headed and Brown-headed Gulls) જોવા મળ્યાં.

ચેતવાની સાથે સાથે મોટી હાજરી ભગતડા (Common Coot)ની પણ હોય છે. જ્યાં જુઓ લાં ‘કૂટ’! તમને વસવસો ના રહે કે ‘પક્ષીર્ધન નહોતું થયું’!

પ્રાબલા બેટ તરફ જતાં પાણી ઓછું થવાને લીધે જમીનનો પટ ઉઘડે છે, જ્યાં અમે મોટી સંઘ્યામાં વાબગલીઓ (terns)ને બેઠેલી તેમજ ઊડાઉડ કરતાં જોઈ. મોટા ભાગની કશ્મીરી વાબગલીઓ (Whiskered Tern) હતી. થોડી ધોળી વાબગલી (Gull-billed Tern) પ્રજનન ઋતુમાં ધારણ કરેલી કાળી ટોળીને લીધે ખૂબ સુંદર દેખાતી હતી. આ ઋતુમાં નળસરોવરમાં પહેલાં ચેતપંખ કાળી વાબગલી (White-winged Black Tern) જોયેલી. જે આ પ્રવાસમાં જોવા ન મળી. અગાઉ જણાવ્યા પ્રમાણે શ્યામશિર ધોમડા પણ આ ટોળામાં હતાં. પણ આ નાના કદનાં બીજા ધોમડા કયા? શ્યામશિર ધોમડાથી પણ નાના અને આંખની પાછળ કાળું ટપકું. ‘એશિયન વોટરફાઉલ સેન્સસ’ (AWC) ની ‘ફિલ્ડ ગાઈડ’ તથા ગ્રીમેટ ઇન્ક્રિપ તથા ઇન્ક્રીપની ‘ફિલ્ડ ગાઈડ’ તપાસતાં અમને ખાત્રી થઈ કે તે નાના ધોમડા (Little Gull) છે. અને તે પણ આશરે ત્રીસની સંઘ્યામાં! નળસરોવરમાં નાના ધોમડાની નોંધ પહેલા થઈ છે, પણ મારા ધ્યાનમાં આટલી મોટી સંઘ્યામાં નહીં!

પાનવડ તરફ આગળ વધતાં, વહેલી સપારના સૂર્ય પ્રકાશમાં ચમકતી મોટી ચોટીલી રૂભકી (Great Crested



Grebe) જોઈ આનંદ થયો.

એક બેટ પર 'મોટા તેજપર (Large Pratincole)' નો માળો હતો. માળો એટલે માત્ર ભેસના પગથી પડેલો ખાડો, કોઈ પણ ફેરફાર વિના આ ખાડામાં બે ઈડાં મૂકેલાં હતાં. અમે માળાની નજીક હતાં ત્યારે એક પક્ષી પાંખો પ્રસારી લંગડાંતું ચાલતું હતું. (broken wing mimicry behaviour) અમારું ધ્યાન માળાને બદલે તેની તરફ દોરવા તે આ રીતે વર્તા રહ્યું હતું! મોટાં તેજપર નિયમિત નગરસરોવરના બેટાં પર માળા કરતાં હોય છે.

પ્રાબળા બેટ પર નવું 'વોયટાવર' બન્યું છે તેના



ઉપરથી દૂર દૂર સુધી હંજના ટોળાં દેખાતાં હતાં. વાદળાયું વાતાવરણ અને ઠડા પવનને લીધે દિવસ ચઢ્યો હોવા હતાં વાતાવરણ આહુલાદક હતું. બેટ પર દસેક વાજયાના સુમારે બે 'ફારેસ્ટ ગાર્ડ' સાથે ૧૫-૨૦ રોજમદારો બેઠા હતા. આ રોજમદારોને 'પેટ્રોલિંગ' માટે રાખેલા હોય છે. તેઓનું કહેણું હતું કે વરસના બે-ત્રાણ મહિના તેમને છૂટા કરી દેવાયાં આવે છે. એ દરમિયાન ગામનાં લોકો તેમને હેરાન કરે છે. હવે થોડા હોડીવાળા પર્યાવરણ બાબતે વધુ જાગૃત થયા છે. રોજમદારીમાં હોડીવાળાને જ ભરતી કરતા હોવાથી આ વિધેયાત્મક ફેરફાર દસ્તિગોચર થાય છે. હોડીવાળા ભાઈઓમાં પક્ષીસર્વક્ષણ વિષે હજ વધુ જાગૃતિ આવે તથા તેમનું પક્ષીઓ સંદર્ભે જ્ઞાન વધે તે દિશામાં વધુ મ્રયતોની

જરૂર છે.

પાનવડ બેટ પર હંમેશની જેમ પીલુમાં મોટો પાન કરકરિયો (Great Reed Warbler) પણ જોયો. અમે જેમ જેમ આ લંબાઈ પટે પથરાયેલા બેટ પર ચાલતા જતા હતા તેમ તેમ વૃક્ષો પર આરામ ફરમાવી રહેલા રાત બગલા (Black-crowned Herons) ઊડતા જતા હતા. કસમના કહેવા પ્રમાણે રાતબગલાની દિનવાસાની આ જગ્યા નવી છે. પાનવડ પર પાનવલા (Painted Snipe)નું એક 'ફિલ્મિલી' જોવા મળ્યું! પાંચેક પક્ષીઓ હતાં અને એમાં ત્રણ પુષ્ટ હતાં. ઇટોડી (Red-wattled Lapwing) ના પણ જે માળા જોયા.

૧૧મી મે, '૦૮ :

સવારે ૫-૪૫ વાગ્યે નીકળી ગયા. રસ્તામાં તેતરને બચાવવાનું ધ્યાન તો રાખવું જ પડે. કયારેક હોલા પણ! રસ્તાની બાજુનાં પાણી સૂક્ષ્મ ગયાં હતાં.

નગરસરોવર ચોકડી પાસે ખાલ્ટેશન કરેલા લીમાં, પેલ્ટોક્રોરમ હવે ખાસ્સા મોટાં થઈ ગયેલા છે. જાડ પર સો - દોઢસો સંકેદ કંકણસાર (White Ibis) અને બસો જેટલા નાના કાજિયા (Little Cormorant)ને બઢેલા જોયા. ત્યાં રાતવાસો (roosting) કરતા હશે. અહીં 'ખાલ્ટેશન'માં જ એક સોનેરી પીળક (Golden Oriole)નું ગાન સાંભળવા મળ્યું.

'એપ્રોચ રોડ' ની બાજુનાં પાણીમાં ધાર્યા મુજબ હજ હતાં. સો - એક નાનાં હજ કેટલાંક અપુષ્ટ પક્ષીઓ સાથે અને થોડાં મોટાં હજ પણ હતાં. બાકી થોડી બતકો પણ હતી જે દૂરથી ઓળખાઈ નહીં અને કાદવ ખૂંદનારા (waders) પણ ખરા. 'એપ્રોચ'ની બાજુમાં ગાંડા બાવળ ભેગાં પીલું સાંદ્ર થઈ ગયા છે. પીપડામાં વાવેલાં બીજાં વૃક્ષો પણ હજ કાળજ માંગે છે. વન-વિભાગ દ્વારા મૂકાયેલા બાંકડા કોઈના રોખનો ભોગ બન્યા હોય તેમ ક્યાંક તૂટેલાં ને વાંકાંકા થઈ ગયેલાં છે.

ગારી પાર્ક કરી સામાન લીધો. લીમાં પર સુગરીનું ટોળું કંઈક ફિઝોસ્તું હતું; શું તે બખર ન પડી. ઓફિસ સંકુલના પ્રાંગણમાં ઘણાં વૃક્ષો વાવાઓડાથી નુકશાન પાયાં હોવાને લીધે કપાયેલાં હતાં. ખારી પીલુનાં બયેલાં જાડ કેટલાં સુંદર ને તંહુરસત છે! અહીં પીલુનું વાવેતર વધુ વધુ જોઈએ અને ઉભેલાં વૃક્ષોની જો વ્યવસ્થિત કાપકૂપ થાય તો પવનથી થતું નુકશાન નિવારી શકાય. શૌચાલય કોઈ પણ સરકારી મજાનમાં શોખે તેવાં! નવું 'ઈન્ટરગ્રીટેશન સેન્ટર' ને જરા નવું રૂપ ન આપી શકાય!

ધરાયેલાં પક્ષીઓની સારવાર અને સુરક્ષા માટે ઊભા થયેલા પાંજરામાં ‘સ્ટોર્ચમ’ની જેમ હવે પકડાયેલી જગ્યાનો, વાયરો અને તૂટેલો સામાન પડ્યો રહે છે. સૌ મુલાકાતીઓના લાભાર્થી! જાળનો તાત્કાલિક બાળીને નિવેદો કેમ નહીં લાવાતો હોય! ટૂંક્માં, પૂરાં પરિસરમાં વ્યવસ્થા ને કલાત્મકતાનો અભાવ કાયમ કઠે છે! એ મેં મહિનામાં કાળા રાતાપગ (Spotted Redshank)ને ગ્રજનન પોણકમાં જોવાનો હંમેશ મોહરહે. કઠે જતાંવેંત જતેના દર્શન થયા. તેનો ‘કોલ’ રાતાપગ (Redshank)થી ખાસ લિન્ન ન લાગ્યો, પણ

કહું. જો કે, કદમાં ઘણો ફેર છે, છતાં ઉનાળું પોણક ધરાવતી કાશ્મીરી વાબગલી અને કાળાપેટ વાબગલીમાં થાપ ખાઈ જવાય. નળસરોવરમાં આ સમયગાળો જુદી જુદી વાબગલીઓની ઓળખાણ માટે ઘણો ઉપયોગી કહેવાય. (મેં કાળી વાબગલી (Black Tern, Chlidonial niger) પણ જોઈ છે. સાંસંદર્ભી નળસરોવર જતા, ગોરજ ગમની ફેરવાડી કેનાલ પર, નળસરોવર ખાતે અને થોળ ખાતે. ૧૨-૧૫ વર્ષ પહેલાં! તસવીર પણ છે, જે સૃષ્ટિમાં પ્રકાશિત થયેલી. - કેનાલ ટાટુ)

અરે! આ કાળીધોળી જાણો જબકારા મારતી વાબગલી કઈ? શેતપંખ કાળી વાબગલી જ વળી! શેતપંખ કાળી વાબગલી (Whitewinged Black Tern) તેના વિરોધાભાસી કાળા - મોળા પહેરવેશને લીધે દેખાવડી લાગે છે. ખૂબ ઓછી જોવા મળતી આ વાબગલીના ચાર - પાંચ નમૂના સહેલાઈથી નિરાંતે જોવા મળ્યાં.

ઓડીમાં, ‘એપ્રોચ રોડ’ની બાજુમાં ભરાયેલાં પાણી તરફ જતાં, મવાસી બતકોમાં કેટલીક ગયણો (Northern Shoveller) અને કેટલીક ચેતવા (Garganey) તરીકે ઓળખાઈ. આ સિવાય કવચિત આપણી સ્થાનિક બતકો ગિરજા (Cotton Pigmy-Goose), ટીલિયાળી બતક (Spot-billed Duck) તથા નાની સિસ્સોટી બતક (Lesser Whistling Duck) નાં ટોળાં પાણીમાં કે ઉડતાં દેખાઈ જતાં. શેતપંખ જલમાંજર (Phaesant-tailed Jacana) તેની લાંબી પુંછીમાં શોભાયમાન લાગતો હતો.

પાછા ફરતાં કાસમે ગીત લવકાયું:

‘નળરાજ તારા બેટડા ઝાંજા

ધાંધીંડા તો પાર વિનાના

હુડકા હાલે, તુણીયા તરે


‘પોડા દોટમ દોટ.....’

ઓફિસની નજીક પહોંચ્યાં ત્યાં બે બોટના પ્રવાસી મસ્તીમાં આવી જઈ પાણીમાં પડેલાં જોય્યાં. નહાવનો ને પાણી ઉડાડવાનો તેઓ આનંદ લૂંટી રહ્યાં હતાં. અમે કિનારે પહોંચ્યો ‘ફિરેસ્ટ ગાર્ડ’ ને આ બાબતે માહિતી આપતાં તેણે બે ચોકીદારોને ત્યાં મોકલ્યાં. ‘અહીં નહાવાની મનાઈ છે’ નું પાટિયું ધણાં સમયથી ‘મીરીંગ’ છે તે ત્યાર પછી આણ્યું, જો કે આપણી પ્રજા આ પાટિયાને કેટલું ગણકારત!

પાછાં વળતાં ‘એપ્રોચ રોડ’ની બાજુનાં પાણીમાં નીલાશિર (Mallard) ની એક માદા દેખાઈ, એક જ પક્ષી! પછી થોડાં દિવસો સુધી તે રહ્યું એમ પાછળથી જાણવા મળ્યું.

૧૮/૧૪, સલ્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રેડ,


અમદાવાદ ૩૮૦૦૧૫



નળસરોવરમાં અત્યારે કોઈનું એકચીકી શાસન હોય તો તે નીલ જલમુરધા (Purple Swamphen)નું! ચિયાવાળી પ્રત્યેક જગ્યામાં તેમની હાજરી ભારોભાર જીણાતી હતી. તો જલમુરધી (Common Moorhen)ની સંપૂર્ણ ગેરહાજરી!!

નળસરોવરના પાણીમાં છૂટાછવાયા ભગતડાં (Common Coot) ના દેખાય તેવું ભાગ્યે જ બને; આજે તો નાની ડૂબકી (Little Grebe) પણ સારી સંખ્યામાં દેખાઈ. નાની ડૂબકીનાં કેટલાંક મોટાં જૂથ સેકડોની સંખ્યામાં ચાનાકર્ષક બની રહ્યાં.

પાણી મેં મહિના પ્રમાણે ઘણું હતું, લગભગ અઢી ફૂટની આસપાસ. છતાં ઉધડતાં જતાં બેટના માથે વાબગલીઓની આવનજાવન ભાગ્યે જ થાન બહાર જાય. મોટા ભાગની કાશ્મીરી વાબગલીઓ હોવાથી તેમનું કાળું પેટાણ ધ્યાન બેચાય તેવું હતું. ‘પાણીનાં સંગાથી માં શ્રી લાલસિંહભાઈએ જણાયું છે તેમ, ‘પોતાના વતન કાશ્મીર તરફ જવાની તેને ઉતાવળ નથી હોતી.’ ‘કાળાપેટ વાબગલી (Blackbellied Tern) પણ ક્યારેક દેખાય છે?’ તેમ કાસમે



શિયાળા દરમ્યાન પાન બેરવ્યા પછી, વસંતપંચમીની આસપાસ લગભગ બધાં વૃક્ષો ઓછાવતા પ્રમાણમાં ફૂલોથી છવાઈ જાય છે. એપ્રિલ આવ્યે બધાં ફૂલો ખરી પડે છે અને તેની જગ્યાએ ફળ, શિંગો તથા પાંદુંબાં બેસે છે; સાથે સાથે નવાં પાન કોળવા લાગે છે. એપ્રિલના અંતમાં જધારે ઉનાળાની ગરમી ચરમસીમાંને પહોંચે ત્યારે આ નવાં પાન ઘાટો છાંયો આપવા લાગે છે. પ્રાણીઓને ગરમીથી રાહત આપતાં આ નવપલ્લવો વૃક્ષનાં બીજને પણ પોષણ પૂરું પાડે છે. આ બીજ, જૂનના અંત સુધીમાં પાકી, વરસાદના પહેલાં જાપટાંના માર વડે વૃક્ષથી અણગા થવા તેયાર થઈ ગયાં હોય છે. પવન, પક્ષી કે પ્રાણી કે અન્ય કોઈ રીતે આ બીજ આસપાસ અને કવચિત્ દૂર સુધી ફેલાય છે.



અમુર ફાળ (Amur Falcon)

તાત્કાર : કો. જીવસ લેપ્ટી, રાવસારી નિરીધન માટે ખાત નં. ૧૭

An Exquisite Jewelry Mall from



Satellite, Ahmedabad



a benchmark of  
Quality, Purity & Trust!

Exclusive Showrooms across 3 floors ...

Carats & Cents

Red Diamond Jewelry

Golden Attire

Gold & Antique Ornaments

Silver Ornates

Silver articles & Fashion Jewelry